

Date of Publication 10<sup>th</sup> Posted on Every Month


₹ 20



साहित्य  
कानूनी  
समाजी प्रयोग। (अधिकारी)

# परब्र

तंत्री : वैदेश जोधी



સમાનો મન્ત્ર: (ક્રોનેટ)

સમાની પ્રપા (અથર્વવેદ)

# પરબ

સ્થાપના વર્ષ: ૧૯૬૦

વર્ષ: ૧૧

ફેબ્રુઆરી: ૨૦૧૭

અંક: ૮

## પરામર્શનસમિતિ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

પ્રમુખ

ઉત્ત્ત. ઉપાધ્યાય

પ્રકાશનમંત્રી

તંત્રી  
યોગેશ જોધી

## ગુજરાતી સાહિત્ય પરિષદ

મેધાષી જ્ઞાનપીઠ .૦૦ ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન,  
ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમ માર્ગ, નદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૮  
ફોન: ૨૬૫૮૭૮૪૭

# પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યપદ અને 'પરબ'ના લવાજમ અંગે :

૧/૧૫૭૫પરબ' દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.

૧/૧૫૭૫પરબ'ના ગ્રાહક તથા પરિષદના સભ્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.

૧/૧૫૭૫પરબ'નું વાર્ષિક લવાજમ — ૧૫૦ છે.

૧/૧૫૭૫સાહિત્યાર્થીઓ માટે 'પરબ'નું વાર્ષિક લવાજમ — ૭૫ છે. સાથે પ્રમાણપત્ર બીડવું.

૧/૧૫૭૫ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સભ્યપદના શુલ્કમાં 'પરબ'ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.

૧/૧૫૭૫પરિષદના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક — ૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક — ૩૦૦ છે. સભ્ય થવા ઈચ્છનારે પરિષદના નિયત ક્રીમાં અરજી કરવાની રહેશે.

૧/૧૫૭૫પરિષદના આજીવન સભ્યપદનું શુલ્ક — ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્ય કી — ૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)

૧/૧૫૭૫પરબ' લવાજમ તથા પરિષદ સભ્યપદ શુલ્કની રકમ મનીઓડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના નામે જ મોકલવી.

## લેખકોને :

૧/૧૫૭૫પરબ'માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.

૧/૧૫૭૫લેખકોએ પોતાનું લખાણ ફૂલ્સકેપ અથવા ૧૪ સાઈઝના કાગળની એક બાજુએ, સુવાર્ય અક્ષરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઠંનલેન્ડ કે ચબરખીઓમાં કૃતિ મોકલવી નહીં. પ્રત્યેક કૃતિ નિચે પૂરું સરનામું લખવું તથા એક નકલ પોતાની પાસે રાખીને જ કૃતિઓ મોકલવા વિનંતી.

૧/૧૫૭૫સીકૃત કૃતિની જાણ કરાશે. ટાલ-ટિકિટો ચૌંટાટેલું કવર મોકલ્યું હશે તો અસ્વીકૃત કૃતિ પરત કરવામાં આવશે, અન્યથા કૃતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતની જાણ કરાશે.

૧/૧૫૭૫ત્રયવહારનું સરનામું: તત્ત્વી, 'પરબ', ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ઘાઇમ્સ' પાછળ, નરીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

**'પરબ'** સંવર્ધક : ગુજરાત સેટ ફિલ્મલાઈઝર્સ ઓન્ડ કેમેરિકલ્સ લિ., વડોદરા

E-mail : gspamd@vsnl.net

ફોન અને ફેક્સ : ૨૬૮૮૭૮૮૭

Web-site : [www.gujaratisahityaparishad.org](http://www.gujaratisahityaparishad.org)

[www.gujaratisahityaparishad.com](http://www.gujaratisahityaparishad.com)

ISSNO250-9747 પરબ

છૂટક ક્રિ. — ૨૦-

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : ઉત્ત્પાદ્યાય (પ્રકાશનમંત્રી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૮ તત્ત્વી : યોગેશ જોશી મુદ્રાશસ્થાન : શારદા મુદ્રાશાલય, ૨૦૧, રિલક્ઝાન, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ દિનાંસ્ક્રીન્ડ ૨૦૧૭

## આ નું કે મ.

**કાચ્ય :** ત્રણ ગગળ, લલિત ન્રિવેદી 6, તપસી ઉભા ધ્યાન ધરીને...., ઊજમશી પરમાર 8, રાજ્યપાને યાદ કર્યો છે !, કિશોર જીકાદરા 8, જનકદુહિતા, પ્રફુલ્લ રાવલ 9, માયા, ઠંડુ જોશી 11, બંધ છે, ભરત વિઝુડા 12, ફંઝાં મારે છે, અરવિંદ ભડ્ક, 12

**વાર્તી :** હજુ ત્રણ બાકી...., રજનીકુમાર પંડ્યા 13, ટોપીઓ ભરતી સ્ત્રીઓ, ગિરીશ ભણ 16

**નિબંધ :** નાભિનાળ, ભગીરથ બ્રહ્મભણ 24

**કિદેશી સાહિત્ય :** જેસે સ્ટુઅર્ટ (Jesse Stuart), ભગીરથ બ્રહ્મભણ 27, ભાંગેલું ચેરી વૃક્ષ, લે. જેસી સ્ટુઅર્ટ, અનુ. મોહનલાલ પટેલ 28, આખરી પાઠ : મૂ. લે. અલફાન્સો ડોટેટ; અનુ. પુષ્ટરરાય જોષી 40

**અભ્યાસ :** અઞ્જિનુડમાં લિગેલું ગુલાબ : નારાયણ દેસાઈ, શરીર્જા વીજળીવાળા 46, ‘વળાવી બા આવી’ : અવિસ્મરણીય રચના : મનમુખ સત્ત્વા 60, ‘ઝીણ-મોજાં’થી ‘સમુદ્ર છલકે છે’ સુધીની જતરા, હર્ષ બ્રહ્મભણ 64

**પ્રકીર્ણ :** ફાર્બસ ગુજરાતી સભા ટ્રૈમાસિક દ્વારા ગુજરાતનાં દોઢસો-બસો વર્ષ ૫૨ હરખ થાય એવો દસ્તિપાત, એસ. ડી. દેસાઈ 72

**સમીક્ષા/ગ્રંથાવલોકન :** સાહિત્યરસિકનો સ્વાધ્યાય, સતીશ વ્યાસ 79

**આવરણાચિત્ર**

**સંદર્ભનોંધ :** પીયૂષ ઠક્કર 83

## કવિતા

ત્રણ ગંગલ | લખિત ત્રિવેદી

### ૧. કાયકી કાયા

વેળે વળજી કંચન કાયા... કાયકા રૂપ ને કાયકી કાયા....  
ખોલી જોયા... સબ પરછાંયા... કાયકા રૂપ ને કાયકી કાયા....  
જમબું-જૂઠનું ના પાયા... કાયકા રૂપ ને કાયકી કાયા....  
દાણે દાણે રંકા-રાયા... કાયકા રૂપ ને કાયકી કાયા....  
જેવા અંદર એવા બારા... જેવાં સમદર એવાં બારાં....  
ઘૂળમૂળ સબ એક હી ભાયા... કાયકા રૂપ ને કાયકી કાયા....  
ઉઘડી ગયા સબ કાક-કમાડાં... ગળથુથી ને ગોળનાં ગાડાં....  
જળદું ઝીલે જરિયન કાયા... કાયકા રૂપ ને કાયકી કાયા....  
ના કોઈ દીવા ના સનકારા... આપ શરીર ને આપ હી આરા....  
એકલ વ્હાયા એકલવાયા... કાયકા રૂપ ને કાયકી કાયા....  
એવો રે રાખ્યો છે રૂપિયો... જેમ તમે રાખ્યો કેદારો...  
આપજ બે તો મારીજાયા... કાયકા રૂપ ને કાયકી કાયા....

### ૨. જીવણજીને નીંદું ના'વે

હાલેડાં ગાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે,  
સરસ્વતી માઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.  
હુમ્મરિયું પાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે,  
અખ્તરી લહાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.  
જુલાવે... પીર રે જુલાવે... આલા ફીર રે જુલાવે,  
કે જીવણસાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.  
ઠારેલી બત્તીયું આવે સરમાં એને ગળબું આવે,  
કે ભામરશાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.

જૂલે એનાં ઘરનાં વાસણ જૂલે એના દંડણપદ્ધતિ,  
કે બિસ્મિલાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.

મીઠા રે ઢોલિયા થણે થઢાં રે વીંઘણાં ઢોણે,  
વહાલી વશોકાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.

ક્યાંથી એને આવે નીંદર જાવું એને ઝીઝે કુંગર,  
મીરાં તે બાઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.

અંધારાં કોણ રે ભગાડે હિંચોળી કોણ રે સુવાડે,  
ક્યાંથી એને માઈ જુલાવે જીવણજીને નીંદું ના'વે.

### 3. અહીંયાં કામ નથી

કાચાપોચાનું અહીંયાં કામ નથી,

માટીપગાનું અહીંયાં કામ નથી..

મેલ માથું ને ખાલ ખાવી કર,

કાલવાલાનું અહીંયાં કામ નથી..

શુભતા ઝળહળાવવાની છે,

કોઈ લડિયાનું અહીંયાં કામ નથી..

ઓગળી ઓગળી થવાનું ગુમ....

કાળમીઢાનું અહીંયાં કામ નથી..

બસ કે નકરો થઈને આવી જા,

માલમજાનું અહીંયાં કામ નથી..

બીજું ઉઠાવવાનું છે, મિત્રો....

અતીહિંશાનું અહીંયાં કામ નથી..

છે માથાભારેનો ઈલાકો, લવિત,

તારા જેવાનું અહીંયાં કામ નથી..

## તપસી ઊભા ધ્યાન ધરીને... | ઊજમશી પરમાર

દૂરદૂરથી આવી પડતો સાદ સકળનો કાને,  
શંખનાદ મન ધરવા કેરી નવરદી નાવે શાને ?

રસ્તાઓ લાંબાલહ થઈને પથરાયા પગ કાજે,  
સુષ્પી શકો તો ઘોષ નિરંતર દશો દિશાએ ગાજે.

મગન થવાના મેળે હાલો, વેળ્ણ વરતી વરતી,  
સુષ્પો, હવાઓ વાવે વાવડ, કોઈ અગમ પથ પરથી.

પર્વતમાળા જાણે, તપસી ઊભા ધ્યાન ધરીને,  
અડાપડાયે વાદળીઓ પણ વળજે બાથ ભરીને.

વૃક્ષોને તો સજવા કાજે ફૂલ-વેલની માળા,  
આતમને આરાધી જાવા આરતની મગમાળા.

## રાજ્યપાને યાદ કર્યો છે ! | કિશોર જીકાદરા

દેખીતો આ કેવો મેં અપરાધ કર્યો છે ?  
માણસમાંથી માણસને મેં બાદ કર્યો છે !

હું ધારું છું, મોટેભાગે નહીં આવે એ,  
ખુશાહાલીને રેમ છતાં મેં સાદ કર્યો છે !

બદનામીનું નામ તમે ના લો તો સારું,  
હું જાણું છું, કોનો મેં સંગાથ કર્યો છે !

ખુદને મેં છેકીને જોયું, એવું લાગ્યું,  
પડછાયાને નાહક મેં બરબાદ કર્યો છે !

ના જીવ્યું તો ઘરનું ઘર વેચીને અંતે,  
અફ્ફવાઓની વર્ચે મેં વસવાટ કર્યો છે !

હક્કો સંઘળા તારા છે, તું ચિંતા ના કર,  
આ ડિક્સાનો કેવળ મેં અનુવાદ કર્યો છે !

છીલલી વેળ્ણ મોં મારે જોવું એ એનું,  
રાજ્યપાને ફૂહેજો, એને યાદ કર્યો છે !

હે શબ્દસોવી !  
 હું જનકદુહિતા  
 આજે ચૌદ વર્ષે ખોલું છું મનનાં દ્વાર  
 ત્યારે બધું સામટું ઊઘડી આવે છે બહાર  
 અગ્રજઅનુરાગી સૌમિત્રની અંગમાં  
 ઉભરાતા ભાવની કષ્ણોમાં મને નહોતો  
 આવ્યો કશોય વિચાર  
 થઈ'તી માત્ર ભાવવિભોર  
 ને સ્વીકાર્યોંટો સ્વેચ્છાએ વિયોગ.  
 ને પછી ઝતુ ચોરાશી વહી  
 ન મેં મને પૂછ્યું કઈ  
 ન ઝતુઓએ કહું કઈ  
 બસ્ત એક છતિ હદદે ધરી  
 હા, કાયોરેકે પરોકે  
 સ્વભાવમાં એકાકાર થઈ'તી એ હૃદયસ્થ સાથે  
 તો ક્યારેક ગોધૂલિવેળાએ હર્ષઘેલી મેં  
 જોઈ'તી એની ધૂધળી છવિને ઊડતી ધૂળમાં  
 આભાસે પણ આયો'તો સહિયારો કેવો રમણીય !  
 ચિત્રવીથિ ખોલું અનેક વાર  
 જોઉં એનું મુખ અભિરામ.  
 હું બોલું  
 એનો તો મૌન વ્યાપાર  
 હું મૌન સાંભળું  
 સ્મૃતિરથમાં મહાલું અવિરામ.  
 ખીલતાં અને ખરતાં ફૂલો વચ્ચે,  
 પક્ષીઓના ઊડતા અને પાછા ફરતા કલરવ વચ્ચે  
 હું બસ સ્મરણથી થઈ છું સુગંગિત હરકશે  
 એટલે તો અનુભવ્યો'તો સંકૈવ મેં સૌમિત્રને સંનિકટ.



‘આપો મને અનુશ્ચા પ્રસન્નચિત્તે’  
 એ શબ્દોમાં હતો અપાર અનુનય  
 વચ્ચાં વર્ષો એ ભાવ-પ્રભાવે.  
 અનુજધર્મે ગયા સૌમિત્ર વને

આજે ચૌદ વર્ષ વીતે કાણવાર જોઉં છું મને ને  
 જોઉં છું ઉત્સવદેલી નગરીને  
 ધજાઓ ફરફરતી ચોરેચૌટે  
 બારણે બારણે સુગંધ ઝૂલે  
 વાદના મધુર નાદ નગરમાં રમે  
 વંજનોની સુવાસ મન ભરે  
 સર્વત્ર આનંદ આનંદ તરે  
 વૃક્ષ વૃક્ષ વચ્ચે ચાલતી ગોળિ  
 પક્ષીઓની વાચાળ ચુણિ  
 આજ કાગના સ્વરમાં ઊઘડે મીઠાશ  
 કોકિલ પાથરે અપૂર્વ સ્વરંજાસ.  
 ત્યારે થાય છે : 'હું ક્યાં ?'



'તમે શિષ્ટ છો તો વિશિષ્ટ પણ છો જ તમે  
 વિશ્વમાં તમે તો છો અદ્વિતીય  
 ભલે, આદિકવિ રહ્યા રામમાં રમમાણ  
 તુલસીચિત્રે ન વસ્તું તમારું ગાન  
 તોય  
 કાળમાં કોણ ભૂલશો તમારું નામ ?  
 રહી શકશો તમે સ્થિતપ્રકા સમજથી  
 ક્યાં લલચાયાં છો કોઈ સુવર્ણમૃગથી ?'



માંડી મીટ જનકદુહિતાએ આકાશે  
 ચાલ્યો સંવાદ લીતરે  
 ખૂલી ગઈ સામટી બધી બારી  
 ખોલી જાતને જાતમાં  
 બહારનો કોલાહલ રહ્યો બહાર  
 અંદર તો ઊંઘ્યો અજવાસ.  
 ન....  
 ત્યાં બારણે ટકોરા પડ્યા પાંચ  
 છૂટ્યા સૌ મનના બંધ  
 ખોલીને જોઉં તો  
 ચોગાણી ઋતુનો ભાવ અંખમાં ભરીને  
 ઊભા છે સૌમિત્ર પ્રસન્ન મુજે અકંધ.

## માયા | ઇન્ડુ જોશી

ખેતરની ખેડેલી ભેજવાળી માટીમાં  
મારા શરીરની લંબાઈનો ખાડો કરી,  
અંદર ઉત્તરી,  
સૂઈ જાઉ ને  
માટી પાથરી દઉં મારા આખા શરીરે  
ને પછી  
સૂંધ્યા કરું તેને.  
સૂંધતાં સૂંધતાં વિચાર તો  
માટીના જ.  
કેટલી તો પોતીકી ને  
સાવ પાસે મારી.  
જાણો હું જ તે –  
તેની જેમ પથરાયેલી બધી.  
ધીરે ધીરે દબાતી દબાતી  
છેક ઉડે,  
જમીન ખોદતાં જ્યાં જળ મળે  
તેવી જગ્યાએ  
પહોંચતી તરતી –  
જ્યાં જળ લઈ જાય ત્યાં  
ને પછી પુષ્ટ જળ બધી જ,  
આજુભાજુ  
ને પછી તણાવાને બદલે  
ઉંડાણ તરફ ખેંચતી હોઉં  
છેક ઉડે ઉડે  
દરિયાના પેટણ તરફ.  
પેટણની સપાટી અડકું  
ખોઢું તેની માટી  
મારા શરીરની લંબાઈ જેટલી  
ને સૂઈ જઈ  
માટી મારી ઉપર નાખી,  
મારા શરીરને ઢાંકી,  
સૂંધ્યા કરું ફરી તેને,  
માટીને.

## બંધ છે | ભરત વિજુડા

દ્રેન આવે છે ને કષ્ટક બંધ છે,  
કયાં સમયનું તોય લોલક બંધ છે !

હોય છે ખુલ્લા તે બીજા કારણે,  
દ્વાર મારા માટે બેશક બંધ છે !

આ સમય થંભી જવા જેવું ન કર,  
આવ, તારું કેમ ટક ટક બંધ છે ?

જળ સરોવરનું સુકાતું જાય છે,  
ને નવા પાણીની આવક બંધ છે !

મનમાં આવે તે જ બોલી નાંખવા  
—નું મન થયું છે, આજ નાટક બંધ છે !

જવતો છું એનું કારણ જવ છે,  
અંગમાં એક અંગરક્ષક બંધ છે !

## ફંઝાં મારે છે | અરવિંદ ભણ

અંધારે અંધારે ફંઝાં મારે છે,  
પોતાના સથવારે ફંઝાં મારે છે.

લોહી ચીંચીચીંચીને જેણે બાંધ્યુંતું,  
એ લોકો ઘરબા'રે ફંઝાં મારે છે.

સુંધ ઉપર ભાખાનું મહું લઈ કવિ,  
ગરવા ગઢ જિરનારે ફંઝાં મારે છે.

યાઢી વાયા પઢી એકલો ઊભો છે,  
અંગારે અંગારે ફંઝાં મારે છે.

પોતાનું સરનામું જિરસામાં લઈને,  
નગરી દ્વારે દ્વારે ફંઝાં મારે છે.

## હજુ ત્રણ બાકી....

### ■ ૨જનીકુમાર પંડ્યા ■

“નજમઅલી શેઠ !”

“કેમ દાક્તર નજુ શેઠને બદલે આખું નામ વળી ‘શેઠ’ સોટું બોલ્યો ? કેમ ?”  
નજુ શેઠના દિમાગમાં એના ચારપાંચ જવાબ જબકી ગયા. જે સાચા પડે એવા ન  
મળે. પણ એક એવો નિકળ્યો જે સાચો હોય અને હતો જ. તે એ કે આજે દુખતો  
નથી તોય દાંત પડાવવા આવ્યા છીએ. કાં તો મારું મગજ અને ચસકી ગયેલું લાગે  
છે અને કાં તો બીજા કરતાં નજુશેઠ બમહી ફી આપવાની ટેવવાળો છે એટલે.  
હા, યાર, થોડું પોદ્ધન તો લગાવવું પડે ને ! એટલે ‘શેઠ’ ઉમેરી દીધું દાક્તરે મારે  
બેટે !

“નજમઅલી શેઠ, આપના દાંત તો નોર્મલ લાગે છે !”

“તમને લાગતા હશે ડોક્ટર, પણ એમાંથી એક દાંત તો મને રાતે બહુ કરે  
છે. કાલે તો આખી રાત ઊંઘ જ ના આવી. પડખાં જ ઘસ્યાં..”

“ઓ કે, દરદની બાબતમાં દર્દી સાચો. દવાની બાબતમાં ડાક્તર સાચો.”

“બસ, તો મહેરભાન, પાડી આપો.”

ડોક્ટરે ખાસ ચેરમાં બેસાર્યા, મોં ખોલાવું. ઓહો, તમાકુને કારણો કેટલા કથ્થાઈ  
થઈ ગયા છે ? અને આ શું ? બત્તીસીમાં ચાર દાંત તો સોનાના ! રંગ તો એની  
પરેય ચડી ગયો છે પણ સોનું તે સોનું જ, જળક્યા વગર રહે નહિ !

વિચાર આવી ગયો. હોય બૈ, હોય, એક જમાનામાં આ શેઠિયાને દોમ દોમ  
સાથબી હતી તે દાંત શું નખ બી સોનાના હોય ! કમાતોય એટલું અને વૃંટાવતોય  
ધૂમ ! માંગણોનાં ટોળાં અંગણો ટિચાતાં જ હોય. સિલોનમાં ચાના બગીચા હતા, બચત  
કરવાની આ એક રીત છે. જતા-આવતા આ તરફના કે તે તરફના ચેકપોસ્ટ પર  
મોટી મોટી બેંગોથી માંડીને નાની નાની પાકેટી કસ્ટમવાળા ફંડીસે પણ મોઢું થોડું  
ઉઘડાવે ? કટ મૂછો નીચે આવેલા બીડેલા હોઠ તો એ વખતે મરક મરક થતા હોય !

“લો. આનાથી કોગળા કરો.” ડોક્ટરે કહ્યું : “જુઓ, બાજુમાં પોટ છે.”

નજુશેઠ બાજુમાં મોં કરીને કોગળા કર્યા પછી નેચિનથી હોઠ લૂધીને કહ્યું,

“કેટલી વાર લાગશે ?”

“કેમ બહુ ઉત્તવળ છે ?”

“ઘેર કોઈ મારી વાટ જુઓ છે.”

“લે ! તે તમે ઘેર કોઈને વાટ જોતું રાખીને અહીં દાંત પડાવવા આવ્યા ?”

“અસે,” નજ્જુશેઠ ડાબા ગાલે હાથ દીધો : “કુમેય રહેવાતું નહોતું.”

આ ઉમરના, મતલબ કે સિટેર-પંચોતેર વટી ગયેલા દર્દીઓની આ ખાસિયત હોય છે – ડોક્ટરને મનોમન રમુજ થતી હતી, રમકડા જેવો થઈ જતો હોય છે માણસ ઉમરના આ મુકામે. બાળકને જેમ જરાક અમસ્તું વાગે ત્યાં ‘‘એ... એ... એ...’’ કરતું મા પાસે દોડચું આવે તેમ આ નજ્જુશેઠ પણ. આંગળી પર જરાક અમસ્તી ટંકણી ઘોંચાય ત્યાં તો પાટો બાંધી ને ત્રણ દિવસ સુધી ખોલે નહિ. ટીક છે. ઉમરના જેલ છે. છોકરાઓ સિલોન છે. બીબી બહુ ઘારી હતી. ત્રણ વરસ પહેલાં ખુદાને ઘારી થઈ ગઈ. હવે આ અબ્બો અહીં એકલો રહે અને આપો દહાડો જુનવાડી સ્પીકર પર કાપડની જળીવાળો રેડિયો સાંભળ્યા કરે. સિલોન રેડિયો મૂકે ત્યારે તો સિકલ લાપસી ખાતી થઈ જાય. “મારા સૈફુનું ઘર” એ અનેક વાર ડોક્ટરને કહેતા : “સૈફુનું ઘર આ સિલોન રેડિયો-સ્ટેશનથી પાંચ જ મિનિટ ! પણ જો જો ખૂબી, એ મારો બટો અહીંનું આપણું વિવિધભારતી મૂકે !”

“તમેય સિલોન રહેતા હો તો !”

નજ્જુશેઠ શરમાઈ ગયા... “તો તો જો ત્યાં પકડાતું હોય તો આકાશવાણી રાજકોટ જ સાંભળ્યું.”

બીજા આગલા દર્દીઓને પત્તાવીને ડોક્ટર નજ્જુશેઠ પાસે આવ્યા. ફરી મોં ખોલાયું, નજ્જુશેઠ સિસકારા બોલાવીને ઉપરનો સોનાના કવરવાળો એક દાંત આંગળી મૂકીને બતાવ્યો, સોજો-બોજો કંઈ હતું નહિ બસ જરીતરી હલતો હતો, પાડી નામવા જેવું કંઈ હતું નહિ પણ જીદ કરતા હતા એટલે દવા મૂકીને ત્રણ મિનિટમાં પાડી આપ્યો. અને ત્યાં રૂનું પૂમહું મૂકી દીધું. આસિસ્ટન્ટ પાસે ધોવડાવીને એક પડીકીમાં મૂકીને નજ્જુશેઠના હાથમાં મૂક્યો.

બંધ મોં હતું છતાં નજ્જુશેઠ અસ્પષ્ટ સ્વરે બોલ્યા : “જી પછી મોકલી આપું છું, અત્યારે જાઉ, કયાંક પેલો થાકીને જતો ના રહે !”

કોણ હશે એ “પેલો” આટલો ઇમ્પોર્ટ માણસ ? ડોક્ટરને સવાલ પૂછવાનો પણ સમય ના રહ્યો, નજ્જુશેઠ પગથિયાં ઊતરી ગયા.

દવાખાનેથી ઘર બહુ દૂર નહીં, પણ આજે કામ સબબ બજારમાંથી નીકળવાનું છે. હાસ્તો વળી, સોનીની દુકાને જવું બહુ જરૂરી, મૂળ કામ તો એ જ.

સોની મહાજન જ્યેશ માણેકલાલ સ્વદાસની દુકાને જ જઈએ. બહુ પ્રામાણિક સોની, ગામ કરતાં બે રૂપિયા વધારે આપશે, ઓછા નહીં. કિસ્મતથી દુકાન ખૂલી જ હતી. ભારે ચીવટથી જ્યેશ સોનાના માલનો તોલ કર્યો, હિસાબ કર્યો અને કડકડતી નોટો ગણી આપી, પણ પૂછ્યું તો ખરું જ : ‘‘કેમ નજ્જુચ્યાચા, કાંઈ બોલતા નથી ??’’

જવાબમાં હવે થોડું બોલી શકાયું : “દાંત પડાવ્યો છે, દીકરા !”

“આઈસકીમ ખાઈને જાઓ,” જ્યેશે કહ્યું : “બહુ સારું લગાશો.”

“નહિ, નહિ, મને બહુ ઉત્તાવળ છે, ઘેર કોઈક રાહ જુએ છે.”

ઘેર પહોંચા ત્યા બહુ હાશકારો થયો. ના, ના, રાહ જોનાર ઉંબરો છાંટી ગયો નહોતો, છ વરસના ચીંથરેહાલ છોકરા સાથે નાનકડા ઝ્રોંઠિગરુમના બારણા પાસે જ બેઠો હતો.

એ રૂમમાં દાખલ થયા. સોક્ષા પર જરી પાછળ વધુ ટેકો દઈને બેઠા, ગજવામાંથી જ્યેશે આપેલો નોટોનો નાનકડો ચોડો કાઢયો. પેલાને નજ્જક બોલાવ્યો. એને બિચારાને હાથ લંબાવવાની સુધ પણ ના રહી. નજ્જુશેઠે એનો હાથ પકડ્યો. એની હથેળી ખોલી અને ચોડો એમાં મૂક્યો.

ગાલની અંદર સહેજ સણકો આવ્યો, છતાં એના પર હાથ દાખીને બોલ્યા : “આટલામાં તારી ઘરવાળીનું ઓપરેશન થઈ રહેશે ન ?”

એ તાજજુબ થઈને જોઈ રહ્યો. નજ્જુશેઠે કહ્યું : “ઘટે તો કહેજે.” વળી હળવેથી કહ્યું : “ફીકર મા કરજે, હજુ ત્રણ દાંત બાકી છે.”



# ટોપીઓ ભરતી સ્ત્રીઓ

## ■ ગિરીશ ભણ ■

મૂળ નામ તો લક્ષ્મી પણ એમાંથી લખમી થઈ જતાં શી વાર ? પચીસની જેબનવંતી ઉમર... દેખાવડી, જગ્રા અલ્લડ ને વાચાળ અઢારે પરણી હતી રસિકને. સામેની ડેલીવાળી મોંઘીએ તેને પોંખી હતી, યંચકા ફોડતા દુખણાં લીધાં હતાં. ને લટકાના આશીર્વાદ પણ આપ્યા હતા : ‘જલદી જલદી દીકરાની મા થા.’

ને તે ખીખીખીખી હસી પડી હતી.

મોં પણ કાયમ મરકલું હોય, ને પગમાં ઝાંઝર.

આખો ખાંચો મેરાઈ-પા તરીકે ઓળખાય. દસ ઘર આમ ને દસ ઘર સામાં. ફળતાં દેશી નિયાંવાળાં છાપરંઓ ને આગળ જાળીવાળાં જૂનાં મકાનો.

એક લક્ષ્મીના ઘરને પાકા વિલાયતી નિયાં, ઓટલો, ચાર પગથિયાં ને રંગિન બારણું, બારીઓ પર પરદાઓ પણ ખરાં. અને અંદરનો સરરસામાન પણ અલગ. પોચી પોચી પથારીવાળો મોટો પલંગ, અરીસાવાળું કબાટ અને ટેબલ પર, મુંબઈથી રસિકે આણેલું ગ્રામોઝીન. લક્ષ્મી જાળવીને ખોલે, રજ સાફ કરે, રૂપેરી હેન્ડલમાં પિન ભરાવે, કબાટમાંથી રેકડ કાઢે, સારીના પાલવથી સાફ કરે.

દર્શકો મુંઘ બનીને જોયા કરે. એ જ ઘરોનાં છોકરાં છાબરાં હોય. ક્યારેક એકાદ સમવયસ્કા પણ હોય. લક્ષ્મી એકાદ મિનિટમાં ગ્રામોઝીનને વાગતું કરી દે. ને ગીત સંભળાવા લાગે : ‘જીવન તી નાવ ના ઠોલે; હા, એ તો તેરે હવાલે.’

આવતી-જતી સ્ત્રીઓના કાન સરવા થઈ જાય, મોં મલકી ઊઠે.

ને કોઈને વિચાર આવી જાય : ‘માણીને જલસાં છે. ધ્યાણી મુંબઈમાં ફૂટપાથ પર કૂટાતો હશે ને આને...’

રેકડ તો એક જ હતી. પાંચ ગાળાં એક તરફ ને પાંચી બીજી તરફ. એકાદ સ્થાને પિન અટવાતી હતી. ને પછી ઘરર થાય એની રમૂજ. સહુને ખૂબ જ રસ પડે.

વીસેય ઘરોમાં આદમીઓ મુંબઈમાં. અહીં તો બૈરાઓ છૈયાઓ ને વૃદ્ધો. આવે અષાઢ, શ્રાવણમાં. શ્રાદ્ધ ઉત્તરતાં એક પછી એક, મુંબઈની વાટ પૂકડે.

આદમીઓ આવે ત્યારે ખાંચાની રોનક વધી જાય. અવરજવરો વધી. કોલાહલ વધી.

વાતાંમાં મુંબઈ હોય. શી રોનક મુંબઈની ? જળાંહળાં ! ભીડવાળા રસ્તાની બેય

તરફ ઊંચાં મકાનોની બારીઓ દેખાય. એમાં માશસો પણ હોય.

ને આકાશ તો ભાગે જ ભળાય. અહીં બીજના ચન્દમાનાં દર્શન કરીએ ને ?  
ત્યાં તો એવું કશું જ ને. કોઈને યાઈમ જ ક્યાં હોય ઉપર જોવાનો ?

ને અવાજે પાર વિનાના. કેટલી ભીડ ? ને રેલવાઈં...?

અને ફેશનેબલ બૈરાંઓ ! કેવાં કપડાં પે'રે ? અમે જ સીવી આપીએ.

દર ચોમાસે વર્ષનો બદલાય. ક્યારેક મોહમયી નગરી તો ક્યારેક દોજબ છે  
દોજબ - એવી ઉપમાઓ સરી પડે. વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ અભિવ્યક્તિઓ.  
સ્ત્રીઓ ઉપરતણે થયા કરે.

કેટલું વહાલ ઊપજે એ દિવસોમાં ? મેરાઈપા સમૂહણું બદલાઈ જાય. ઘરમાં  
નસકોરાં, બરાઢા, હર્ષનાદો, ચીડો, પ્રેમ - એ બધું જ ઠલવાયા કરે.

આખો વિસ્તાર જાણો કે પૌરુષી અસર નીચે સંમોહિત થઈ જાય !

અમસરો ક્યાં એકેય ખોંખારોય નીકળતો હોય ?

વીસેય સ્ત્રીઓને ભાન કે આ પુરુષો મુંબઈમાં શું કરતા હતા. ફૂટપાથ પર...  
બે દુકાનો વચ્ચેની જગામાં તેમાંનાં સિલાઈ મશીન, ટેબલ ગોઠવાય. બસ, એ જ સ્થાન  
જ્યાં ગ્રાહકો આવે, માપનાં વસ્ત્રો અપાય, સૂચનાઓ અપાય, વસ્ત્રો સિવાઈ જાય  
ને ગ્રાહકો પાસેથી યથાતથા પૈસા લઈને વિદાય કરાય. આ જ આજીવિકાપ્રાપ્તિનું સ્થાન.  
વીસેય સંચાઓ હારમાં પડ્યા હોય. બીજાઓ પણ હોય - વાળ કાપવાવાળા, માલિસ  
કરવાવાળા, સૂરમો વેચનારાઓ, વેણીઓ વેચનારાઓ.

દુકાનવાળાઓ સાથે ગોઠવણા. રાતે સંચાઓ એ દુકાનના સામાન વચ્ચે ક્યાંય  
મેલી દેવાય.

ને આ વીસેય આસપાસની ફાવતી સસ્તી લોજ-વીશીઓમાં જમી લે.

રાતે... બેચાર ખોલીઓમાં આડાંઅવળાં ગોઠવાઈને નીંદર તાણી લે. પ્રારંભમાં  
મુશ્કેલીઓ પડી જ હતી. મેરાઈપાનાં ઘરો, પત્નીઓ, સુખો - યાદ આવી જતાં હતાં.  
પણ શું હતું ? પૈસા અહીં હતાં. સાંજે સો-બસો નો વકરો સહેજેય થતો હતો. આવું  
ક્યાં હતું મેરાઈપામાં ? રોજનું એકાદ કપડું માંડ સીવવાનું હોય. ને એમાં પાછી ઉધારી  
પણ હોય.

બસ... વળગી રવ્યા મહાગાંઠની જેમ. ધીમે ધીમે શહેર ગમવા લાગ્યું હતું. ખોલી  
જેવી ઓરડીમાં સરસ ઊંઘ આવી જતી હતી. વસ્ત્રો... સીવી સીવીને થાંભલા જેવા  
થયેલા પગોની વેદના ભૂલી જવાતી હતી. વીશીની જાડી રોટલીઓ પટ કરતી ગળે  
ઉંતરી જતી હતી.

દર મહિને... મનીઓર્ડરો થઈ જાય ટપોટપ. વચ્ચે એકબે પોસ્ટકર્ડ પણ લખાઈ

જાય. ઘડીભર ઘર ડોકાઈ જાય ભીની આંખોમાં, પણ બીજી પળે ગ્રાહક ઊભી હોય સામે. સ્ત્રીઓનાં વસ્ત્રો જ સીરે. બ્લાઉઝ, ધારારાં, ફોક એવું.

એકલદોકલ સન્ની ભાગ્યે જ આવે. જે આવે એ ત્રણચારના ટોળામાં. બેને સિવડાવવું હોય - એ મૂંગી હોય, અને જેને ના સિવડાવવું હોય એ જ બોલ્યા કરે.

અર્ધુ મરાઈ, અર્ધુ છિન્દી. ને આ લોક પણ ગુજરાતી સહિત ત્રણેય ભાષાઓના પ્રયોગ કરે.

બે વાર નકો નકો થાય એ પછી માપ નક્કી થાય. રોડની સામેની વસ્તીમાંથી ગ્રાહકો આવે. મોટા ભાગની શ્યામ સ્ત્રીઓ. કોઈ વળી ઊજળી પણ હોય. પહેલાં લજજા અનુભવે ને પછી સતત બોલ્યા કરે.

વીસેયના ધંધા સરસ ચાલતા હતા. રસિકે... કાનજીને કંધું હતું : ‘બધુંય બૈરાંઓને ના કેવું. શું સમજ્યો ?

(૨)

મેરાઈપાના ખાંચામાં આદમીઓ સિવાય, બારેમાસ આવતા બે પુરુષો હતા. એક હુસેન ટપાવી ને બીજો કાન્તિ ટોપીવાળો. બધી સ્ત્રીઓ રાહ જોતી બેઠી હોય.

હુસેન ખાંચામાં પ્રવેશતાવેંત જ સાદ પાડે : ‘આવો જીવીબોન, કશીબોન, લક્ષ્મીબોન, રસીલા, રમાબોન....! એય આવો ડેલીએ.’

ને એ સહુ દોડતી દોડતી ચહેરા પર હરખ સાથે ડેલીએ આવે. ડાબા હથનો અંગૂઠો સળવળ થતો હોય, આંખો સામે પતિ દેખાતો હોય. કેટલીકને વાંચતા આવડતું હતું.

કાગળ, મનીઓર્ડરો અપાય. નોટેના થોકડા નીકળે ખાખી ખીચામાંથી. પેડ પર અંગૂઠા મુકાય. દરમિયાન એકાઈ પાણીને જ્વાસેય ખરી લાવે હુસેન માટે. પૈસા.... ગણાય ને બ્લાઉઝમાં મેલાય, પત્ર હોય તો છાને ખૂણો વંચાય.

સહુથી તગું મનીઓર્ડર લક્ષ્મીને મળે. બીજીઓ નવાઈમાં દૂબી જાય : ‘હું આટલા પૈસા ? રસિકનૈ બહુ કમાતા હશે ? આમ તો બધાંય સાથે જ સીરે છે. સામેની ગલીઓમાંથી આવતી સ્ત્રીઓ વસ્ત્રો સીવતી હતી ! તો કેમ આમ ?’

શંકાયે જતી કે તેમના ધણીઓ ઓછું મોકલતા તો નહીં હોય ને ? રસિક જૈને આટલા ધુબાકા કેમ ? લક્ષ્મી હથમાં નોટો રાખીને બે વાર ગણે. દરમિયાન હસ્યા કરે.

બીજીઓ નિસાસા નાખ્યા કરે. અરે, હુસેન પણ તેનાં લટકાં નિહાળ્યાં કરે.

ક્યારેક તે બોલે પણ ખરી : ‘હુસનભૈ, શું જોવો છો ? મને.... ? કે પછી મારા પોલકાને ? મારા વરે સીયું છે. મુંબઈની ફેશનવાળું. ખબર છે, લાઈનું લાગે છે મારા

વર પાસે સ્ત્રીઓની.

રસીલાને થોડો જવાબ મળ્યો પણ ખરો – આ તગડા મનીઓર્ડરોનો. તો શું તેનો પતિ દેશી બ્લાઉઝો સીવતો હો ?

રસિકનૈ હોશિયાર તો ખરા. હા, લખમી કેવા ફેશનવાળા બ્લાઉઝ પે'રે છે ? ક્યારેક તો સાવ ઉઘાડી જ દેખાતી હતી. હુસેન ને કાન્નિબૈ તો આવે છે ને ? શરમ ને આવતી હોય ?

સમૃહમાં પણ આવો વિષય ચર્ચાઈ જાય. કેટલાં વિશેષજ્ઞો વપરાય લખમી માટે ? સાવ નશરમી ! વેતા બળી !

(૩)

મેરાઈ-પામાં સતત પ્રવેશ કરતો બીજો પુરુષ – કાન્નિબૈ. દર રવિવારે સાઈકલ ચલાવતો આવે.

બે મોટા થેલાઓમાં પુરુષોએ પહેરવાની ટોપીઓ હોય, રંગીન ભરત ભરવાની કોકિલીઓ હોય. અને ખીસામાં એક, બે, પાંચ, દસની નોટોની થપ્પીઓ હોય.

લખમી સિવાયની બધી જ સ્ત્રીઓ ટોપીઓ પરનું ભરતકામ કરે. દર રવિવારે જૂની – ભરત ભરાયેલી ટોપીઓ અપાય ને બીજી નવીઓ લેવાય.

કાન્નિબૈ બધી જ ટોપીઓ પર નજર ફેરવી લે, સંતોષ વ્યક્ત કરે, ગણે અને ડિસાબ કરે.

બધું નોટમાં લખાય.

મેરાઈપાની સ્ત્રીઓ ખુશ ખુશ થઈ જાય. વરના પૈસા આવતા હોય પરંતુ આ તો આપકમાઈના. એનો આનંદ જ નોખો હોય. દિવાળી કેડ એના સંધરામાંથી એકાદી જણસ ખરીદાય.

કાન્નિ સાથે ઘરોબો. ક્યારેક અંગત વાતો, વસવસા તેની પાસે ઠલવાઈ જાય, વિનોદેય થાય. પેલો સાંત્વનાઓ પણ આપે.

તેના માથા પર પણ આવી જ ભરત ભરેલી ટોપી. પણ જરા મેલી, આકાર વિનાની, જ્ઞાણી.

કોઈ સ્ત્રી મજાક કરે : ‘ટોપીવાળા થૈને આવી જૂની ટોપી કેમ પે'રો છો, કાન્નિબૈ ?’

ને તે જવાબ દે : ‘કેમ નથી વરતાતો આ ટોપીમાં ?’

એક લક્ષ્મી જ ટોપીઓ ના ભરે. ફેશનવાળાં વસ્ત્રો પહેરે, રેકર્ડ વગાડે, ક્યારેક નાચે.

કાન્નિ પાસેથી પસાર થાય ત્યારે ઉપાલંભભર્યું મોં મચકોડે.

(૪)

મેરાઈપાની સ્ત્રીઓના હાથમાં સોઈ-દોરા ને ટોપીઓ જ હોય. જ્યારે સમય મળે ને જીવ ટોપીમાં જાય, તરત પરોણી લેતીક.... ભરત ભરવા લાવે. ટેરવાં પર લોહીના ગંમા પણ પડે. હસીને.... ટેરવું દબાવી દે પાલવ સાથે. ક્યારેક તો પરસેવો ને લોહી ભેગાં પણ થઈ જાય. મૂળ ટોપી પર કશું ચોંટી ના જવું જોઈએ, ભરત સીધી લીટીમાં ધારની સમાંતરે ભરાવું જોઈએ.

કાન્નિભૈ.... કશું ના ચલાવે.

આખો દિવસ ને અરધી રાત ટોપીમાં જ પસાર થઈ જાય.

ને રસીલા કહેતી હતી : ‘એય આખો જલમારો આ ટોપીયું પાછળ જ જવાનો. આપણને બીજું કાંઈ દેખાવાનું જ ને. હસતાંય ટોપી ને રોતાંય ટોપી.

બીજી સહમત થઈ જતી : ‘બીજું આવકે છેય શું ? કાન્નિભૈની રાહ જોવાની, હુસેનનીયે જોવાની ને આપડા ધાડીઓનીયે જોવાની.

કાશી તરત જ કહે : ‘ધાડીઓ પણ આપડી વાટચું જ જોતા હોય ! કેવા અકરાંતિયા થઈને ઝાંબતા હોય છે આપડા પર ?’

ને સમૂહમાં હસાહસી થઈ જતી.

જીવી પાછી ટોપીઓ પર આવી જતી : ‘ને આપડા હાથો ત્યારેય ટોપીઓ ભરતાં હોય એમ હાલ્યા કરે. સખણાં નો રહે !’

‘અરે, મરશું ત્યારેય હાથો તો એમ જ હાલતા રેવાના. કેટલાં વરસોથી ટોપીઓ ભરીએ છીએ ? ને ધૂટવાનું થોડું છે ? મૌંદીમા પણ આટલાં વરસેય ભરે છે ને ? નજર નબળી છે પણ હાથ તો સરસ હાલે છે. ને આપદું પણ એમ જ ચાલવાનું.’

ને શાન્તિએ નવી દિશા તાકી હતી : ‘આપડી ટોપીઓ કેટલા આદમીના માથે ઢંકાઈ હશે ?’

રસીલાએ અવલોકનની વાત કહી હતી : ‘કાશીબુન, હવે કેટલાંક આદમી ઉઘાડમથાય ફરે છે.’

ને શાંતિ પ્રસરી ગઈ હતી પરસાળમાં.

(૫)

શ્રાદ્ધ પક્ષ પછી મેરાઈપાના પતિઓ, એક પછી એક મુંબઈ જવા લાગે. ઉદાસી જવાઈ જાય. છેલ્લી રાતે સ્ત્રીઓ રડચા કરે, પતિસેવા કર્યા કરે. સાંત્વનાઓ, સૂચનાઓ અને ચરણસેવા..

‘અરેરે, ત્યાં તો આખો દિવસ મશીન ચલાવવાનું ? પગે ગોટલા ચડે તો ત્યાં કોણ તમારું ?’

પગ દબાવતાં દબાવતાં ચિંતાઓ વક્ત થાય. શ્રાદ્ધ પક્ષ પછી મેરાઈપામાં કાગડાઓ પણ ના હુંકે. પત્રો આવે, મનીઓર્ડરો આવે, સાથે મળીને વિલાપો થાય. હુસેનના ફેરા વધી જાય.

પાછું ધીમે ધીમે બધું પૂર્વવત્તુ બની જાય. એક બીજી વાત પણ લગભગ બને. એકાં સ્ત્રી અચૂક ગર્ભવતી બની હોય.

આ વખતે રસીલા હતી. ત્રણ વર્ષની ટેણકી તો હતી ને આ નવું પગરણ થયું હતું. ચિંતા એકલી રસીલાને નહોતી. આખા મેરાઈપાને હતી. પુત્રી આવે તો ? બે થાય ! તો બે માંડવા ! તો શું થાય રસીલાનું ? પણ પુત્ર મળે તો, મેળ પડી જાય ! પણ આ કાંઈ રસીલાના હાથની વાત નહોતી. ને પીડા હતી એ જ.

ને એની ચર્ચા ઘરે ઘરે. એક લક્ષ્મી જ અપવાદરૂપ. વગાડ્યા કરે વાજું. ઠાઠથી હરેફરે.

પૃથ્વીય કરે રસીલાની : ‘એમ...? તબિયત સારી છે ને ? આવું જ બને છે દર વરસે; ખરું ને ?’

ને તેની ચર્ચા શરૂ થઈ જાય.

‘કેવી... પૂછપૂછ કરે છે ? છે તેને કશુય ? પરણ્યે કેટલાં થાં ? મૌખીએ પૌંખીંતી તેને. શું હશે ? રાતી રાણની ફરે છે. રસિકો મનીઓર્ડરો મોકલે ને આ તનકારા કરે.’

‘કાશી, મખમલની તો પથારી છે ! જમીણકી જોઈ આવી છે. રૂપાળો છત્રીપલંગ છે.’ બીજી ટકોર કરતી.

‘હશે... લાખમીમાં જ ખોટકો !’ બીજી પૂરું કરતી.

તે એ સમયે જ કાશીના વરનો પત્ર આવ્યો હતો. પોસ્ટકાર્ડમાં કીરીના ટાંગા જેવા અક્ષરોમાં રસિક વિશેની આખી કથા ટૂંકમાં આવેખી હતી. રસિકો આડ રસે ચડી ગયો હતો. તેની પાસે એક મોટરવાળી આવતીંતી. ગોરી પારસ્શાણ. રસિકોય રૂપાળો ને ? કપડાં સિવડાવવા આવતીંતી ને લહુ થઈ ગૈ. રસિક પર. રસિકેય ઓળઘોળ. સંચો મેલાને મોટરમાં બેસી જાય, છેક સાંજે પાછો આવે. ક્યારેક તો... છેક રાતે આવે. અમારે તેનો સામાન સંભાળવો પડે.’

કાશીએ એક પોસ્ટકાર્ડ તો વાંચીને ઝાડી નાખ્યું હતું પરંતુ જમનાએ તેના વરનું પોસ્ટકાર્ડ લક્ષ્મીને જ હાથોખથ આપ્યું હતું.

મેરાઈપામાં હાહાકાર મચી ગયો હતો. પછીનાં દશ્યોમાં લક્ષ્મી વરચે રડમસ ચહેરે ઊભી હોય ને આખું ટોળું જાતજાતનાં સાંત્વનાં આપતું હોય.

ખાનગી બેઠકોમાં લક્ષ્મી પ્રતિ નિંદારસ ઢોળાતો.

‘એ જ લાગની હતી લખમી.’

‘હવે વગડ ગાણાં. ને નાચ આજા ઓરડામાં.’

‘રસિકનૈ કાંઈ અમથા અમથા આ મારગે જ્યા હશે ?’

‘આપડા ધણીઓયે મુંબઠીમાં જ છે ને ? છે એકેય એબ....? ને તો બૈશવ આવતા હોય ને પોલકાં સિવડાવવા ? એમાં રૂપાળીઓ પણ હોય ને ?

(૬)

ને સમાચાર મળ્યા કે લક્ષ્મી, હુસેન લાવતો હતો એ તગડાં મનીઓર્ડરો પાછાં મોકલતી હતી, આમોક્ષેન વાજું વેચવા કાઢ્યું હતું, ઝાંઝાં રમણીક સોનીને ત્યાં ગીરવે મેલ્યાં હતાં.

‘મરશો, એનાં કરમ.’ મોંઘીએ સમાધાન શોધ્યું હતું.

‘ચે ઈ પડે.’ શાન્તિએ કહેવત ટંકી હતી.

‘કેટલું ગુમાન હતું ? આપડે ટોપીઓ ભરીએ ને તે હસતી’તી !’

કાશીએ સમાપન કર્યું હતું.

ને બધી સ્ત્રીઓએ માથાં હલાવી અનુમોદન આપ્યું હતું.

‘મૂકો લખમીની વાતમાં પૂળો.’ એ વાક્યથી સમાપન થયું હતું.

ને એ પછી એ સ્ત્રીઓ ગર્ભવતી રસીલા ભડી વળી ગઈ હતી. ઐ, તેનુંય પાધરું કરવું હોય - કામ પાર પાડે. આંદું હોય કે ગર્ભિણી કહૃતાતી હોય, હલીમા હસતી હોય. ફૂલ જરે એવું બોલતી હોય. હાથની કરામત. તેને જશ રેખા છે. મેરાઈપાની બધી જ સુવાવડો હલીમાએ કરી છે. હા, ઈ પેલા.... સમુ આવતી’તી. ભલી બચારી. જે આપો ઈ હસીને લે લેતો !

રસીલાને પાંચમો જતો હતો.

શું કરાય અયણો ? બખર્ય છે ને ? છસરડા નો કરતી. હજ્યે ટોપીઓ ભરે છે ? વરના મનીઓર્ડર આવે છે ને ? અને પોસ્ટકાર્ડ ? હલીમા ક્યારે આવી’તી ? શું કીધું એજો ?

ઇછ્છી ચાલે છે. આમ તો સુવાણ છે. મનીઓર્ડરમાં વધારે આયવા ? મોકલે જ ને ? કાંઈ ઉપકાર કરે છે ? આપડે વેદીએ તો ઈ એટલું તો કરે ને ? મૂક હેવ ટોપીઓની પડ્ય. નો લેવી આ રવિવારે. ઈ તો આવશે ટોપી પે’રવાવાળો. ભગવાનનું રટણ કરેશ ને ?

હવે જ કાળજી રાખવાની. આ તો સાતમો કોઠો. નથી બોલાવવો વરને. આપડે છીએ ને ? આટલાં વેતર આયવાં. એકેય વાર આદમીની હાજરી હતી. ભલે મુંબીમાં

યાંટિયા-તોડ કરે. કમાશે તારે અહીં પોચશે. જીણકી હેરાન નથી કરતી ને ? મોકલી દેવી મારે ત્યાં, પાટી-પેન લૈને.

હલીમાની ગણતરી ખોટી નો પડે. વૈશાખ વદ કીધું ને ? અને રસોડામાં નો ગુડાતી. મારી વિદૃગી શાક-નોટલી કરી આલશે. પંદરની થૈ. પલોટવી પડશે. ને ? કાલ હવારે માંડવો આવશે. હારુ કયરું, ટોપીઓ બંધ કરી. ફરકે છે ને ? અરે, તારી હારે વાતુંય કરશે ! જોજે, તારી મનોકમના પૂરી કરશે ઉપરવાળો. ટોપી પે'રનારો જ આવશે તારા ખોળામાં.

હવે તો ભર્યા દી ! આજકાલ જ. અમે સૂશું તારી પાંગતે. અલી, લખમીય પૂછતીંતી તારા વાકડ. મોંઘીમાએ કીધું. આવવાની છે તારી પાસે.

રસીલા, શું થાય છે તને ?

(૭)

રસીલાને ત્યાં આખો મેરાઈ પા ઊમટચો હતો. ચહેરાઓ પર હરબ માતો નહોતો.

ટોપીઓ ભરતીંતી ને આયવો ટોપીવાળો ! હલીમા બાકી ભારે પાવરધી. ઠસ્પિતાલે જ્યા હોઈ તો પેટ ચીરવું જ પડે. સમું વેતર આવી જ્યું ને ? સાડલો, પાંચ રૂપિયા – બધું દીધું લેખે !

રસીલાથી નવરી થયેલી સ્ત્રીઓએ જોયું તો લક્ષ્મી બારણામાં બેઠી બેઠી ટોપીઓ ભરી રહી હતી. તેનો ઝંઝર વિનાનો પગ ડેલી રહ્યો હતો.

## નાભિનાળ

### ■ ભગીરથ બ્રહ્મભક્ત ■

આજે મારું નાનકડું ગામ મારી જીવનચર્યાની બહાર નીકળી ગયું છે, પણ જ્યાં મારા શૈશવને લાડ મળેલાં એની ધરતીના કણેકણ સાથે મારા અસ્તિત્વનો સંબંધ છે. હું એના સ્મરણમાત્રથી રણજિતી ઊર્ધ્વ છું – એ સ્મૃતિઓ જ મને સંપૂર્ણ નગરવાસી થવા દેતી નથી. ગામનાં તળપદ ઝરણાંએ મને જે ભીજબ્યો છે એની તોવે ભદ્રસાગર ક્યાંથી આવી શકે ?

કહું ? ગુજરાતના નકશામાં મારા ગામનું નામ નથી. ક્યાંથી હોય ? નામની એને તમા પણ ક્યાં છે ? ગાંધીનગરની કેડયમાં બેઠું છે. ત્યારે તો ગાંધીનગર જેવું નામ પણ ક્યાં પડ્યું હતું ? ત્યાં તો ભરચક આંબાવાડિયાં અને લીલાંછમ ખેતરો વહુભેર ઊભાં હતાં. એ નગરના વસવાટે ખેતર જ ન રહેવા દીઘાં, આંબા તો કેરી સમેત વફાયા અને પછી એ નગરીની આગથી અહિસાના પૂજારી ગાંધીનું નામ રખાયું. એ નગર ગાંધીનગર કહેવાયું. એ નગરથી થોડેક છેટે માણસા જવાના માર્ગે આગળ જાઓ તો રસ્તામાં વાસણિયા મહાદેવ આવે, જ્યાં હનુમાન ઊંચા થઈને સઘળાં પરિવર્તનો નિહાળતા દેખાય. બસ એ મહાદેવ છોડો એટલે તરત બાલવા ચોકી આવે. એ ચોકીથી ગોઆરિયા રોડ પકડો એટલે પહેલું સ્ટેન્ડ આમજા અને બીજું સ્ટેન્ડ નાફરી. એ મારું ગામ. એ ગામે પહોંચવા માટે ત્યારે રોડ નહોતા. હું વાત કરું છું ૧૯૬૦ની... નેળિયા મારગે પહોંચાતું... માણસાનું નેળિયું... રૂપાલનું નેળિયું... ગોલથરાનું નેળિયું... સોજાનું નેળિયું અને ધધૂનું નેળિયું... આ નેળિયામાં વટેમારગુ થઈને ચાલવાની જે મજા હતી ! ગાડું હોય ડૂબાડૂ તો... ટ્રેક્ટર, એ તો પછી આવ્યાં... બસ પણ એક-બે આવે. ગામમાં નહીં દવાખાનું, નહીં નિશાળ... નહીં દુકાન, નહીં ઘંટી, નહીં લાઈબ્રેરી. માત્ર પાણીનો હવાડો... જેંચીને પાણી કઢાય એનો ગામકુવો. એક મહાદેવનું અને રામભગવાનનું મંદિર... આકર્ષણ જન્મે કે વહુ પડે એવું નોંધપાત્ર કશુંય નહીં. ગામમાં ગણતરીબાજો છે, ભૂવા છે, દોરા-ધારા કરનારા છે. ઓલિયા, ભોળિયા માણસો પણ છે. જાઝ જુછા અને થોડા સાચા માણસો છે. આમ જુઓ તો ભોળા શંભુ જેવો શંભુ મેળો છે ત્યાં. તેમ છતાં ગામનું મને ગૌરવ છે.

જો તમારે નજીકમાં નજીક રેલવે સ્ટેશને જવું હોય તો ઉનાવા અથવા મકાખાડા જવું પડે. ત્યાંથી એકબે યાઈમે જતી રેલગાડી મળે. એ પણ કેવી? પાંચ-સાત ડભાની... ઠચ્યુક-ઠચ્યુક ચાલતી... ગાડીમાં બેસે પણ કોણ? માણસો ઓછાં... મોજથી વાતો કરતાં ગળે બાંધિલી ઘૂઘરી રણકાવતી બકરી જેમ વાડામાં દાખલ થાય એમ ગાડી આવે ને જાય. ભાખ-ભાખ... કરતી ઉપડે એટલે ખબર પડે કે એ આવીને ગઈ... સાંધાવાળો હોય... ઝડીવાળો હોય, સ્ટેશન-માસ્ટર બાકીના સમયમાં માખી મારતો હોય. એવો નવરો ધૂપ. એવે સમયે ગામનાં વૃક્ષો, ખેતરો, કૃતરાં આપણી જ્ઞાને આત્મીયતા કેળવતાં હોય....

ગામના ભગતના ઘરે ખાવાના દાણા ન હોય પણ એની ભજનવાડીનો શબ્દ તમને ફીફી બનાવી દે તેવો ખમીરવંતો. એ ભજન ક્યાંથી ભૂલી શકાય? ગામના મંદિરના બાવાજી પણ એવા નવરા... બે યાઈમ આરતી કરી જાણે કેવળ. પછી બાવાજી પણ બાજી રહે. એ બાવાજને પણ પોતીકી માયા. એ માયાની સમસ્યાઓ.... બાવાજની સમસ્યાઓ પણ ગામની સમસ્યા બની જાય. હવે હું નગરજીવનમાં જોઉં છું ત્યારે સંકદાશનો પરિચય થાય છે એવું ગામડામાં કેમ નહીં હોય એવો વિચાર આવે છે. કેટલીક મૂળેવણો મારે તમારી સામે મૂકવી છે – ઉત્તર મને મળતો નથી, તમારી પાસે એ ઉત્તર હોય તો જગ્ઘાવજો. મારા ગામમાં કંઈ દેવી પુરુષો નહોતા વસતા કે નહોતા વસતા ભજોલા-ગજોલા કોઈ ભદ્ર પુરુષો. મારું ગામ તો એક ગામ સંપૂર્ણ અભાવો વચ્ચે જીવે. ન ગામમાં ઘંટી, ન દુકાન, ન દ્વારાનું, ન પાણીના નળ. તેમ છીતાં એ ગામમાં મહેમાન આવતા, માણસો બીમાર પડતા, બહારથી માણે ઉપાડી પાણી લાવી ઢોરઢાંખરને પિવડાવતું... કોઈ બીમાર પણ પડતું... સારું પણ થઈ જતું... એમ છીતાં આજની તુલનામાં એ અગવડો અગવડો લાગી જ નથી. બલકે જીવનનો આનંદ ત્યારે હતો એવો આજે કેમ નહીં હોય એનો પ્રશ્ન થાય છે. અભાવો વચ્ચે જે આનંદ હતો, જે સદ્ગ્રાવ હતો એ ક્યાં છું થઈ ગયો? ભાઈઓ જગડતા, અબોલાય લેતા, કોઈના પ્રસંગે રિસાતા, ન કરવા જેવું ખોટુંય કરતાં... એ બધા કંઈ દેવ તો નહોતા જ... તેમ છીતાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એમનામાં ક્યાંથી ભાઈચારાનું જરણ ફૂટી નીકળતું? એની વાત હજુ સમજાતી નથી. હું જન્મ્યો મારા ગામમાં, છ-સાત વર્ષ મોટો થયો, પછી દસકો રહ્યો.... પણ પછી લગભગ પાંચેક દસકા શહેરમાં રહ્યો છું. ગામમાં જેટલા ઓળખે એનાથી ઔધિક માણસોનો શહેરે પરિચય કરાવ્યો છે. ઘણી સગવડો મળી છે... તેમ છીતાં કોઈ મારું વતન પૂછે છે અથવા તો કોઈ મારા ગામ વિશે વાત કઢે છે ત્યારે કેમ સભાન થઈ જાઉં છું... કેમ ગૌરવ લઉં છું? કોઈ કહે તમે ક્યાંના? તો આનંદની જગ્ઘાએ શા માટે ‘નાદરી’ ઉત્તર આપું છું... મને સમજાતું

નથી. ગામમાં કોઈની ભેંસ કે કોઈનો બળદ મૃત્યુ પામતાં ત્યારે મારાથી કેમ રહી પડાતું ? નથી સમજી શક્યો ? ગામના ગોર, ગામનો સુથાર, ગામનો મજૂર, ગામનો જેડૂત શા માટે યાદ આવે છે ? ભૌમિતિક આકૃતિ વગરના ગામનું આટલું આકર્ષણ શા માટે ?

દીકરાને પરણપવવાની વાત આવી, પરણપવતી વખતે સામાવણાએ ગામ પૂછ્યું તો એ બંધ ઘરવાળા ગામનું નામ મેં કેમ આચ્યું ? મારા મૂળ ગામના નામથી વેવાઈ શું પામ્યા હશે ? ગામમાંથી તેમણે મારા વિશે માહિતી મેળવી હશે ? એના કરતાં વધારે માહિતી તો શહેર પાસે છે – ગામમાં મારા દીકરાને તો કોઈ ચહેરેમહોરેય ઓળખતું નથી તેમ છતાં સૌ સાગમટે બેઠાં હોય ત્યારે સ્વજનોની વચ્ચે હું મારા ગામનું ગૌરવ કેમ લઈ છું ? ગામની કુળદેવીને પગે લગાડવા માટે દીકરાને સજોડે શા માટે લઈ જાઉં છું ? એવા તો કયા ગુણે ગામનું આકર્ષણ મારામાંથી તદ્દન કેમ નામશેષ થતું નથી ? ગામ મારા ખબર-અંતર પૂછે છે. ગામની ધૂળ મારાપો વ્યક્ત કરે છે. આત્મીયતાથી બંધાઈ જાઉં છું એના કણેકણમાં. ગામ જ મારા આયખાનો થાક ઉતારે છે. હું ગામમાં જાઉં ત્યારે કોઈ ઓળખે કે ન ઓળખે – ગામ મારી પીઠ પસવારે છે.

હું મારા મૃત્યુનો વિચાર કરું છું ત્યારે પણ મને થઈ આવે છે – દીકરાઓ શું કરશે ? હું એમને અગાઉથી કહી રાખ્યું કે, ‘ભાઈ, આ તો પારકો પરદેશ... મારી માટી ગામમાં લઈ જાઓ.’ આવાં વિધાનો કરવા પાછળ કર્યું પ્રયોજન હશે મારું ? મને લાગે છે કે જે બળે પરમાત્મામાંથી વિભૂતો પડેલો આત્મા પુનઃ પરમાત્માની જ જંખના કરતો હોય છે. બસ એ જ રીતે અને એ જ બળે મારું અસ્તિત્વ મારા ગામની, મારા કુળની, મારી અસલી માટીની પોકાર કરતું હશે કે શું ? વ્યક્તિથી ભલે ગામ ઓળખાતું હોય, એવું ક્યારેક બને પણ ખરું, પણ બહુધા તો ગામથી જ માણસ ઓળખાય છે. એનાથી જ એનું સમાજમાં મૂલ્યાંકન થાય છે. ખરેખર તો ગામ એટલે વ્યક્તિની ખાનદાનીનું લોહી, એનાથી જ વ્યક્તિની ઓળખ થાય છે.

## જેસ્ઝુ સ્ટુઆર્ટ (Jesse Stuart)

જેસ્ઝુ સ્ટુઆર્ટનો જન્મ અમેરિકાના કેનટકી રાજ્યના રીવર્ટન પાસેના એક નાના ગામમાં ઈ. સ. ૧૮૦૭માં થયો હતો. વતનથી દૂરની કોઈ કંદ્રી સ્કૂલમાં એના શિક્ષણનો આરંભ થયો. એ ખર્ચર ઉપર બેસીને અથવા પગે ચાલીને સ્કૂલે જતો. કુટુંબમાં એના કામની જરૂરિયાત ઊભી થતાં ૧૧ વર્ષની ઉંમરે એનો અભ્યાસ બંધ થયો, પણ ૧૫માં વર્ષે એને ફરી અભ્યાસ કરવાની તક મળી. લિંકન મેમોરિયલ યુનિવર્સિટી સુધી અભ્યાસ ચાલુ રહ્યો.

વવસાયમાં એનાં બે મુખ્ય ક્ષેત્રો જેતી અને શિક્ષણ. કેનટકીના કુંગરાળ પ્રદેશમાં એના ૫૦૦ એકરના ફાર્મ ઉપર જીવનભર એણે એક ખેડૂત તરીકે કામ કર્યું. સાથે સાથે જીવનનાં ૨૦ વર્ષ એણે શિક્ષણનું કામ કર્યું. એની આ પ્રવૃત્તિનો આરંભ કેનટકીના એક ઓરડાની ગામઠી શાળાના શિક્ષક તરીકે થયો. એ પછી એણે જુદાં જુદાં ૫૮ અને હોદ્દા પર શિક્ષણનું ઘણું કામ કર્યું.

ઈ. સ. ૧૮૩૪માં એનું પ્રથમ પુસ્તક – ‘The Man with a Bull Tongue Plow’ કાવ્યસંગ્રહના રૂપમાં પ્રગટ થયું. પછી તો એણે ઘણી ટૂંકી વાર્તાઓ લખી. ‘The Man of the Mauntain hills’ અને ‘Tales from the Plum Grove’ એના જાણીતા વાર્તાસંગ્રહો છે. એને થોમસ જેફર્સન સધર્ન એવોર્ડ મળ્યો હતો. અને એક વર્ષ માટે યુરોપ-ભરમણ માટેની જ્યુગેઇનહેમ ફેલોશિપ મળી હતી.

એણે આત્મકथા પણ લખી છે. આ ‘Split Cherry Tree’નો અનુવાદ છે.

# ભાંગેલું ચેરી વૃક્ષ

લે. જેસી સ્ટુઅર્ટ, અનુ. મોહનલાલ પટેલ

મેં પ્રોફેસર હર્બિટને કહ્યું : ‘સ્કૂલના સમય પછી કામ કરવા માટે બે કલાક રોકાવામાં મને વાંધો નથી, પણ એના કરતાં તમે મને શારીરિક શિક્ષા કરીને વહેલો ધેર જવા દો એવું હું ઈચ્છું છું. હું બે કલાક મોડો ધેર જઈશ એટલે મારા પિતા મને માર્યા વિના રહેવાના નથી.

પ્રોફેસર હર્બિટ બોલ્યા : ‘હવે તું શારીરિક શિક્ષા માટે ઘણો મોટો ગણાય. ચેરીના ઝડપ પર ચઢીને એને ભાંગવા માટે મારે તમને શિક્ષા કરવી પડે એની તમને છોકરાઓને ખબર હોવી જોઈએ. તારા સિવાય પાંચેય છોકરાઓએ એક એક ડોલર ભરી હીધો છે. તું એકલો જ એ ભરવામાં બાકી છે. તું એક ડોલર ઉધીનો મેળવી શકે એમ નથી ?

‘ના, હું એ મેળવી શકું એમ નથી એટલે મારે શિક્ષા ભોગવવી રહી. હું એનો ઝડપ નિકાલ ઈચ્છું છું.’

પ્રોફેસર હર્બિટ મારી સામે જોયું. એ બહુ મોટા માણસ છે. એમજો રાખોડી રંગનો સૂટ પહેર્યો હતો. એમના માથાના વાળના રંગ સાથે એનો બરાબર મેળ બેસતો હતો.

મેં પ્રોફેસર હર્બિટને કહ્યું : ‘તમે મારા પિતાને જાણતા નથી. એ જુનવાણી માણસ છે. એમે એકવીસ વર્ષના થઈએ ત્યાં સુધી એ અમારું બરાબર ધ્યાન રાખે છે. ‘દંડાનો ઉપયોગ ન કરો તો તમે છોકરાને બગાડી મૂકો છો.’ એ કહેવતમાં એ માને છે. ચેરીના ઝડપ વાત કેમેય કરીને હું એમના ગળે નહીં ઉતારી શકું. અમારા લોકોમાં હાઈસ્કૂલમાં દાખલ થનાર હું પહેલો અને એકલો છું.

પ્રોફેસર હર્બિટ કહ્યું : ‘તારે આજે અને આવતી કાલે સ્કૂલ છૂટ્યા પછી બાબે કલાક રોકાઈને શિક્ષા ભોગવવી તો પડશે જ.’ આટલું કહી ખુલાસો કરતા હોય એમ એ બોલ્યા : ‘હું તને એક કલાકના ૨૫ સેન્ટ દેખે મહેનતાણું ચૂકવીશ. કામમાં તારે શાળાના વર્ગોનાં ભૌયતળિયાં વાળીને સાફ્ કરવાનાં થશે. વર્ગોની બારીઓ સાફ્ કરવાની અને એમાંનાં કાળાં પાટિયાં ધોવાનાં થશે. તારી વતી એક ડોલર હું ભરીશ.

આમ શાળા છૂટ્યા પછી મારે કામ કરવાનું નક્કી થયું.

હું કામ કરતો હતો એ વખતે મને આવા આવા વિચાર આવવા લાગ્યા : ‘અમે પેલા ચેરીના ઝડપ ઉપર ચઢ્યા જ શું કામ ? એને શા માટે ભાંયું ? અમે છ જજા

વર्गना સમૂહમાંથી જુદા પડીને ટેકરીઓ તરફ ભાગ્યા શા માટે ? એક નાની સરખી ગરોળી પાછળ અમે છ જજા નાના એવા ચેરીના જાડ ઉપર શા માટે ચઢ્યા ? ચેરીનું જાડ ચિરાઈને અમને લઈને કેમ બાંગ્યું ? એણે મજબૂત હોવું જોઈતું હતું. ચેરી બાંગ્યું એ વખતે જ એનો માલિક ઈંફ કારબાટી એ વિસ્તારમાં ભૌષ બેડતો હતો. એણે અમને પકડી પાડ્યા અને અમારાં નામ જાણી લીધાં. જાડ ભાંગ્યા બદલ છ ડોલર વસૂલ કરવાનું વિચારવાને બદલે કશું ન લેવાનું નક્કી કરીને એ સારો માણસ કેમ ન નીવાડ્યો ?

મેં સ્કૂલ છોડી ત્યારે છ વાગ્યા હતા. ઘેર પહોંચવા માટે મારે છ માઈલનું અંતર કાપવાનું હતું. હું ઘેર પહોંચું ત્યારે સાત તો ક્યારનાય વાગી ચૂક્યા હોય. ઘેર પહોંચું ત્યારે મારા ભાગનું બધું કામ કરવાનું બાકી હશે. પિતાજી અને હું સાંજ પછીનું બધું કામ પૂરું કરીએ છીએ. સાત ગાયોને દોહવાની. ઓગણીસ પશુઓને ખવડાવવાનું. ચાર ખચ્ચર અને પચીસ દુક્કર. દીવાલમાં તાપકાં (Fire Place) અને ચૂલામાં રંધણાં માટે બળતણ કાપવાનાં. કૂવામાંથી પાણી ખેંચવાનું... હું ઘેર પહોંચું ત્યારે પિતાજી આ બધું એકલા હાથે કરતા હશે. આના કારણે એ મગજ ગુમાવી બેઠા હશે.

હું ઘર તરફ ભાગ્યો. અંધારામાં પાંડાં વિનાનાં વૃક્ષો નીચે દોડતો હતો અને ટેકરીઓ ઉપર જડપથી ચઢતો હતો અને એમના ઉપરથી દોડીને ઉત્તરતો હતો. જમીન ઠરવા લાગી હતી. મારે ઉતાવળ કરવાની હતી. દોડવું પડતું હતું. ટેકરીઓની હારમાળ પાર કરીને હું ઘાસના મેદાન સુધી પહોંચ્યો. ઠડો પવન મારા ચહેરા પરના પરસેવાને સૂક્ષ્મી દેતો હતો. હું ઘાસના મેદાન સોંસરો દોડીને ઘેર પહોંચ્યો.

ઘરમાં પ્રવેશતાં જ મારાં પુસ્તકો ફેંકી દીધાં અને પશુઓના ખાણની વ્યવસ્થા માટે દોડીને કોઠાર સુધી પહોંચ્યો. મેં કપડાં બદલવાની તમા રાખી નહીં. કોઠારે પહોંચ્યા પછી મેં જોયું કે પિતાજી હોર માટે જમીન ઉપર ખાણ પાથરી રહ્યા હતા. આ મારા ભાગનું કામ હતું. પિતાજીને મેં કહ્યું : ‘પા, એ તમે રહેવા દો; હું કરી દઈશ. મારે જરા મોડું થઈ ગયું છે.’

‘તું મોડો છે એ હું જોઈ શકું છું.’ કહી એમણે મારી સામે જોયું. એમની આંખોમાં આગ ભડભડતી હતી. એમણે કહ્યું : ‘હુનિયાની કઈ તાકાતે તને રોકી રાખ્યો ? કામમાં મદદ કરી શકે એવો એક જ છોકરો અને તે આમ દગડાઈ કરી રહ્યો છે ! જરા સમજણો થા.’

હું કંઈ બોલ્યો નહીં. સ્કૂલમાંથી હું કેમ મોડો આવ્યો એ વિશે હું કશું કહેવા માગતો નહોતો.

પિતાજીએ ફરી એક વાર મારી સામે જોયું અને બોલ્યા : ‘રાત પડચે તું કેમ

આવ્યો એ મને કહે, નહીં તો હું તને અહીં જ છિકોરી (કઠળ લાકડાવાળું એક વૃક્ષ)ની લાકડીથી ફટકારીશ.’

પિતાજી આગળ હું જૂદું બોલી ન શક્યો. એ શાળામાં જઈને આ અંગેની ખાતરી કરે ત્યારે મારી સ્થિતિ વધારે કફોડી થાય. મેં એમને કહ્યું : ‘મારે સ્કૂલના સમય પછી ત્યાં રોકાંવું પડ્યું હતું.’

‘નિશાળના સમય પછી તારે કેમ રોકાંવું પડ્યું હતું ?’

મેં કહ્યું : ‘અમારો જીવશાસ્ત્રનો વર્ગ વગડાના પર્યટને ગયો હતો. વર્ગના અમે છ જીણા બધાથી જુદા પડીને એક ખેતરમાં પહોંચી જઈને એક ચેરીના ઝાડ ઉપર ચંચા હતા. ઝાડનું ડાળ્યું ચિરાયું અને ઝાડ ભાંગ્યું. આ નુકસાનના કારણે અમારે ચેરીના માલિકને છ ડોલર આપવાના થયા. અમારે એક એક ડોલર આપવો પડે એમ હતો. હું ન આપી શક્યો એટલે પ્રોફેસર હબર્ટ મને શાળાના સમય પછી કામ કરવાનું સૌંઘ્યું છે. એક કલાકના પચીસ સેન્ટ દેખે બે દિવસ બજે કલાક કામ કરવાનું થાય. આજે બે કલાક કામ કર્યું. કાલે એ પ્રમાણે કરવાનું છે.’

‘હું સાચ્યું કહે છે ?’

‘હું સાચ્યું જ કહું છું. તમે ત્યાં જઈને ખાતરી કરજો.’

‘હું સવારે એ જ કરવાનો છું. તમે લોકોએ કોનું ઝાડ ભાંગ્યું છે ?

‘ઈઝ કારબટ્રીનું ચેરીવૃક્ષ.’

‘ઈઝ કારબટ્રી તો હાઈસ્કૂલના સ્થળથી ચાર માઈલ દૂર રહે છે. ત્યાં જઈને તમે શું કરતા હતા ? નિશાળવાળા તમને નિશાળમાં ચોપડીઓનું ભણાવતા નથી ? એ લોકો તમને નિશાળમાંથી બહાર કાઢીને દુંગરાળ જગ્યામાં લઈ જાય છે ? જો એમ જ હોય તો હવેથી હું તને ઘેર જ રાખીશ. અહીં તને આપી શકાય એવું ઘણું કામ છે.’

મેં કહ્યું : ‘પા, હવે વસ્તંત ઝાંતુનો આરંભ થવા માંડ્યો છે. જીવડાં, સાપ, સ્કૂલ, ગરોળીઓ, દેડકાં અને વનસ્પતિના છોડની અભ્યાસ માટે જરૂર પડવાની છે. આજે મજાનો ચોખ્યો દિવસ હતો એટલે આમાંનું થોડુંક મેળવી લેવા બઢાર વગડા અને ખેતરોમાં નીકળ્યા હતા. એક ચેરીના ઝાડ ઉપર એક ગરોળીને તડકો ખાતી અમે જોઈ અમે છ છોકરા એ ગરોળીને પકડવા એકીસાથે એ ઝાડ ઉપર ચઢી ગયા અને ઝાડ ભાંગ્યું. ઈઝ કારબટ્રી નજીકમાં જ ખેડ કરતો હતો. એ ધસી આવ્યો અને અમારાં નામ મેળવી લીધાં. ઈઝને છ ડોલર આપવાનું નક્કી થયું. પાંચ છોકરાઓએ એમના ડોલર આપી દીધા. મારો ડોલર પ્રોફેસર હબર્ટ આપ્યો અને મારે આ કામ કરવાનું થયું.’

પિતાજી બોલ્યા : ‘હું સવારે જાતે આવીશ અને તપાસ કરીશ. પ્રોફેસર આ પ્રદેશના નથી. સવારે હું એમને મળીશ. પુસ્તકોને પડતાં મૂકીને છોકરાઓને ટેકરીઓમાં ભમતા કરવા એ કયા પ્રકારની નિશાળ છે ?’

મેં કહ્યું : ‘આ, મહેરબાની કરીને ત્યાં ન જતા. મને ૫૦ સેન્ટ આપો એટલે બધી વાત ઉંકલી જશે. તમે ત્યાં જાઓ એવું હું ઈચ્છતો નથી. પ્રોફેસર હર્બિટ જાથે ઊંચા સાઢે બોલવાનું થાય તે પણ હું નથી ઈચ્છતો.’

પિતાજી બોલ્યા : ‘વૃદ્ધ બાપથી શરમાય છે, તેવ ? તું મારા કરતાં સારું જીવન જીવે એ હેતુથી સખત કામ કરીને મેં તને ઉછેર્યો અને હાઈસ્ક્યુલમાં ભણવા મૂક્યો છે.’

પિતાજીના નિર્ણય પછી એક વાર તો મને એવો વિચાર આવી ગયો કે જેટલી બની શકે એટલી વધારે ઝડપથી કોઈઠાની પેલી પારનાં જંગલોમાં ભાગી જાઉં. ઘર અને નિશાળ છોડિને એવો નાચી જાઉં કે કોઈ મને શોદ્ધી ન શકે. હું પિતાજીના સાથમાં સ્કૂલે નહીં જઈ શકું. એમની પાસે પિસ્તોલ હોય અને કદાચ પ્રોફેસર હર્બિટને એ ભડકે દઈ દે ! પિતાજી શું કરે એ કહેવું અધરું છે. હું કદાચ એમને એમ કહી શકું કે તમારા વખતમાં નિશાળ જ્યાં હતી ત્યાં આજે નથી. ટેકરીઓમાં એનું ડેકાણું બદલાયું છે. પણ એ નહીં સમજે. હું એમ કહી શકું કે અમે દેડકાં, પક્ષીઓ, સાપ, ગરોળીઓ, ફૂલ અને જીવાં વિશે ભણતા હતા તો એ પણ એ નહીં સમજે. હું વેરથી ભાગી જાઉં તો પિતાજીને એનું કંઈ લાગશે નહીં. એ પ્રોફેસર હર્બિટને મળશે જ. એ તો એમ જ માનશે કે શાળા અને પ્રોફેસર હર્બિટ જ મને વેરથી ભગાડ્યો છે.

ભાગી જવાની જરૂર નથી. મારે રહેવાનું છે. પશુઓના ખાણાનું કામ પૂરું કરવાનું છે. અને આવતી કાવે સવારે પિતાજી સાથે સ્કૂલે જવાનું છે.

આકાશમાં ઠડા માર્ચ મહિનાનો ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ચંદ્રના અજવાગમાં મેં મારું કામ પૂરું કર્યું. ઘેર મારે કેટલું કામ કરવાનું હોય છે એ પ્રોફેસર હર્બિટ જાણતા નથી. જો એ જાણતા હોત તો એમણે મને શાળાસમય પછી રોકી રાખ્યો ન હોત. ચેરી વૃક્ષના ઢંડ રૂપે મારા ભાગે ભરવાનો થતો એક ડોલર એમણે મને ઉધીનો આપ્યો હોત. એ કદી ટેકરીઓના નિવાસી નહોતા એટલે ટેકરીઓમાં રહેતા અને હાઈસ્ક્યુલમાં ભણતા છોકરાઓને કઈ રીતે કામ કરવું પડે છે એની એમને ખબર નથી. હવે એ એક પ્રાદેશિક હાઈસ્ક્યુલમાં ભણાવે છે જ્યાં ટેકરીઓમાં વસતા છોકરાઓ અભ્યાસ કરે છે.

મારું કામ પૂરું કર્યા પછી હું ઘરમાં ગયો અને મારું સાંજનું ખાણું આધું. એ ઠંડું થઈ ગયું હતું.

પિતાજી અને મોમ જમી ચૂક્યાં હતાં. આગળના રૂમમાં વાતો કરતાં બેઠાં હતાં. પિતાજી મોમને શાળાએથી મારા મોડા આવવાની વાત કરી રહ્યા હતા.

રાત્રે મારે બધી ગાયો દોહવી પડી. મારે લાકડું કાપવું પડ્યું. આખો હિવસ જમીન પરના રજણપાટ પછી આ કામ બહુ અધ્યાત્મિક લાગ્યું.

પિતાજી અને મોમ વચ્ચેની વાત મારા કાને પડતી હતી. પિતાજીને મોમે કહ્યું : ‘જુઓ લસ્ટર, એ ઝંગટી તમે દૂર રહો. વગર જોઈતી ઉપાધિ ઊભી કરશો નહીં. તમે એવું કંઈ કરશો તો તમને જેલ પણ થાય. તમે એમાં કાયદાની ચુંગાલમાં સપદાશો. તમે ત્યાં જાઓ પણ બીજું કંઈ કર્યા વગર પ્રોફેસર અને બધા વિદ્યાર્થીઓની સમક્ષ ડેવને શિક્ષા કરજો.’

પિતાજી બોલ્યા : ‘હું અહીં જે કરી રહ્યો છું એ પ્રોફેસર જાણતા નથી. હું એમને બતાવી આપીશ કે એક છોકરાને રોકી રાખીને બીજા બધા સાથ નિર્દોષ હોય એ રીતે જતા કરવા એ વાજબી નથી. મારો છોકરો બીજા છોકરાઓ જેવો ભલોભોળો છે. બંદૂકની ગોળી ગમે તે માણસના શરીરમાં કાણું પાડે એમ શાળાના શિક્ષકના શરીરમાં પણ કાણું પાડી દેશો. એ મને એવું કશું કરી શકે એમ નથી. હું આ માટે પહેલ કરીશ. હું સવારે પહેલો ત્યાં પહોંચી જોઈશ અને માંકણ કે જીવઢાને કેવી રીતે ભણાવાય છે એ જોઈશ. ભગવાનના સર્જનનાં ગરોળીઓ, દેડકાં વગેરેનો શિકાર કેવી રીતે થાય છે એ જોઈશ. આખા પ્રદેશમાં રજણપાટ અને એક ગરોળીની પાઇળ ચઢીને ચેરી વૃક્ષનું નિકંદન કેવી રીતે થાય છે તે જોઈશ. વૃદ્ધ ઈંફ કારબટ્રીએ ચેરી ભાંગ્યાના વળતર માટે છ ડોલર વસૂલ કરવાના બદલે એણો ગરમાગરમ પ્રવાહી સીસાનો ઉપયોગ કરવો જોઈતો હતો. એણે સૌ પહેલાં તો વૃદ્ધ હર્બિટને જ લેવો જોઈતો હતો.’

મેં ખાણું ખાધું અને ઉપરના માળે ચઢી ગયો. દીવો સળગાવ્યો. સારાયે મામલાને ભૂલી જવા હું પ્રયત્ન કરવા માંડ્યો. મેં પહેલાં જોમેટ્રી અને પછી જીવશાસ્ત્રના પાઠનો અભ્યાસ કર્યો.

પિતાજી વિશે હું ઝાંઝું વિચારી શક્યો નહીં. એ સવારે મારી સાથે સ્કૂલે આવશે. પ્રોફેસર હર્બિટને મારવા પોતાની સાથે પિસ્તોલ લેશો. પ્રોફેસર હર્બિટ મારા વિશે શું વિચારશે ? હું એમને કહીશ, ‘પિતાજી આગળ મારું કશું ચાલતું નથી.’ પણ પિતાજી તો એમને ગોળીએ દઈ દેશો. પિતાજી સાથે જવાનું મારા માટે ત્રાસદ્યાયક છે. બની શકે કે ચાતમાં એ ઠંડા પડે અને સવારે નિશાળે જવાનું માંડી વાળે.

પિતાજી સવારે ચાર વાગે ઊઠી ગયા. ચૂલ્હામાં એમણે અજીન સળગાવ્યો. પછી તાપક્ષામાં બળતણ ઉમેદ્યું. એમણે નાસ્તો તૈયાર કરવા માટે મોમને જગાડી. પછી એમણે ગાયોને ખાણ આપવામાં અને દોહવામાં મદદ કરવા માટે મને જગાડ્યો. અમે કોઈઠારને

લગતું બધું કામ પતાવ્યું. મોમે અમારા માટે નાસ્તો તૈયાર કરી દીધો હતો. અમે નાસ્તો લીધો. પરોઢનું અજવાણું દેખાયું અને અમે પાંડાં વિનાનાં ઓક વૃક્ષો પર સહેદ ધૂમસ છવાયેલો જોઈ શક્યા. ટેકરીઓ પણ ધૂમસના કારણે સહેદ જણાતી હતી.

પિતાજીએ કહ્યું : ‘હવે તેવ, સ્કૂલે જવા આપણે તૈયાર થઈ જઈએ. તારી સાથે નિશાળે જવા હું આવવાનો છું અને માંકણ-જવડાં, દેડકાં, ગરોળી, સાપ શીખવાનું અને ચેરીના ઝાડના ભાંગી પડવા વગેરે વિશે તપાસવાનો છું. ભણાવવાની આવી મૂર્ખાઈભરી રીતને હું પસંદ કરતો નથી.’

પિતાજી સાથે નિશાળે જવાની બાબતમાં મને એક વાતનો આનંદ હતો કે અમે વહેલી સવારે જઈ રહ્યા હતા. પિતાજી પ્રોફેસર હર્બિટ ઉપર ગોળી ચલાવે ત્યારે એ જોવા મારા સહાધ્યાયોમાંથી બહુ ઓછા હાજર હશે.

હું જાણતો હતો કે સ્કૂલના વાતાવરણમાં પિતાજી સાવ જુદા જ દેખાતા હશે. એમણે ઓવરઅ૱લ પહેર્યું હતું. મોટા બૂટ, બલ્યુ રંગનું શર્ટ, ઘેરાના ચામડાનો કોટ, એક ધારે વળાંકવાળી કાળા રંગની હેટ, પછે બાંધીલા ચામડાના કવરમાં એમની પિસ્તોલ - આ બધું એમને એક જુદા માણસ દેખાડવા માટે પૂરતું હતું.

ટેકરી પાર કરીને અમે હાઈસ્કૂલના માર્ગે ચાલવા લાગ્યા.

અમે હાઈસ્કૂલે પહોંચ્યા ત્યારે ઘણું વહેલું હતું. પ્રોફેસર હર્બિટ હમણાં જ આવ્યા હતા. અમે શાળાના મકાનના પગથિયે ચઢતા હતા ત્યારે મને આ વિચાર આવ્યો - અત્યારે તો પિતાજી પ્રોફેસર હર્બિટને જાણતા નથી પણ બની શકે કે પ્રોફેસર હર્બિટ એક સારા માણસ છે એવો જ્યાલ એમને આવે. ટેકરીની પેલે પારના લેમ્બર્ટ છોકરાઓની બાબતમાં એમ જ બન્યું હતું. જ્યાં સુધી એ છોકરાઓ સાથે વાત થઈ નહોતી ત્યાં સુધી એ મને ગમતા નહોતા, પછી તો એ મને ગમી ગયા અને અમે મિત્રો બની ગયા. બીજા માણસને ઓળખવામાં ક્યારેક આવું બને છે.

પિતાજીએ પ્રોફેસરને મળતી વખતે કહ્યું : ‘તમે જ પ્રોફેસર હર્બિટ કે ?’ ‘હા’, પ્રોફેસરે જવાબ આપ્યો અને કહ્યું : ‘અને તમે તેવના પિતા કે ?’ ‘હા’ કહીને પિતાજીએ એમની પિસ્તોલ કાઢીને પ્રોફેસર હર્બિટની રૂમની એક બેઠક પર મૂકી.

પિતાજીની પિસ્તોલ જોઈને પ્રોફેસર હર્બિટનાં કાળી ફેમનાં ચશમાં પાછળની આંખો પહોળી થઈ ગઈ અને એમના ફિક્કા ગાલમાં રંગ ભણ્યો.

પિતાજીએ કહ્યું : ‘આ સ્કૂલ વિશે મારે કેટલીક બાબતો જાણવી છે. તેવને હું એક સ્કોલર બનાવવા માગું છું. અગિયાર નાનેરાંઓમાંથી એને એકલાને મેં હાઈસ્કૂલમાં ભણવા મૂક્યો છે. એ ધેર મોડો આવે ત્યારે ઘરનું બધું કામ મારે એકલાએ કરવાનું થાય છે. એ કહે છે કે ગઈ કાલે તમે બધા માંકણ જેવા જીવજંતુઓના શિકાર માટે

ગયા હતા અને એક ચેરીનું ઝડ ભાંગ્યું. આના કારણે તેવને નિશાળના સમય પછી બજે કલાક રોકાઈને ચેરીના ઝડના વળતર માટે કામ કરવાનું છે. આ બરાબર છે ?

જરાક થોથવાતાં પ્રોફેસર હર્બિટ જવાબ આપ્યો : ‘હા, બરાબર છે.’

અને એમજો પિતાજની પિસ્તોલ સામે જોયું.

પિતાજ બોલ્યા : ‘આ હાઈસ્ક્વુલ જ નથી. એ માંકણ હાઈસ્ક્વુલ છે, ગરોળી હાઈસ્ક્વુલ છે, સાપ હાઈસ્ક્વુલ છે. આ ખરી હાઈસ્ક્વુલ જ નથી.’

પ્રોફેસર હર્બિટ પિતાજને કહ્યું : ‘આ ગન (પિસ્તોલ) તમે શા માટે લાવ્યા છો ?’

પિતાજએ જવાબ આપ્યો : ‘તમે એનું કાણું જોઈ શકો છો.’ આટલું બોલી એમજો ગનના નાળના પર આંગળી મૂકી. પછી કહ્યું : ‘એ કાણામાંથી ગોળી આવે અને કોઈ પણ માણસને મારી નામે એમ સ્ક્વુલ-ટીચરને પણ મારી શકે. એ શ્રીમંતનેય મારે અને ગરીબનેય મારે. એ માણસને મારે. પણ અહીં આવીને તમને જોયા ત્યારે મને લાગ્યું કે આ મારું સાધન તમને થોડી જ મિનિટોમાં પૂરા કરી દઈ શકે.’

પ્રોફેસર હર્બિટની બાજુમાં કદાવર, કઠોર, મજબૂત અને ભૂખરા રંગની ચામડીવાળા પિતાજ ઉભા હતા. એ આટલા બધા મોટા અને ખડતલ હતા એની તો મને ખબર જ નહોતી. અગાઉ મેં એમને કદી નિશાળમાં જોયા નહોતા. મેં નિશાળના પ્રોફેસર હર્બિટને જ જોયા હતા. એ મને કાયમ કદાવર દેખાતા હતા. અત્યારે પિતાજની બાજુમાં ઊભેલા એ એવા દેખાતા નહોતા.

પ્રોફેસર હર્બિટ બોલ્યા : ‘મિ. સેફ્સ્ટન, હું તો ફક્ત મારી ફરજ બજાવું છું. અને રાજ્યે જે અભ્યાસક્રમ નક્કી કરી આપ્યો છે એને અનુસરું છું.’

‘ભાષાતરનો અભ્યાસક્રમ ? કયું ભાષાતર ? માંકણનું ભાષાતર ? નાલેશીનું ભાષાતર ? તરુણ-તરુણીઓને જંગલમાં લઈ જવાનાં ? એમની પાસે ધીંગામસ્તી કરાવવાની ?’

પ્રોફેસર હર્બિટ તેવને સૂચના આપતાં કહ્યું : ‘છોકરાઓ હવે સ્ક્વુલના મકાનમાં આવવા લાગ્યા છે. તેવ, દરવાજો બંધ કર, જેથી કોઈ સાંભળો નહીં.’

મેં બારણું બંધ કર્યું. પવનમાં પાંદડું ધૂજે એમ હું ધ્રૂજતો હતો.

ક્ષણો ક્ષણો મને લાગ્યા કરતું હતું કે પિતાજ ગમે ત્યારે પ્રોફેસર હર્બિટને મારી દેશો. એ બોલતા હતા ત્યારે એમનો ચહેરો વારંવાર રાતો થઈ જતો હતો. એમજો કહ્યું : ‘છોકરાઓને નિશાળમાં રહેવા દીધા વગર સારાયે પ્રદેશમાં રખડતા કરવા અને ચેરીવૃક્ષો ભાંગવાં એને હું સારું ગણતો નથી.’

‘તેવ પ્રત્યે હું બીજું શું કરી શક્યો હોત મિ. સેફ્સ્ટન ? એક ગરોળી પાછળ

બધા છોકરાઓએ જાડ ઉપર ચઢવાની જરૂર નહોતી. એક જ ચઢ્યો હોત તો પણ ગરોળીને પકડી શક્યો હોત. ખેડૂતે છ ડોલરનો ચાર્જ કર્યો એ આકસ્માતું તો હતું પણ અમારે એ ભરપાઈ કરવું પડે એમ હતું. પાંચ પાસેથી પૈસા વસૂલ કરું અને એકને જતો કરું ? એની પાસે ડોલર નહોતો અને એ મેળવી ન શક્યો. હું એને કામ દ્વારા ડોલર ભરવાની તક આપું છું. એ મારું કામ નથી કરતો. સ્કૂલનું કામ કરે છે.’

પિતાજીએ કહ્યું : ‘તમે એને શું કરી શકો એ હું સમજ શકતો નથી. ફક્ત વિલો વૃક્ષની ડાળીની સોટી એના માટે જરૂરી હતી.’

મારા તરફ આંગળી કરીને પ્રોફેસર હર્બિટ બોલ્યા : ‘શારીરિક માર માટે હવે એ ઘણો મોટો છે, મોટા આદમીના કદનો છે?’

પિતાજી બોલ્યા : ‘મારા માટે એ મોટો નથી. એ એકવીસ વર્ષ વયારે ત્યાં સુધી મોટો નથી. એકને કામમાં રોકવો અને બીજાઓને પૈસા લઈને જતા કરવા એ રીત મને શોભાસ્પદ લાગતી નથી. માંકણને હાઈસ્કૂલ સાથે શું લાગે વળગે ? એ મને સમજાતું નથી. કોઈ પણ રીતે એ મને સારું જણાતું નથી.

પિતાજી પિસ્તોલ ઉપાડી લીધી અને એના કવરમાં ખોસી લીધી. પ્રોફેસરના ચહેરામાં બાળોલો રંગ વિલીન થઈ ગયો. અને એમણે પિતાજી સાથે હવે મોકણ મને વાતો કરવા માંડી. પિતાજી જરાક નરમ પડવા હતા. એ હાઈસ્કૂલના બિલ્ડિંગમાં હોય એ પણ એક વિચિત્ર ઘટના હતી.

પ્રોફેસર હર્બિટ બોલ્યા : ‘મિ. સેક્રેસ્ટન, અમે ફક્ત સાપ, દેડકાનનાં બચ્ચાં, ફૂલ, પંતંગિયાં, ગરોળીઓ વગેરેનો શિકાર કરતા નથી. જીવવિજ્ઞાનના પ્રયોગોમાં જંતુઉછેર માટે જરૂરી સાધનમાં રાખવા માટે હું સક્કા વીમોથીના ઘાસનો પણ શિકાર કરું છું.’

પિતાજી બોલ્યા : ‘એ શું છે એની તો મને ખબર નથી પણ જંતુઉછેરના સાધન અંગે એટલી ખબર છે કે કે મરધાનાં બચ્ચાના ઉછેર માટેનું એ સાધન આજકાલ છેતરસમજું બહાનું થઈ પડ્યું છે. પણ તમે જે જાતના ઉછેરની વાત કરી એની તો મને જાણ નથી.’

‘તમે જંતુઓ વિશે સાંભળ્યું છે, મિ. સેક્રેસ્ટન ?’ પ્રોફેસરે પૂછ્યું.

‘તમને વાંધો ન હોય તો મને ફક્ત લસ્ટર કહો.’

‘બરાબર લસ્ટર, તમે જંતુઓ વિશે સાંભળ્યું છે ?’

‘હા; એના વિશે સાંભળ્યું છે ખરું, પણ હું જંતુઓમાં માનતો નથી. મને પાંસઠ થયાં, આજ સુધી મેં જંતુ જોયું નથી.’

‘તમે એને તમારી નરી આંખે ન જોઈ શકો. તમે તમારી પિસ્તોલ એના ટેકાડો રાખો અને આજે મારી સાથે હાઈસ્કૂલમાં રહો. હું તમને કેટલીક ચીજો બતાવીશ.

તમારા દાંત ઉપર જંતુઓ છે તે પણ તમે જોઈ શકશો.

‘શું કહ્યું ? મારા દાંત ઉપર જંતુઓ છે એવું તમે કહેવા માગો છો ?’

‘હા, એ જ વસ્તુ કાળા નાગમાં પણ જોઈ શકાય.’

પિતાજીએ કહ્યું : ‘હું તમારી સાથે વિવાદમાં ઊત્તરવા માગતો નથી. પણ એ માનવનું થાય તો એ એક કમનરીબી હો. મારા દાંત ઉપર જંતુઓ હોય એ હું માની શકતો નથી.’

‘એ હું તમને બતાવીશ. તમને સ્કૂલની મુલાકાત કરાવવા ઈચ્છાનું છું તમે નિશાળે જતા હતા એ સમય પછી ટેકરીઓમાં ઘણો બદલાવ આવી ગયો છે. તમે જ્યારે ભણતા હતા ત્યારે આ ટેકરીઓમાં કોઈ હાઈસ્કૂલ હોય એવું માની શકાય એમ નથી.’

‘ના’, પિતાજીએ કહ્યું : ‘ફક્ત વાંચવા, લખવા અને ગણવા પૂરતું ભણતર. મારી વખતે માંકણનું ભણતર નહોતું અને દાંત ઉપર જંતુ શોધવાનું ભણતર પણ નહોતું અને નાગમાં પણ જંતુ હોય એવું શીખવવામાં આવતું નહોતું. દુનિયા બદલાઈ રહી છે.’

‘હા, એ બદલાઈ રહી છે. આશા રાખીએ કે એ સારા માટે હોય. તમારા છોકરા જેવા અન્ય છોકરાઓ એને બદલવામાં મદદ કરી રહ્યા છે. આ રહ્યો તમારો છોકરો. મેં કહ્યું એ બધું જ એ જાણો છે. તમે આજે મારી સાથે રહો.’

‘હા, હું તમારી સાથે રહીશ. મારે મારા દાંત પરનાં જંતુ જોવાં છે. મારા આખા જીવનમાં મેં કદ્દી જંતુ જોયું નથી. જોયું તે માનવા બરાબર છે.’

પિતાજી પ્રોફેસર હર્બર્ટ સાથે ઓફિસ બહાર નીકળ્યા.

મેં આશા રાખી હતી કે પોતાની પિસ્તોલનું પ્રદર્શન કરવાના કારણે પ્રોફેસર હર્બર્ટ પિતાજીને ગિરફ્તાર નહીં કરાવે. પિતાજી જ્યારે જઘડાનો નિકાલ કરવા જાય છે ત્યારે એમની પિસ્તોલ એમના મિત્ર તરીકેની ગરજ સારે છે.

બેલ વાગ્યો. સ્કૂલ શરૂ થઈ.

છોકરા-છોકરીઓ હારબંધ શાળાના મકાનમાં પ્રવેશતાં હતાં.

એ બધાં સ્વચ્છ અને સફાઈદાર વસ્ત્રોમાં સજજ હતાં.

પિતાજી શાળાના પ્રાંગણામાં એક પર્શ્વિહોણા એલ્યુ વૃક્ષની બાજુમાં ઊભા રહીને હારબંધ શાળાના દ્વારમાં પ્રવેશતાં છોકરા-છોકરીઓને જોઈ રહ્યા હતા. પિતાજીએ ઘેટાના ચામડાનો કોટ પહેરેલો હતો. એમના મોટા બૂટ દોરીથી બાંધીલા હતા અને પગમાં એમણે પહેરેલાં જાડાં મોઝાં બૂટની કિનાર બહાર નીકળેલાં દેખાતાં હતાં. એમના મોટા કાળા હેટમાં કાળા તથા રાખોડી રંગના વાળ જોઈ શકતા હતા. એમનો ચહેરો કઠોર દેખાતો હતો અને એ ચહેરાની ચામડી સૂર્યના તાપમાં શેકડતી

રહેલી હોવાના કારણે વનસ્પતિના સાંઠાના પાકી ગયેલા પાન જેવી થઈ ગયેલી હતી. એમના બાહુ મોટા હતા અને એ જે વૃક્ષની બાજુમાં ઊભા હતા એની બહાર દેખાતા જાડા મૂળ જેવા દેખાતા હતા.

હું જ્યારે મારા પહેલા વર્ગમાં પ્રવેશ્યો ત્યારે મેં જોયું કે પ્રોફેસર હર્બિટ સાથે પિતાજી શાળામાં રાઉન્ડ લઈ રહ્યા હતા. એ બંને અમારા વર્ગમાં આવ્યા અને વર્ગમાં થોડી વાર બેઠા. એ બેઠા હતા ત્યારે ફેડ વુર્ક્સ જેનેને આર્મસ્ટ્રોંગના કાનમાં કહેતાં મેં સાંભળ્યો : ‘પેલો વૃદ્ધ માણસ કોણ છે ? જડ દેખાતો એ માણસ ગામડિયો લાગે છે.’ જેને વળતો જવાબ આઓયો : ‘મને લાગે છે કે તેવના પિતા છે.’ વર્ગનો સમય પૂરો થાય એ પહેલાં પ્રોફેસર હર્બિટ અને પિતાજી ઉઠીને વર્ગ બહાર ગયા. એમને મેં રમતના મેદાન તરફ જતા જોયા. એ વખતે પિતાજીના કોટ નીચેની પિસ્તોલનો અણસાર આવી જતો હતો.

બાપોરે શાળાના ભોજનાલયમાં પ્રોફેસર હર્બિટ રોજ જે નાના ટેબલ પર એકલા જમતા હતા તેના પર અત્યારે પ્રોફેસર હર્બિટ અને પિતાજી બંને જમવા માટે ગોઠવાયા હતા. પિતાજી જમતા હતા તે તરફ છોકરાઓનું ધ્યાન હતું. જમવામાં પિતાજી કાંઠાના બદલે છરીનો ઉપયોગ કરતા હતા. જમનાર મારા પિતા હતા એ જાડીને ઘણા છોકરાઓને દુઃખની લાગણી થઈ. પણ એમને મારા માટે દુઃખી થવાની જરૂર નહોતી. જ્યારે મને સમજાયું કે પિતાજી પ્રોફેસર હર્બિટને ગોળીએ દેવાના નથી અને એ બંને મિત્રો બની ગયા છે ત્યારે મને આનંદ થયો હતો. હવે મને પિતાજીના વર્તન માટે શરમ આવતી નહોતી.

બાપોર પછી જ્યારે અમે જીવશાસ્ત્રના વર્ગમાં ગયા ત્યારે પિતાજી ત્યાં હતા. એ માઈકોસ્કોપની બાજુનાં ઊંચાં સ્ટ્રોમાંના એક પર બેઠેલા હતા. પિતાજીને એમની છરી વડે એક દાંત પરની છારી કાઢતા મેં જોયા. પ્રોફેસર હર્બિટ એ છારીને એક કાચ નીચે રાખીને માઈકોસ્કોપમાં ગોઠવી એ પછી એને આંખને અનુકૂળ આવે એ રીતે બરાબર સરકારી ને પછી પિતાજીને એમણે કહ્યું : ‘લસ્ટર, હવે તમારી આંખને માઈકોસ્કોપ સાથે બરાબર મેળવો અને બીજી આંખ બંધ કરો.’

પિતાજીએ પ્રોફેસરે કહ્યું એમ કર્યું. પછી બોલ્યા : ‘કોણે આવું વિચાર્યું હશે ? શરીરના એક દાંત પર અને શરીરના બરાબર મોઢામાં ! પ્રોફેસર, તમે સાચા છો.’

‘લસ્ટર, જંતુઓની દુનિયા છે. આપણે એમને નરી આંખે જોઈ શકતા નથી. એ જોવા માટે માઈકોસ્કોપનો ઉપયોગ કરવો પડે. આપણા શરીરમાં કરોડો જંતુઓ હોય છે, કેટલાંક નુકસાનકારક અને કેટલાંક શયદાકારક !’

પિતાજી મોહું નીચું રાખીને માઈકોસ્કોપમાં જોવામાં તહ્વીન હતા. એ વખતે

એમનો કોટ નીચે તરફ સરક્યો અને એમની પિસ્તોલ દેખાવા લાગી. પ્રોફેસર હર્બિંના ધ્યાનમાં એ આવ્યું. એમજો સજ્જણ ઉભા થઈને પિસ્તોલ ઢંકાપેલી રહે એવી રીતે કોટને ખેંચીને ઠીક કર્યો.

‘હા, હા.’ એવો ઉદ્ગાર કાઢીને પિતાજીએ એકદમ ઉભા થઈ જઈને કોટને બરાબર સરખો કરી લિધો. પિતાજીનો ચહેરો ચાતોચોળ થઈ ગયો. એમને ખબર હતી કે સ્કૂલમાં આ રીતે પિસ્તોલ લાવી શકાય નહીં અને એનું પ્રદર્શન પણ ન થઈ શકે.

પ્રોફેસર હર્બિં બોલ્યા : ‘અમારી પાસે કણો સાપ (નાગ) છે. ગઈ કાલે અમે એને પકડ્યો હતો. એને કલોરોફોમ આપીશું પછી એના શરીરની વાઢકાપ કરીને એના શરીરમાં પણ જંતુઓ છે તે તમને બતાવીશું.’

‘એવું ન કરતા’, પિતાજી બોલી ઉઠ્યા : ‘હું તમારી વાત માની લઉં છું. તમે કણા સાપને મારતા હો એ જોવા હું ઈચ્છાતો નથી. એવા સાપને હું કદી મારતો નથી. એ જેતીમાં અમને ખૂબ ઉપયોગી છે. મને કણા સાપ ગમે છે અને એવા સાપને મારનાર લોકોને હું વિકારું છું. હું મારી જગ્યા (ખેતર)માં કોઈને એવા સાપને મારવા દેતો નથી.’

વિદ્યાર્થીઓ પિતાજી તરફ જોઈ રહ્યા એ આવું બોલ્યા એ પછી વિદ્યાર્થીઓને એ ગમવા લાગ્યા. પિતાજીના જિસ્સામાં ગન, પણ પાંસળીઓ હેઠળ કુમળું હેયું. પિતાજી ઘેર ખચ્ચરને ન મારે. એ ઘરનાં પાળેલાં થોરને પણ કદી મારતા નહીં.

પ્રોફેસર હર્બિં પિતાજીને પ્રયોગશાળામાં લઈ ગયા. અમે પ્રયોગોનાં કામ માટે વિવિધ પ્રકારનાં સાધનો વાપરતાં હતાં. તે પિતાજીને બતાવ્યાં અને અમે કરેલાં કામ પણ બતાવ્યાં.

દિવસના કાર્યનો છેલ્ખો જીવશાસ્ત્રનો અમારો વર્ગ (તાસ) પૂરો થયો અને અમે બહાર નીકળ્યા.

હવે મારે ચેરીવૃક્ષ ભાંગ્યા નિભિતે બે કલાક કામ કરવાના સમયનો આરંભ થતો હતો. અત્યારે મને એ વાતનો દગદાળો હતો કે અત્યારે મને બે કલાકના કામ માટે રોકાવા દેશે કે કેમ !

પિતાજી મુખ્ય હોલમાં ઉભા હતા અને એ વિદ્યાર્થીઓને બહાર જતા નિરખી રહ્યા હતા. અત્યારે વિદ્યાર્થીઓના વૃન્દ વર્ચે એ લીલાં પાંડડાંથી આચ્છાદિત વૃક્ષમાં સૂક્ષ્મ થઈને ભૂખરા રંગના બની ગયેલા એક પાંડડા જેવા લાગતા હતા.

મેં જાડુ હાથમાં લીધું અને સાફ્સૂઝીનું કામ શરૂ કર્યું એ વખતે પ્રોફેસર હર્બિં મારી પાસે આવ્યા અને એમજો કહ્યું : ‘આજનું કામ તને પછીથી કરવાની છૂટ આપું છું. આજે તું તારા પિતા સાથે ઘેર જા. એ બહાર તારી રાહ જુઓ છે.’

મેં જાડુ મૂકી દીધું. પુસ્તકો લીધાં અને પગથિયાં ઉત્તરીને હું નીચે ગયો. પિતાજીએ કહ્યું : ‘અત્યારે તારે બે કલાક માટે કામ કરવાનું નથી.’

મેં જવાબ આપ્યો : ‘પ્રોફેસર હર્બિટ આજનું કામ પછી કરવાની છૂટ આપી છે અને અત્યારે તમારી સાથે ઘેર જવાનું કહ્યું છે.’

પિતાજી બોલ્યા : ‘ના, એમણે આગાઉ જે કહેલું છે એ પ્રમાણે કરવાનું છે. એ સારા માણસ છે. મારા સમયમાં હતી તેના કરતાં આજની સ્કૂલ બદલાઈ ગયેલી છે. હું હવે ખર્યું પાન હું, ડેવ. હું પછાત હું. આ સ્થળને લાયક નથી. જો પ્રોફેસર છૂટ આપે તો આપણે બંને જાડુ લઈને એક કલાક કામ કરી લઈએ. એમાં તારું દેવું ભરપાઈ થઈ જશે. હું આ માટે પ્રોફેસરને કહીશા.’

પ્રોફેસરનો સંપર્ક થતાં એ બોલ્યા : ‘હું આ દેવું ફોક કરું છું. લસ્ટર, હું તો તમે સમજો એટલું જ દીચ્છતો હતો.’

પિતાજીએ કહ્યું : ‘હું સમજું છું. અને હું સમજું છું એટલા માટે જ કહું છું કે એણે જાડ માટે દેવું ભરપાઈ કરવું જ જોઈએ અને હું એમાં મદદ કરવા માગું છું.’

‘એવું ન કરશો’, પ્રોફેસરે કહ્યું : ‘હવે હું એ બધું મારા માથે લઈ છું.’

પિતાજી બોલ્યા : ‘અમે એવું કરતાં નથી. અમે ન્યાયી અને પ્રામાણિક માણસો છીએ. અમે કશા વગર કશું મેળવી લેવા દીચ્છતા નથી. પ્રોફેસર હર્બિટ અત્યારે તમે ખોટા છો અને હું સાચો છું. તમારે મને સાંભળવો પડશે. તમારી પાસેથી હું ઘણું શીખ્યો. મારા દીકરાએ એ માર્ગ જવું જોઈએ. જગત મને પાઇળ મૂકીને આગળ વધી ગયું છે. મેં ટેકરીઓમાં હળ ચલાવ્યું છે અને મારા કુટુંબને ઉછેર્યું છે. ન્યાયી અને પ્રામાણિક માણસ હું. હું દેવું રાળી દેતો નથી. હું જાતે ઘણું ભણ્યો નથી. પણ સાચું શું અને ખોઢું શું એ સમજું છું.’

પ્રોફેસર હર્બિટ ઘેર ગયા. પિતાજી અને હું રોકાયા અને એક કલાક સાફ્ટ્સ્લી કરી. હાથમાં જાડુ સાથે પિતાજીને જોયા. આ જરા વિચિત્ર લાગતું હતું. ઘેર એમણે કદ્દી આ કામ કર્યું નહોતું. મોમ જ એ કામ કરતી. પિતાજી કહેતા ‘હું વાળવા-જૂડવાનું કામ કરી શકતો નથી અને કરું તો ભોંયતળિયા ઉપર કચરાની રેખાઓ રહી જવાની, પણ ડેવ, અહીં હું મારાથી બને એટલું ઉત્તમ કામ કરીશ. સ્કૂલની બાબતમાં હું ખોટો હતો.

મેં કહ્યું : ‘શાળામાં પિસ્તોલ લાવવા માટે અને એને ઓફિસમાં ખુલ્લી મૂકવાના કારણે પ્રોફેસર હર્બિટ તમારા ઉપર વોરન્ટ કથાવી શક્યા હોત એ તમે જાણતા હતું ?’

પિતાજી બોલ્યા : ‘એ બધું બરાબર થઈ ગયું છે. પ્રોફેસર હર્બિટ હવે કોટૈનો આશ્રય નહીં લે. હું એમને ગમું છું અને એ મને ગમે છે. એમણે મને કેટલીક જાગકારી

આપી. તારે નિશાળે જવું જોઈએ. ટેકરીઓમાં કામ કરનારો હું ખડતલ અને મજબૂત માણસ. મેં ઘણું અવધું કામ કર્યું છે. પણ તેવ, હું પણત રહી ગયો છું. હું નાનો માણસ છું. મારા હાથ ફરતાં તારા હાથ નરમ રહેવાના. તારાં વસ્ત્રો સારાં રહેવાનાં. મારા વૃદ્ધ પિતા કરતાં તું વધારે ચોખ્યો દેવાવાનો. તેવ, દેવું ભરવાની બાબતમાં ખ્યાલ રાખવો અને પ્રામાણિક રહેવું. પ્રાણીઓ પ્રત્યે દ્યા રાખવી અને સાપ બાબતમાં કશી ઉપાયિ ન કરવી. આ બધું આજે હું સ્કૂલમાંથી પામ્યો છું. નાગને ઊંઘવા દેવા અને તેમનો વાઢકાપ ન કરવો.’

અમે ઘેર પહોંચ્યા ત્યારે મોહું થઈ ગયું હતું. આકાશમાં તારાઓ ચમકતા હતા. ભોંય ઠરી ગઈ હતી. ઘેર જવામાં પિતાજીએ વધારે સમય લીધો. ગઈ રાતે હું દોડી શક્યો હતો એમ આજે દોડી ન શક્યો. અમે બધું કામ કરી રહ્યા અને જમી લીધું ત્યાં સુધીમાં દસ વાગી ગયા હતા. પિતાજી તાપણાની જીવા આગળ બેઠા. દિવસના પોતાના અનુભવ વિશેની વાત કરતાં એમણે મોમને કહ્યું કે પોતે એને કોઈક વાર હાઈસ્ક્વુલ લઈ જશે અને જંતુનું દર્શન કરાવશે. પિતાજીએ હાઈસ્ક્વુલ વિશે અને મજાના માણસ પ્રોફેસર હર્બર્ટ વિશે પણ કહ્યું. અત્યારની હાઈસ્ક્વુલ પોતાના વખતની નિશાળ કરતાં કેવી જુદી હતી એ વિશે પણ કહ્યું.



## આખરી પાઠ

**મૂ. લે. અલજાન્સો ડોટેટ; અનુ. પુષ્કરરાય જોખી**

તે દિવસે થોડો મોડો જ હું સ્કૂલે જવા નીકળ્યો હતો. અમારા શિક્ષક મિ. એમ. ડ્યુયેલે ગઈ કાલે કહ્યું હતું કે આજના દિવસે ‘પાર્ટીસિપલ’ના વિશે પ્રશ્નો પૂછશે. મેં તો આ વિષયની તૈયારી બિલકુલ કરી ન હતી. મને બીક લાગતી હતી કે શિક્ષક નારાજ થઈ જશે અને તેને કારણે મારે સજા ભોગવતી પડશે. થોડી કાણો તો હું એવું વિચારી રહ્યો હતો કે આજે ક્યાંક ભાગી જાઉં અને આખો દિવસ ક્યાંક સ્કૂલની બહાર જ વિતાવું. આજનો દિવસ ખુશમિજાજ હતો, સુંદર તડકે ફેલાયેલો હતો. જંગલોમાં પંખીઓનો કલરવ ગૂંજું રહ્યો હતો. સો મિલની પાણણ, ખુલ્લા મેદાનમાં, પ્રશિયન સૈનિકો કવાયત કરી રહ્યા હતા. આ બધું ‘પાર્ટીસિપલ’ની સરખામહીમાં કેટલું સુંદર અને આકર્ષક હતું! છતાં પણ આ પ્રકારની ઠથણને દ્યાવી દેવાની માનસિક શક્તિ મારી અંદર હતી. હું સ્કૂલની તરરું દોડી ગયો.

જ્યારે હું ટાઉનહોલની સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે ત્યાંના ‘બુલેટિન બોર્ડ’ની સામે કેટલાયે લોકો એકઠા થયા હતા. છેલ્લાં બે વરસોમાં બધા માઠા સમાચારો અમને અહીંથી મળ્યા હતા. લડાઈમાં પરાજય, સેનાની ટુકડીઓનું આગમન, કમાન્ડિંગ ઓફિસરના હુકમો વગેરે. હવે નવા સમાચાર શું હશે? એવું વિચારતો હું આગળ વધતો ગયો.

તે વખતે, ત્યાં અમારો લુહાર મિ. વાક્ટર જે પોતાના પ્રતિનિધિ દ્વારા તે બુલેટિનને વંચાવી રહ્યો હતો, તેણે મારું નામ પુકારી મને કહ્યું, ‘બેય, આટનું દોડવાની જરૂર નથી, સ્ક્રૂલે પહોંચવા માટે હજી પૂરતો સમય (બાકી) છે.’

મને લાગ્યું તે મારી મજાક ઉડાવી રહ્યો છે. હું રોકાયો નહિ અને પહેલાં કરતાં પણ વધારે ઝડપથી દોડીને શિક્ષકના બગ્ગીચાએ પહોંચી ગયો.

સામાન્ય રીતે સ્કૂલ શરૂ થવાના સમયે ત્યાં ખૂબ ભીડ-ભાડ, ગરબડ, શોરબકોર મચતાં રહેતાં હોય છે, જે ખૂબ દૂર સુધી શેરીઓમાં સંભળતાં હોય છે. ડેસ્કોનું ખોલવું, બંધ થવું, બધા વિદ્યાર્થીઓ સાથે મળીને કાન પર હાથ રાખીને જોર જોરથી પાઢીનું રટણ કરવું અને શિક્ષકનું વારંવાર રૂલરનું મેજ પર પટકતા રહેવું, આ બધા અવાજો દૂર સુધી સંભલાતા હોય. પરંતુ આજનો માહોલ બિલકુલ અલગ હતો. ત્યાં સઘણું સ્તરથી હતું. હું વિચારી રહ્યો હતો કે હરરોજની જેમ જ્યારે હું ચૂપચાપ બધાથી નજર બચાવીને, પોતાની જગ્યાએ પહોંચીશ ત્યારે ખૂબ ધમાલ મરી જશે, પરંતુ આજે તેવું કંઈ પણ થયું નહિ. સઘણું રવિવારની સવાર જેવું શાંત વાતાવરણ હતું. મેં બારી બહારથી જ જોઈ લીધું હતું કે મારા બધા સહાધ્યાથી પોતપોતાની જગ્યા પર બેસી ગયા હતા અને અમારા શિક્ષક બગલમાં ભયાનક રૂલર (અંકડી) રાખીને, અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ઘૂમી રહ્યા હતા. મારે તો વર્ગનું બારણું ખોલીને સૌની સામે થઈને મારી બેઠક સુધી પહોંચવું પડ્યું. તમે અનુમાન લગાવી શકો છો કે હું કેટલો ગભરાયેલો હતો અને ભોડપથી મારું મોં કેટલું લાલ-લાલ થઈ ગયું હતું!

પરંતુ એવું કશું પણ થયું નહિ જેને કારણે હું ડરી રહ્યો હતો. શિક્ષકે મને જોયો અને ધીમા સ્વરે કહ્યું, ‘જલદી તારી જગ્યાએ બેસી જા, નાનકડ ફાન્સ, આજ તારા વિના જ અમે શરૂ કરવાના હતા.’

હું બેન્ચની ઉપરથી છલાંગ મારીને પોતાની જગ્યાએ પહોંચી બેસી ગયો. હવે મારા હૈયાના ધબકારાં ઘણા ઓછા થઈ ગયા હતા. મેં જોયું કે શિક્ષક આજે પોતાનો સુંદર લીલા રંગનો કોટ, જુર્રવાળું શર્ટ અને ભરત ભરેલી રેશમની કાળા રંગની ટોપીના પોશાકમાં હતા. આ પ્રકારનો પોશાક તેઓ ખાસ કરીને ઇન્સ્પેક્શનના સમયે અથવા તો ઇનામવિતરણ જેવા વિશેષ પ્રસંગે પહેરતા હતા. મને તો આજે એવું લાગતું હતું

કે આખી સ્કૂલ આજે પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. ખૂબ વિચિત્ર અને ગંભીર બધું લાગતું હતું, પરંતુ આ બધાથી મને નવાઈ પમાડે તેવી વાત એ હતી કે અમારા વર્ગખંડમાં પાછળના ભાગમાં થોડીક બેન્ચ જે હંમેશાં ખાલી જ પડી રહેતી હતી, તે આજે ગામના લોકોથી પૂરેપૂરી ભરાઈ ગઈ હતી. ત્રણ ખૂણિયાવાળો હેટ પહેલો વૃદ્ધ હૈસર, માજ મેયર સાહેબ, માજ પોસ્ટમાસ્ટર અને અન્ય કેટલાંય ગ્રામવાસીઓ પાછલી બેન્ચ પર બેઠો હતાં. જે સૌના ચહેરાઓ ઉપર વિષણુતા છવાયેલી હતી.

હું આ બધું જોઈને દંગ થઈ ગયો હતો. એટલામાં શિક્ષક પોતાની ખુરસી ઉપર બેસી ગયા અને તરત જ પોતાના મૃદુ અને ગંભીર અવાજમાં વર્ગને સંબોધવા લાગ્યા :

“મારાં બાળકો, આજે જે કંઈ હું તમને આપી રહ્યો છું, તે મારો અહીંનો આખરી પાઠ છે. બર્લિનથી આદેશ આવ્યો છે કે આજના દિવસ પછી અલ્યોસ અને લોરેન ગામોમાં આવેલી બધી શાળાઓમાં ફેન્ચને બદલે માત્ર જર્મન ભાષા જ શીખવવામાં આવશે. કાઢે તમારા નવા શિક્ષક આવી જશે. આજનો આપણો પાઠ આખરી ફેન્ચ પાઠ રહેશે. આ કારણે આપ સૌ લોકો, આજના પાઠ ઉપર પોતાનું પૂરું ધ્યાન આપશો.”

આખાયે વર્ગની તાળીઓથી ઓરડો ગુંજુ ઊંઘ્યો.

ઓહ ! આ દુષ્ટ જર્મન લોકો. યાઉનહોલના ‘બુલેટિન બોર્ડ’ પર કદાચ એના વિશે લખવામાં આવ્યું હતું.

મારો આખરી ફેન્ચ પાઠ ! હજુ પણ મને સારી રીતે લખતાં પણ નથી આવડતું. મારું આગળ ઉપર શું થશે ? ભગવાન જ જાણો ! આ મારી જ ભૂલ છે કે આજ સુધી મેં ભાષાવા-લખવામાં પૂરું ધ્યાન નથી આપ્યું. તેને બદલે પંખીઓનાં ઈંડાં ચોરવામાં, અથવા ‘સોઅર’ની ઉપરથી લપસવાની રમતમાં વધારે સમય બરબાદ કરતો રહ્યો. પુસ્તકો મને માથાનો મોટો દુખાવો લાગતાં હતાં અને તેને ઊંચકાને સ્કૂલે લઈ જવાનું ખૂબ કષ્ટદાયક લાગતું હતું. આજે એકાએક તે પુસ્તકો મને અતિશય પ્રિય લાગવા મંડચાં. વ્યાકરણ અને સંતોનાં ચારિત્રોવાળાં ઇતિહાસનાં પુસ્તકો આજે મને પુરાણા મિત્રો જેવાં લાગવા મંડચાં. તે રીતે અમારા શિક્ષક શ્રીમાન એમ. ધ્યામેલ પણ. હવે તે અહીંથી ચાલ્યા જશે. આજના દિવસ પછી હું તેમને જોઈ શકીશ નહિ. તેની સાથે વાત પણ કરી શકીશ નહિ. આવા વિચારો જ્યારે મારા મનમાં ઊભરાવા લાગ્યા ત્યારે તેમનો વિક્ષિપ્ત સ્વભાવ અને દરરોજ તેની બગલમાં બિરાજમાન તેવું ભયાનક રૂલર આ બધી ચીજો મારા દિમાગમાંથી ગાયબ થઈ ગઈ.

બિચારા શિક્ષક ! આજે અહીં તેમનો આખરી પાઠ છે. આ દિવસનું સમ્માન રાખવાને માટે તેઓ ફક્ત રવિવારને દિવસે પહેરવામાં આવતાં સારાં કપડાં પહેરીને આવ્યા છે. હવે મારી સમજમાં આવી ગયું કે શા માટે અમારા ગામનાં બુરુર્ગ (ઘરડાં)

લોકો અહીં પધાર્યા છે. તે લોકો પણ પણતાઈ રહ્યાં છે કે તેઓ પણ વધુ ભાષ્યા ન હતા. અખંડિત ચાલીસ વર્ષો સુધી નિષ્ઠા અને પ્રામાણિકતાભરી શિક્ષકની પવિત્ર સેવા આપવાવાળા આ માણસ સમક્ષ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી આ બધાં લોકો આજે અહીં એકઠાં થયાં હતાં. તેની સાથે, પોતાના દેશને, જે આજે પોતાનો રહ્યો નથી, તેને ગૌરવ-આદર સમર્પિત કરવાનો ઉદ્દેશ પણ છે, તે લોકોનો.

જ્યારે હું આ વિચારોમાં દૂબેલો હતો, મને ભાસ થયો કે કોઈ મારું નામ લઈ પુકારી રહ્યું છે. ઓહ ! હવે પાઠનો જવાબ દેવાનો મારો વારો આવી ગયો હતો. ‘પાર્ટિસિપલ’ના તે ભયાનક નિયમોને, સ્પષ્ટ રૂપે, મોટા અવાજે, ટીક ટીક રૂપે હું બોલી શક્કું, તે સ્થિતિને પામવા માટે, હું મારું કંઈ પણ આપવા માટે રાજી હતો, પરંતુ થયું શું ? પ્રારંભ કરતી વેળાએ જ હું થોથવાઈ ગયો, શબ્દ નીકળ્યા નહિ અને આગળ કશું પણ કહેવા માટે અસમર્થ થઈને હું ડેસ્ક પકડીને ઊભો રહી ગયો. હૈયાના ધબકારા વધી ગયાં. મોં ઊંચું કરી જોવાની હિંમત પણ રહી નહીં.

શિક્ષકને એ કહેતાં મેં સાંભળ્યા, ‘નાનકડા ફાન્સ, હું જિજાઈશ નહિ. તને બહુ ખરાબ લાગ્યું હશે. આમ કેમ થાય છે, જુઓ. રોજબરોજ આપણે આપણી જાતને કહેતા હોઈએ છીએ, ‘વાહ ! મારી પાસે ઘણો સમય છે. હું આ કાલે પણ શીખી લઈશ, આ શીખવામાં કેટલો સમય લાગવાનો ? પરંતુ તેનું પરિણામ શું આવે છે ? તને ખબર પડી ને ? હવે સૌથી પાછળ જે સજજનો બેઠાં છે, તે લોકોને આ કહેવાનો તને હક છે. તું હંમેશાં કહે છે કે તું એક સાચો ફેન્ચ છો. તને (તારી) પોતાની માતૃભાષા લખવાનું, વાંચવાનું અને બોલવાનું કેમ નથી આવડતું ? પરંતુ, તું એકલો નહિ, નાનકડા ફાન્સ, આપણે બધા આપણી જાતને કોસચા યોગ્ય બની ગયા છીએ.’

‘તારાં માતા-પિતા તને ભાષાવવાને માટે ઉત્સુક ન હતાં. તેઓ ઈચ્છિતાં હતાં કે તને કયાંક બેતરમાં અથવા મિલમાં કામ કરવા મોકલે તો વધુ સારું થાત. આવું કર્યું હોત તો આવક થોડી વધી શકતી હતી. અને હું ? હું પણ દૂષણપાત્ર છું. મેં ભાષાવવાને સમયે, કેટલાયે દિવસો સુધી તને મારા બગીચામાં ઝડાંછોડને પાણી પાવા મોકલ્યો હતો ને ? અને જ્યારે પણ મારે માધલીઓને પકડવાનું જવાનું થતું હતું ત્યારે તમને લોકોને રજ આપી દેતો હતો.’

શિક્ષક આ રીતે કંઈ-કેટલીયે વાતો કહેતા ગયા. તેઓએ ફેન્ચ ભાષા વિશે વાત કરી. તેઓએ કહ્યું કે આ ભાષા વિશ્વભરમાં અતિ સુંદર, અતિ શુદ્ધ અને તર્કબદ્ધ ભાષા છે. આપણે સૌચે મળીને તેનું રક્ષણ કરવું જોઈએ. આ ભાષાને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ, કારણ કે જ્યાં સુધી આપણે લોકો ગુલામીમાં છીએ ત્યાં સુધી એ કારાગૃહને માટે એક ચાવીના રૂપે કામ કરતી રહેશે. આટલું બોલ્યા પછી તેમણે

વ्याकरणनुं पुस्तक खोल्यु अने तेमांथी एક पाठनुं विवरण આयुं. में तेने एटली સारી રीતे समજ લीदूં કे मने પोતाने ते बाचामां આशર्य थयु. तेओએ જे कઈ શીખल्यु ते केटलું સ્પષ्ट અने સરળ હતुं ! હવे મनે ખ्याल આવ્યો કે અગાઉના દિવસોમાં મેં ક્યારેય ભણવાની વાતોને મન લગાવીને (ધ્યાનપૂર્વક) સાંભળી જ ન હતી.

વ्याकરणનો પાઠ પૂરો થયા પછી શુદ્ધ લેખનનો પ્રારંભ થયો. આજે હ્યામેલ સર અમારા બધા માટે એક નવી નોટબુક લાવ્યા હતા. તેના મુખપૃષ્ઠ ઉપર સુંદર અક્ષરોમાં ‘ફાસ અલ્સેસ’ શાન્દ લખવામાં આવ્યા હતા. આ દશ્ય જોવાલાયક હતું કે હરએક વિદ્યાર્થી શાંત અને મૌન રૂપે મન લગાવીને નોટબુકમાં લખી રહ્યો હતો અને માત્ર લેખિનીનો કર-કર એવો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે દરમિયાન કેટલાંયે ટીડાં ઊડીને અંદર આવ્યાં, પરંતુ કોઈએ તેમના તરફ ધ્યાન ન આયું. નાનાં બાળકો એ પણ. તેઓ પણ પોતાની ફિશ નોટબુકોમાં લખી રહ્યાં હતાં, જાણે કે તે પણ ફેન્ચ જ હતાં. છત ઉપર કબૂતરો બેઢાં બેઢાં ધૂ... ધૂ... ધૂ... ધૂ... ગાઈ રહ્યાં હતાં. લખતાં લખતાં હું એ વિચારી ઊડકો – શું આ લોકો કબૂતરોને પણ જર્મન ભાષામાં ગાવા માટે જબરદસ્તી કરશો ?

નોટબુકમાં લખતી વખતે વચ્ચે વચ્ચે હું માયું ઊંચું કરીને શિક્ષકને જોઈ રહ્યો હતો. સર એમ. હ્યામેલ ખુરશી ઉપર નિશ્ચલ થઈને બેઠા હતા. ક્યારેક આ તરફ, ક્યારેક તે તરફ; ક્યારેક તો એક તરફ નજર ધૂમાવી જોઈ રહ્યા હતા. મેં વિચાર્યુ કે કદાચ શિક્ષક બાળકોથી ભરેલો આ નાનકડો વર્ગખંડ પોતાની આંખોમાં સમાવી લેવા ઈચ્છતા હશે. ચાળીસ વર્ષથી તે અહીં હતા. આ કાર્ય પર બારીની બહાર તેણે પોતે બનાવેલું નાનકડું એવું ઉદ્ઘાન છે. બેન્ચ, ડેસ્ક વગેરે ચીજો ઘસાઈ ઘસાઈને સુન્વાળી થઈ ગઈ હતી. ઉદ્ઘાનનાં વૃક્ષો લાંબાં થઈ ગયાં છે અને હોપવાયિનની વેલ જે તેમણે પોતે વાતી હતી, તે બારીમાંથી ચઢીને આખી છત પર ફેલાઈ ગઈ છે. આ બધી ચીજોને છોડીને અહીંથી જતાં તેમને કેવું લાગી રહ્યું હશે ? ઉપલા માળના ઓરડામાં, તેમની નાની બેન સામાન બાંધતાં બાંધતાં બોલી રહી છે. આ સાંભળીને તેને કેવું લાગી રહ્યું હશે ?! કાલે જ તેને અહીંથી આ દેશમાંથી ચાલ્યા જવાનું છે ને !

પરંતુ તેનું હદ્ય સંયમપૂર્વ અને દઢ હતું. તે દિવસે દરેક પ્રકારનો અભ્યાસ પૂરો થયો ત્યાં સુધી સારી રીતે નિભાવવાનું ધૈર્ય અને દઢતા તેમનામાં હતાં. શુદ્ધ લેખનની પછી અમારે ઈતિહાસનો પાઠ ભણવાનો હતો. ત્યાર બાદ નાનાં-નાનાં બાળકોના ‘બ, બે, બિ, બો, બુ’ વગેરે અક્ષરોને રાગરૂપમાં ભણવાનું શરૂ થયું. વર્ગખંડની પાછળ બેઠેલો બૂઢો હૌસર, પોતાની આંખો પર ચેશમા ચઢાવીને, પોતાની પ્રાઇમરને બંને હાથોથી પકડીને, બાળકોની સાથે પઠન કરી રહ્યો હતો. તેનો ધ્વનિ

ઉદ્ઘેગથી કંપિત થઈ રહ્યો હતો. અક્ષરોને વાંચવામાં તેને જે તકલીફ થઈ રહી હતી, તે જોઈને અમને હસતું આવી રહ્યું હતું અને સાથે રહતું પણ. આહા ! અમારો આખરી પાઠ કેટલો ગહન રીતે મારી સ્મૃતિમાં જડાઈ ગયો છે !

ચર્ચના ઘડિયાળમાં બાર વાગ્યા હતા. તે કષેણે ઘંટ પણ બજ્યો. તે સમયે કવાયતમાંથી પાછી ફરી રહેલી પ્રશ્નિયન પલટનની ટ્રમ્પેટનો અવાજ પણ સંભળાયો. મિ. એમ. હ્યામેલ મ્લાન વદને ખુરશીમાંથી ઉઠી ઉભા થયા. મેં ક્યારેય જોયું ન હતું કે તેઓ આટલા લાંબા માણસ હતા.

“મિત્રો,” તેઓએ કહ્યું, “હું... હું...” કંચ રૂંધાવાને કારણો — દૂમો ભરાઈ જવાને લીધે તેઓ આગળ કંઈ પણ બોલી ન શક્યા.

બ્લેકબોર્ડની તરફ ફરીને, હાથમાં એક ચોક લીધો અને પોતાની પૂરી તાકાત લગાવીને મોટા મોટા અક્ષરોમાં લખવા લાગ્યા —

‘Vive La France !’ (ફ્રાન્સની જ્ય હો !)

લખવાનું પૂરું થતાં જ, તેઓ પોતાનું માથું દીવાલ સાથે ટેકવીને ઉભા થઈ ગયા અને એક શાઢ પણ કહ્યા વિના હાથથી જ સંકેત કરતા રહ્યા —

‘શાળા છૂટી ગઈ છે. તમે લોકો જઈ શકો છો.’

## અભિનુકૃતમાં ઊગેલું ગુલાબ : નારાયણ દેસાઈ

### ■ શરીરી વીજળીવાળા ■

‘અભિનુકૃતમાં ઊગેલું ગુલાબ’ એ નારાયણ દેસાઈ દ્વારા લખાયેલી મહાદેવ દેસાઈની જીવનકથા છે. આપણે ત્યાં પુત્ર દ્વારા પિતાની જીવનકથા લખાયાના અન્ય દાખલા છે પરંતુ આ જીવનકથા જરા વિશિષ્ટ છે. આ જીવનકથાના નાયક મહાદેવ દેસાઈ છે પરંતુ એના મહાનાયક મોહનદાસ કરમંદ ગાંધી છે. ગાંધીજી નામના કેન્દ્રની આસપાસ પોતાનું જીવનચક પૂરું કરનાર મહાદેવભાઈની વાત લખનારને ગાંધીજીની વાત કર્યા વગર ચાલે જ નહીં. એટલે જ જીવનકથાની ભૂમિકા બાંધતાં નારાયણ દેસાઈ સ્પષ્ટતા કરે છે : ‘મહાદેવભાઈનું કામ સમજવા આપણે આ કથામાં અત્યારથી માંડીને છેવટ સુધી વારંવાર ગાંધીજીનું કામ સમજવું પડશે. અને ગાંધીજી એ પચ્ચીસ વર્ષના ગાળામાં મોટા ભાગે દેશના વિવેકબુદ્ધ અને અંતરાત્મા રૂપે કામ કરી રહ્યા હતા, તેથી આપણે ઠેર ઠેર દેશના વાતાવરણને પણ સમજવું પડશે. તે વિના મહાદેવની અંતરકથા છતી નહીં થાય. જ્યાં મહાદેવની જીવનધારા એટલે ગાંધીજીના તીર્થરાજ પ્રયાગમાં મળી ગયેલી સરસ્વતી, અને ગાંધીજીની પોતાની ગંગા જ્યાં આ ભારતના માનવના મહાસાગરમાં મળી જતો ગંગાસાગર-સંગમ હોય, ત્યાં નોખાં નોખાં તીર્થમાં સ્નાન કે નોખાં નોખાં જળનું પાન શક્ય પણ નથી અને ઠિણ પણ નથી.’ (૭૬) જેમના જીવનની ક્ષણેક્ષણ ગાંધીજી સાથે સંકળાયેલી હતી એવા મહાદેવભાઈ વિશે લખવામાં નારાયણ દેસાઈને પણ મૂંજવણ તો થઈ જ હશે. જે વ્યક્તિએ ગાંધીજીનો બોલેલો અને લખેલો અક્ષરેઅક્ષર સાચબ્યો, પણ પોતા વિશે કશું ના લખ્યું એના વિશે કઈ રીતે લખવું એની મૂંજવણ... પણ મહાદેવભાઈની ડાયરીઓએ લેખકને રસ્તો સુઝાડ્યો : ‘મહાદેવ જો મોહનમાં મળી જવાથી ન મળતા હોય તો એની શોધ મોહનમાં જ કર ને...’ ગાંધીમાં એકરૂપ થઈ ગયેલા મહાદેવના ચરિત્રલેખક નોંધે છે : ‘ગાંધીજીનો છેડો પકડયો એટલે મહાદેવભાઈને મળ્યા વગર છૂટકો જ નહોતો.’ (૧૫)

૭૨૧ પાનાં અને ૪૪ પ્રકરણોમાં વિસ્તરેલી આ જીવનકથાના કેન્દ્રમાં મહાદેવ નથી, મોહન છે. કુલ પાંચ ખંડ : સમૃતિ (મૃત્યુની વાત), પ્રસ્તુતિ (જન્મ, ભાષાતર,

દિશાશોધ), પ્રીતિ (ગાંધીજી સાથેનું તારમૈત્રક પ્રેમની સત્તા સુધી વિસ્તરે), ધૂતિ (સ્વવિકાસની સમાંતરે સંપૂર્ણ સમર્પણ) અને આહૃતિ. ખંડોની જેમ જ પ્રકરણોનાં શીર્ષકો પણ સૂચનાત્મક છે. આરંભ જ ‘મહાદેવ, ઊઠો મહાદેવ !’ એવી ગાંધીની બૂમથી, દેશ આખાના હૈયાને હીબકે ચડાવતા અકાળ મૃત્યુથી થાય. ને પછી જીવનકથાની માંડણી થાય. ગાંધી જાથે પહેલી નજરને પ્રેમ થાય તે પ્રકરણ ‘તારમૈત્રક’, ચંપારણ સત્ત્યાગ્રહનું શીર્ષક ‘ધર્મયુદ્ધ’ દાંડીકૂચ્યવાળા પ્રકરણનું શીર્ષક ‘મહાભિનિજમણા’, ગાંધી-મહાદેવસંઘર્ષ તે ‘અજિનિંહુંનું ગુલાબ’ તો મહાદેવની શક્તિઓનો અતિશય ઉપયોગ અને કથળતા સ્વાસ્થ્યની વાત કરતું પ્રકરણ તે ‘ધસાનું સુપડ’. નારાયણ દેસાઈ વાચકને સંબોધવાને બદલે એને સંડોવતા જોઈને વાત માંડે છે. દા.ત., ‘આપણા કથાનાયકનો જન્મ ગુજરાતની પણિયા પણીમાં થયો.’ ‘એમનું બાળપણ કેવા દેશકાળમાં વીત્યું તે જરા જોઈ લઈએ....’ (૨૧). બે વાત કે બે પ્રસંગને સરસ રીતે જોડી આપે છે લેખક. દા. ત., ૧૯૨૮માં પોરલંદરના દીવાનના પાકા મકાનમાં એક અંધારી ઓરડીમાં જ્યાં ગાંધીનો જન્મ થયો હતો તે જોઈ મહાદેવે ભાવુક બનીને લખ્યું હતું, ‘બાપુના જૂના ઘરનાં દર્શન કર્યા, એ ઓરડાનો અંધકાર જોઈને સહેજ મનમાં થયું કે ભગવાને ઘોર અધારું ફેડવાને માટે જ બાપુને મોકલ્યા હોય ને !’ (૨૪). નારાયણ દેસાઈ તરત લખે છે : ‘એ રાષ્ટ્ર દીપકની ખાતર પોતાના જીવનનું પૂરેપૂરું તેલ બાળી નાખનાર મહાદેવનું જન્મસ્થળ જોઈને કોઈને મહાદેવનાં જ પેલાં વચનો યાદ આવી જાય તો એમાં કાઈ નવાઈ કહેવાય ?’ (૨૪). ગાંધીથી અલગ મહાદેવનું જીવન જ નહોતું એટલે ગાંધીની વાતો આવે જ, છતાં જ્યાં વાળી શકાય ત્યાં માત્ર નામોલ્યેખ સાથે સમગ્ર પ્રસંગ કે ઘટનાકમ લેખક રણે છે. આ ગાંધીની કથા નથી તે બાબતે સભાન લેખક મહાદેવ પકડાયા ત્યાં દાંડી સત્ત્યાગ્રહની વાત સમેટી લે છે પરંતુ ક્યારેક ગાંધી અને દેશ એટલી હંદ કેન્દ્રમાં રહ્યા છે કે મહાદેવ બિલકુલ જ ખસી જાય છે પરિધિ પર. દા. ત., ‘એકત્રાયજી’ જેવાં પ્રકરણ... આ જીવનકથાને શા માટે અકાદમી-પુરસ્કાર મળ્યો હશે એનો જવાબ લેખકની અભિવ્યક્તિમાંથી પણ મળે છે. દા.ત.,

- મહાદેવની પ્રવૃત્તિઓનો તેઓ ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી થોડા જ સમયમાં શંકરની જયમાંથી છૂટેલી ગંગાની જેમ વિસ્તાર થવા લાગેલો. (૧૫૪)
  - મહાદેવભાઈને પોતાના સૌથી પ્રિય એવા વિષય ગાંધીજી ઉપર બોલવાનું આવે ત્યારે તેઓ માણેકથારી પૂનમના ચાંદાની જેમ સોણે કળાએ ખીલી ઊંઠતા (૩૦૨)
  - ગાંધીજી જે રીતે પિડ આગળ વર્તતા તેને મહાદેવ બ્રહ્માંડ આગળ છતું કરતા.
- (૪૩૪)

- મહાદેવના થાક વિશે : ફેલાવતી ફેલાવતી લગભગ છેડે આવી ગઈ હતી.

(૭૦૪)

આભિવ્યક્તિ ઉપરાંત કથાબંધ, વસ્તુવક્ષી નિરૂપણ, ભાષાની પ્રવાહિતાનો પણ આ ચરિત્રગ્રંથને વિશિષ્ટતા બક્ષવામાં ફાળો છે. - શક્ય હોય ત્યાં સુધી તથ્યોને બોલવા દઈ નારાયણ દેસાઈએ મહાદેવભાઈની ચરિત્રગાથા ગાઈ છે. મહાદેવભાઈની ગાંધીભક્તિ, અન્ય સ્ત્રીઓ સાથેના એમના સંબંધો, દુર્ગાબહેન સાથેનું દામ્પત્ય, ગાંધીજી સાથેનો સંઘર્ષ વગેરે એવી બાબતો હતી જ્યાં લેખકના તાટસ્થયની કસોટી થઈ શકે, પરંતુ નારાયણ દેસાઈ એ તમામ પ્રસંગોના આદેખનમાં પૂરા વિવેક સાથે તટસ્થ રહ્યા છે. જરાક ગાંધીપદ્ધે ઠળ્યા છે પરંતુ પિતાનો પક્ષ એમણે કશે નથી લીધો. પોતાની જાતને ગાંધીજીના ‘પીર, બબરચી, ભિસ્તી, પર’ કે ‘હમાલ’ તરીકે ઓળખાવતા મહાદેવ દેસાઈના વ્યક્તિત્વનાં લગભગ તમામ પાસાં આ જીવનકથામાં નારાયણ દેસાઈએ પૂરા સામર્થ્યની આદેખ્યાં છે. ગાંધીજીના ગાડોશ મહાદેવ માત્ર એમના લહિયા નહોતા, એ ગાંધીવિચારના સક્ષમ ભાષ્યકાર હતા, એક ઉત્તમ પત્રકાર, વિચારક, ચિંતક મહાદેવના વ્યક્તિત્વનાં અતિશય ઋજુ પાસાં પણ અહીં ઊજાગર થયાં છે. એમણે અનેક વાર ગાંધીજીના વિચારો કે નિર્ણયો બદલવામાં ભાગ ભજવેલો, એમના વતી વિષ્ટિકાર બનેલા, એમની વ્યૂહરચનાઓને આકાર આપેલો અને અમલમાં પણ મૂકેલી.... લેખકે હંઝાવી દે એટલા સંદર્ભમાંથી પસાર થયા પછી આ જીવનકથા લખી છે તે છીતાં મહાદેવ દેસાઈની વાત કરવા માટે હું અન્ય ગ્રંથોનો આધાર લઈશ.

આ મહાદેવ દેસાઈની જીવનકથા છે. એટલે મારી વાતના કેન્દ્રમાં પણ મહાદેવ દેસાઈ જ રહેશે. વિશ્વાળ વાચન, ડાંડું ચિંતન કરવાની ક્ષમતા, ભાષાપ્રાસૂત્વ તથા અનુવાદ બાબતે અલ્લ મહાદેવભાઈનું ભુવન મહોહારી વ્યક્તિત્વ, એમના ગાંધીજી સાથેના સંબંધો, માન્યામાં ન આવે એવું ગાંધી પ્રત્યેનું એમનું સમર્પણ, એક માણસ કરી શકે તેના કરતાં અનેકગણાં કામ કરી શકવાની એમની ક્ષમતા, જાતને શૂન્ય કરી દેવાની આવહત વગેરે વિશે મારે વાત કરવી છે. સુરત પાસેના સાવ નાનકડા ગામની અંધારી ઓરડીમાં ૧-૧-૧૮૮૨ના રોજ જન્મેલા મહાદેવ નાનપણમાં ખારવાઓના હાથનું પાણી પીવાઈ જાય તો વટલાઈ જવાય એવા ડરને કારણે કલાકો સુધી તરસ્યા રહેલા, પણ ગાંધીજીના સ્પર્શ અસ્પૃષ્યતાનિવારણ માટે કામ કરતા, પાયખાનાં સાફ કરતાં થયેલાં. નાનપણમાં એકેય કામ જાતે ન કરી શકતા મહાદેવ પછીથી ગાંધીજીનાં ખાદીનાં જાડાં કપડાં ધોતા, રસોઈ કરતા, સરસામાન સાચવતા કઈ રીતે થયા ? જે મહાદેવને કપડાં ધોતા હાથમાં ફરઝોલા થતા એ પછીથી અલહાબાદની અતિશય આકરી જેલમાં કઈ રીતે ખુશબુશાલ રહેતા ? ગાંધીના

બક્ઝિતવમાં એવું શું જાહું હતું કે મહાદેવ અને એમના જેવા અનેક વજ જેવા બની જતા હતા ?... મારે આ વાત કરવી છે એટલે સ્વાત્માવિક જ મહાદેવની સમાંતરે મોહનની ગાથા ગુંથાતી જ જવાની.

જે કોલેજમાંથી દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિંદ ચાન્ડે, ઝીરોજશાહ મહેતા, ગો. મા. ત્રિપાઠી જેવા અસાધારણ વિદ્ધાનો ભાડીને નીકળેલા તે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ૧૪ વર્ષની ઉમરે મહાદેવભાઈએ પ્રવેશ મેળવેલો અને માત્ર ૧૮ વર્ષની ઉમરે ૧૯૧૦માં ડિલસૂફી-તર્કશાસ્ત્ર જેવા વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. પાસ કર્યું તે હકીકત એમનું બૌદ્ધિક કાહું દર્શાવે છે. વકીલ, અનુવાદક જેવા કામ કરતા મહાદેવ, મિત્ર નરહરિ પારેખ સાથે ૧૯૧૭માં પહેલી વાર ગાંધીજીને મળવા ગયા ને પાછા વળતાં મિત્રને કહે છે : ‘નરહરિ મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ (૬૧). પિતાજીની નામરજી છતાં, જેમાંથી કદ્દી પાછા વળવાના નોંત્રા એવું ગાંધીજી સાથે જવાનું પગલું ૨૫ વર્ષના મહાદેવ કર્દ પ્રેરણાને આધારે ભરતા હશે ? ધીમે ધીમે જાતને નામશોષ કરતા જવાની આ સાધના પાછળ, આ સર્વસ્વ સમર્પણકારી નિર્ણય પાછળ નારાયણ દેસાઈ નોંધે છે તેમ ‘ભક્તિ, વિદ્ધતા અને સંસ્કારિતાનો નિવેણીસંગમ હતો.’ (૭૭). આ સંપૂર્ણ સમર્પણ મહાદેવને સ્વમાંથી સ્વદેશ અને ત્યાથી સર્વદેશ સુધી પોતાની દ્વિતીજો વિસ્તારવાના પુરુષાર્થની ગાથાના નાયક બનાવે છે. મહાદેવ ભલેને એવું કહે કે, ‘કેવળ ગાંધીજી પ્રત્યેની ભક્તિ ઉપરાંત કશી જ લાયકાત મારામાં નહોતી.’ (૭૬). આ નભતા પર વારી જવાય પણ એને સાચી ન મનાય. કારણ કે ગાંધીજી પણ ગયા ત્યારે મહાદેવની અંજલિ સાવ ખાતી નહોતી. નારાયણ દેસાઈ લખે છે તેમ ‘એ કરસંપુટમાં ઉત્તમ ભાષાજ્ઞાન, ઉત્તમ અનુવાદકળા, વિશ્વાણ વાચન, આંખે ઊરીને વળ્ણે એવા સુંદર અક્ષર અને એવા અક્ષરે અતિ ઝડપથી લખવાની કુશળતા, પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનાં ઉત્તમ અંગોનું અધ્યયન, ઉંડું ચિંતન કરવાની શક્તિ ઉપરાંત એ અંજલિમાં નભતા, શાલીનતા અને સમર્પણબુદ્ધિ જેવા ગુણોનો સાગરભર્યો અર્થ્ય હતો....’ (૭૬)

મહાદેવભાઈની બૌદ્ધિક ક્ષમતાની, ભાષાપ્રભુત્વની, સુંદર અક્ષરોની, એમના માયાળું સ્વભાવ તથા મીઠી વાણીની જેટલી પ્રશંસા થઈ છે એટલી જ કાયમ એમના દેખાવની પ્રશંસા પણ સાંભળી છે. ગાંધીજી એમને ‘ગુલાબનું કૂલ’ કહેતા. સરોજિની નાયડુ એમને ‘ગુલે ગુજરાત’ કહેતા. નરસિંહરાવ દિવેણ્યાએ કહેલું : ‘અનાવલો છે, પણ નાગર જેવો દેખાય છે.’ (૪૬). મહાદેવભાઈના દેખાવ સંદર્ભે વખાજા તો અનેક લોકોએ કર્યા છે પરંતુ સ્વામી આનંદ જેવું શાબ્દિક મૂર્તીકરણ ભાગ્યે જ કશે જોવા મળશે. ‘મોગલ ગાર્ડનના ગુલાબ, ઢાકાની શબદનમ કે મોનાવિસા જેવી કલાકૃતિઓની

બરોબરી કરે એવી સંપૂર્ણતા લઈને દેવોનેય અદેખાઈ આવે એવી કામગીરી બજાવવા અવનિ પર ઉત્તરી આવેલા' મહાદેવભાઈના દેખાવ બાબતે સ્વામી આનંદ લખે છે : 'અક્ષર જેવા જ જાતે દેખાવડા. કિરતારે શરદ્ધનમની ચાંદનીને ગંગાજળમાં જબોળીને હેમની એરણ પર હીરાની હથોડીએ ઘડેલા. હાજરાહજૂર યુનાનનું શિલ્પ. ભાજ્યા પછી માણસની નજર ન ખસે.' (શુક. ૬૧). એમનું અંગેજુ ઓક્સફર્ડનું, ગુજરાતી લખાણ ભક્તિભાનું કલાસિક, શૈલી અને રજૂઆત એમના પંડ જેવી મનોહરી, વહાલસોયી, ભારોભાર ભાવુક, પડોકંકરી ગોત્યું ના જરે... ' (શુકતારક સમા : ૬૧). ભાષાપ્રભુત, અનુવાદ અને અક્ષરોની સુંદરતા બાબતે મહાદેવભાઈ ગાંધીજીથી ચર્ચિયાતા હતા. વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડનો પ્રાઇવેટ સેકેટરી સર મેન સેટ્ટીએ એક વાર મહાદેવભાઈને કહેલું : 'વાઈસરોયને પણ તમારા અક્ષરની અદેખાઈ આવે છે?' (૧૬૫) અતિશય ખરાબ અક્ષરો ઉકેલવામાં પણ મહાદેવ માહેર હતા. (ગાંધીને કારણે !!)

આપણાને પ્રશ્ન થાય કે આટાટલાં આંદોલનો, ધૂંવાધાર લડતો અને ગાંધીજીનાં તમામ કામોની વર્ણે મહાદેવભાઈએ આટાટલું લખવા-વાંચવાનો સમય ક્યારે કાઢ્યો હો ? જોન મોર્ટિના અતિશય કિલાષ ગણપાતા 'ઓન કોમ્પ્રોમાઈઝ'નો 'સત્યાગ્રહ કી મર્યાદા' શીર્ષકથી સરળ અને સરસ અનુવાદ, ગાંધીજીની આત્મકથાનો અંગેજુમાં અનુવાદ, જવાહરલાલ નહેરુની અંગેજુમાં લખાયેલી આત્મકથાનો ગુજરાતી અનુવાદ (પંડિતઝની ચમકદાર ભાષા, એમનું આત્મસંવેદન, વેદના અને જલતા જિગરનું મનોમંથન અનુવાદમાં આબાદ ઉત્તર્યું છે. જાણે કે પંડિતજી ગુજરાતીમાં લખતા હોય તેવું લાગે છે.) ગાંધીજીના 'અનાસક્તિ યોગ'નો અંગેજુ અનુવાદ, યાગોરના 'પ્રાચીન આહિત્ય' ઉપરાંત 'ચિત્રાંગદા'નો તથા કેટલાંક ગીતોનો અનુવાદ, શરદ્ધાભુની 'વિરાજવહુ વગેરે વાર્તાઓ'નો અનુવાદ, મૌલાના આજાદ, બે ખુદાઈ જિદમતગારો, સંત ફાન્સિસ જેવાં ચિત્રચિત્રણો, અર્જુન ભગતના ભજનોનું સંપાદન, અચ્યુત પટવર્ધન તથા અશોક મહેતાના ગ્રંથ 'હિંદુનો કોમી ત્રિકોણા'ના ગુજરાતી અનુવાદની સટીક પ્રસ્તાવના તથા બીજું કેટલુંયે.... એમણે ક્યારે લખ્યું હો આ બધું એવો પ્રશ્ન મહાદેવભાઈની ડાયરીઓ વાંચનારાને, એમની વ્યસ્તતા સમજનારા દરેકને ચોક્કસ થવાનો. એ વ્યાસના ગણેશની જેમ ગાંધીજીના માત્ર લહિયા નહોતા. લેખક, અનુવાદક, પત્રકાર અને બહુશ્વૃત વિદ્વાન મહાદેવભાઈનું જીવન ગાંધીજી પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતું, છતાં એમનું પોતીનું વ્યક્તિત્વ પણ એટલું જ પ્રબળ હતું. એટલે જ પુરુષોત્તમ માવળંકર લખે છે, 'આત્મસમર્પણ અને આત્મપ્રગટન એકસાથે કર્યાનો આટલો જીવંત અને જિગરભર્યો દાખલો ભાગ્યે જ જોવા મળે !' (શુકતારક સમા : ૨૪૪).

ગાંધીજી કહેતા, 'મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી

બધું જ છે.' (૪૧૦). જરૂર પડે ગાંધીજીના ભરત/શત્રુધની ભૂમિકા ભજવતા મહાદેવભાઈ પોતાની જાતને ગાંધીજીના હનુમાન જ માનતા. ગાંધીજીના અંતરની વાતોથી માંગીને એમની નાની મોટી તમામ બાધ્ય પ્રવૃત્તિઓને જગત આગળ ધરી દેવી એ જ એમનો ધર્મ, એમનું જીવનકાર્ય રહ્યાં કાયમ. ગાંધીજી પ્રત્યેની ભક્તિ કેવી હોશે કે એમની ઉંઘ ન બગડે એટલા માટે મહાદેવ અને ખારેવાલ 'ંગ ઈન્ડિયા' માટેનું લખાણ રેલગાડીના પાયખાનામાં બેસીને પૂરું કરતા ! અંગેજો પ્રત્યે ગાંધી જેવી વજાદારી મહાદેવમાં નહોતી. પરંતુ એમની ગાંધી પ્રત્યેની ભક્તિ એમને તર્કના ક્ષેત્રથી પર લઈ જતી. એટલે જ ગાંધીજી સાથે મતભેદ થાય ત્યારે ગાંધીનો દોષ શોધવાને બદલે મહાદેવ કાયમ પોતાનો જ દોષ શોધવા પ્રયાસ કરતા. (૧૩૫). એટલે જ નારાયણ દેસાઈ વાચક વતી પ્રશ્ન ઉઠાવતાં કહે છે : 'શું મહાદેવભાઈ ગાંધીજીને અવતારી પુરુષ માનતા હતા ?' પછીના લાખાશમાં આપણને આ પ્રશ્નનો જવાબ મળી જાય છે. મહાદેવ પોતાની જાતને ઓગાળી નામેલી એ અર્થમાં તેઓ ગાંધીજીના સગુણ-સાકાર ભક્ત હતા એમ કહી શકાય પરંતુ તેઓ ગાંધીજીના આંધળા ભક્ત નહોતા. તેઓ ગાંધીજીને સિદ્ધ નહીં, સાધક જ માનતા. ગાંધીજી કદી ભૂલ કરે જ નહીં એમ તેઓ નહોતા માનતા. ગાંધીજીમાં ચ્યાતકારો કરવાની કિર્દિક અલોકિક શક્તિ છે, એવું તેઓ નહોતા માનતા. તેમનામાં સામાન્ય લોકો કરતાં ઘણો વધારે હિંબાંશ છે એવું તેઓ માનતા...' (૧૯૦). એમની ભક્તિ આંધળી નહોતી એટલે જ મહાદેવ ગાંધીજીને અમુક સાચી વાત મોં પર કહી શકતા. દા.ત., રેટિયો આધ્યાત્મિક વિધિ છે એમ હજુ મને પ્રતીત નથી થયું.' (૨૬૦) કે ચૌરીચોરાના બનાવ પછી ગાંધીજી સવિનય કાનૂનભંગની લડાઈ મુલતવી રાખે ત્યારે ક્રોંચેસની નેતાગીરી સંમત ન હતી, ને મહાદેવ પોતે પણ સંમત ન હતા તેવું એ ગાંધીજીને લખે છે. જોકે એ જ પત્રમાં આવું પણ ઉમેરે છે : મેં એક મિત્રને ગૂઢાર્થમાં કહ્યું : જુઓ, એ તો ગાંધી છે. કાં તો એની બધી અતિશયતાઓ સાથે એને સ્વીકારો અગર એને પડતો મૂકો. દેશો પોતાની પસંદગી કરવાની છે....' દેશ શું કરશે એ દેશ જાણે પણ મહાદેવ લખે છે : 'મેં તો પાંચ વર્ષ પહેલાં ગોધરામાં આપણી સાથે મારાં પાનાં પડ્યાં ત્યારે જ પસંદગી કરી લીધી હતી.' (૨૬૭). આ હંદના સમર્પણ છતાં ગાંધીજીની અમુક વાતનો કરવો પડે તો મહાદેવભાઈ વિરોધ કરી શકતા. દા.ત., ગાંધીજીએ આશ્રમમાં સ્ત્રીપુરુષોના અલગ રસોડાં કરવાનો વિચાર મૂક્યો ત્યારે મહાદેવભાઈએ, નરહરિ પરીખ સાથે મળીને વિરોધ કરતો પત્ર લખેલો. સ્પષ્ટ વિરોધ નોંધાવતા એમણે લખેલું : જે સ્ત્રીઓ અને પુરુષોએ અનેક વર્ષો થયાં સાથે જીવન ગાળ્યાં છે, સાથે વિચારો કર્યા છે, સાથે આકંક્ષાઓ બાંધી છે અને એકબીજાને હુંફું આપી છે તેમનો એકાએક વિશ્વેષ કરવાથી તેઓ એકબીજાને માટે

જૂરશે, સહવાસનું વિશેષ ચિંતન કરી પોતાના બ્રહ્મચર્યનો મનસા વિશેષ ભંગ કરશે. વૈરાગ્ય વિના કરાવેલા ત્યાગમાંથી એવી માનસિક વિકૃતિ પેદા થશે કે જેથી પોતાની આસપાસનાં માણસ તેમને અકારાં લાગશે. અને પોતે આસપાસનાં માણસોને અકારા થઈ પડશે. આવી રીતે હૃદયભર્ણ થયેલાં પાસેથી વિશેષ કામ પણ શું લઈ શકાશે ? (૪૩૮). જ્યાદ શબ્દોમાં પોતાની વાત મૂડીને નિખાલસપણે આમ પણ લખે છે કે ‘અમે આશ્રમમાં દાખલ થયા ત્યારે બ્રહ્મચર્યનો નિયમ સૌને માટે ફરજિયાત હોત તો તેટલો નિયમ જ અમને આશ્રમથી છેયા રાખવાને માટે પૂરતો હતો.’ (૪૪૨). ગાંધીજી પ્રત્યે પૂર્ણ સમર્પિત મહાદેવ હતા પૂરા સંસારી, રસિક જીવ, સંસારને પંચેન્દ્રિયથી માણી શકતા. દુર્ગાબહેન માટે અતિશય જીવણ સૂતરની સાડી વણતા મહાદેવ એમની સ્વાદિષ્ટ રસોઈ સબડકા ભરી માણી શકતા. આણ પોતાની સાડી પહેરવામાં દુર્ગાબહેન સંકોચ અનુભવતાં. મહાદેવ એમને કહે, ‘કંઈ નહીં, આ સાડી તું ઘરમાં જ પહેર. એનો એક એક તરાર કંતતાં કંતતાં મેં તારું સ્મરણ કર્યું છે, જેટલો વધારે વખત તું એ સાડી પહેરેલી રાખે તેટલું વધારે સારું.’ (શુક્તારક સમા : ૧૦૩). આવા મહાદેવભાઈ કોઈને પણ; દુર્ગાબહેનને તો ખાસ, અન્યાય કરી શકે એ વાત કઈ રીતે માની શકાય ?

વેશિયર એલ્યિન લખે છે કે, ‘કેટલાયે બિનજરૂરી મુલાકાતીઓને ગાંધીજીથી દૂર રાખીને મહાદેવે એમનો દસેક વરસ જેટલો સમય તો બચાવ્યો જ હશે.’ (શુક્તારક સમા : ૭૧) ને આ મુલાકાતીઓ કેવા કેવા પ્રકારના હતા ? ખ્યારેલાલ લખે છે : ‘કબજિયાતની બીમારીવાળા અને ખોરાકના જાતભાતના પ્રયોગો કરનારાથી માંડીને સાહિત્યકારો, કવિઓ, કળાવિદો, પ્રવાસીઓ, અખબારોના પ્રતિનિધિઓ, રાજ્યદ્વારી પુરુષો, અધ્યાત્મની ખોજમાં લાગેલાઓ..... આ બધાના ગાંડાયેલા સવાલોના કે પત્રોના જવાબો મોટા ભાગે મહાદેવભાઈ જ આપતા. જાતભાતનાં બેજંઓ ક્યારેક દલીલે ચઢતાં, ‘તમે જ રોકો છો, મહાત્માજી તો એટલા દયાળું છે કે સૌ કોઈને મળવા દે.’ જવાબમાં મહાદેવ કહેતા, ‘આચું; હું પણ તેટલો દયાળું હોત તો હું મહાત્મા હોત અને તમે મારાં જ દર્શન કરીને તૃપ્ત થાત. પણ મહાત્મા તો ગાંધી જ છે, અને હું તો કેવળ પહેરેદાર છું’ (૩૭૭) આવી માથાઝોડ ઉપરાંત ગાંધી આશ્રમના જાતભાતના નમૂનાઓ વર્ણેના ઝઘડા-ટંટા પણ મહાદેવ જ શમાવતા. ઉશ્કેરાયેલાઓને શાંત પાડતા, મૂંગાયેલાઓના મનની ગૂંચ ઉકેલતા. એમના માયાળું અને પરગજુ સ્વભાવ તથા મીઠી જીભથી રસઝરતી વાણીના પ્રતાપે મોટા ભાગના પ્રશ્નો ગાંધીજી પાસે પહોંચાડવાની જરૂર જ ના રહેતી.

નારાયણ દેસાઈએ ભૂમિકામાં જ લખેલું છે કે, ‘હું મહાદેવ દેસાઈનો કેવળ પ્રશ્નસક જ નહોતો, પુત્ર પણ હતો. સત્યની મર્યાદામાં રહીને ચરિત્રની સાથે

ચારિત્ર્યગાથા ગાવાનો આ પ્રયાસ છે.' આ તટસ્થ લેખક પાછા ગાંધીજીના પણ જીવનકથાકાર છે. એટલે એમનું તાટસ્થ ઘણી વાર આપણને ગાંધીજી તરફ ફળી જતું લાગશે. એ તટસ્થ અવાજે, સ્વસ્થપણે કહી શક્યા છે કે, 'એ ધ્યાનમાં રાખવું પડશે કે ઘણીખરી ઐતિહાસિક ઘટનાઓમાં મુખ્ય ભાગ ગાંધીજીએ જ ભજવ્યો હતો. મહાદેવભાઈએ તો યથાસંભવ સેવા દ્વારા એમની પ્રવૃત્તિઓને પુષ્ટ કરવાનું જ કામ કર્યું હતું' (૧૮૪). જેકે વાચક તરીકે આપણે લેખક જેટલા તટસ્થ નહીં રહી શકીએ. રચનાત્મક કાર્યક્રમોમાં લોકમત ડેળવવાના, ગાંધીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના, બારડોલી સત્યાગ્રહ કે દાંડીકૂચ વિશે ગાંધીજીનું વલણ, વ્યૂહરચના, માન્યતા વિશે સતત લખી લખીને લોકો અને સરકાર, ગાંધી અને સરકાર, લોકો અને ગાંધી વચ્ચે સેતુ બની સ્પષ્ટ પ્રજામત ઊભો કરવામાં મહાદેવભાઈનો ફાળો બહુ મોટો હતો. બારડોલી સત્યાગ્રહમાં સરકાર નમી એમાં સરદારના દઠ નેતૃત્વ સાથે મહાદેવભાઈની ગજાતરીઓ, આંકડાકીય દલીલોનો પણ એટલો જ મોટો ફાળો હતો.

આમ તો ગાંધીજીના સચિવ થવું એ સાધનાનો પથ હતો. નારાયણ દેસાઈ કહે છે તેમ એ પથ 'શુરુસ્ય ધારા' જેવો દુર્ગમ હતો. મહાદેવભાઈ માટે તો 'સાહિબ મારો એક' જેવું હતું એટલે પોતાની ભૂલ ના હોય ત્યાં પણ એ મારી માગતા, પશ્ચાત્પાપ કરતા, રડતા પણ ખરા, ગાંધીજી સાથે પોતે રહેવાને લાયક નથી એવું પણ કહેતા. પરંતુ વાચક તરીકે આપણે દરેક પ્રસંગે ગાંધીજીનો પક્ષ નથી લઈ શકતા. દા.ત., મિસ સ્કેડ પાસે ફેન્ચ શીખતા મહાદેવને ગાંધીજી ખખડાવે છે ત્યારે કે દુર્ગાબાળેન અને કસ્તૂરબા પુરી મંદિરના દર્શને ગયાં તે નિમિત્તે ગાંધીજી જે ભાષામાં મહાદેવભાઈને તોડી પાડે છે તે આપણને જરાય ગળે નથી ઉંઠારું. આ બેઉ પ્રસંગે આપણે મહાદેવભાઈના પક્ષે ઊભા રહેવાનું પસંદ કરીશું, મંદિરવાળા પ્રસંગ નિમિત્તે ચંદ્રશોખર ધમીયિકારી વાખે છે : જગન્નાથપુરીવાળા પ્રસંગે ગાંધીજી કરતાં મહાદેવનું વર્તન વધુ સ્વસ્થ, સમતોલ હતું. પત્નીના સ્વતંત્ર અસ્તિત્વ, વ્યક્તિત્વ, વિચાર અને ઈચ્છાને એણે માન આપું પણ અહિસામાં માનનાર ગાંધી એવું ન કરી શક્યા.' કદાચ એટલે જ પ્રથમ પ્રતિક્રિયા રૂપે 'હરિજન'માં મહાદેવ આવું લખી બેઠા હશે ને આ પ્રસંગ પછી ?

To live with the saints in heaven

is a bliss and glory

But to live with a saint on earth

is a different story.

મહાદેવે સુશીલા નાયરને પણ આ વાત કહેલી કે, 'બાપુની સાથે રહેવું એ જવાળામુખીની ટોચ પર રહેવા જેવું છે. જવાળામુખી ક્યારે ફાટે અને આપણા ઝુરચા

ઉડાવી દે એ કોઈ કહી શકે નહીં.' (શુક્તારક સમા : ૨૧)

આમ પાછો બેઠ વચ્ચે એવો મનમેળ કે એકમેક વગર જરાય ન ચાલે. મહાદેવ તો દામ્પત્યજીવનની વાતોથી માંડીને બધું જ ગાંધીને કહેતા. ગાંધીજીથી દૂર જવાનું, વિખ્યા પડવાનું મહાદેવને જરાય ન ગમતું. દૂર રહેવું પડે ત્યારે પોતે ગાંધીજી માટે શું છે તે જાણવાની એમને ઈચ્છા થતી. જ્યારે 'ઇન્ડિપેન્દ્ન' માટે અલહાબાદ જવું પડેવું ત્યારે એમના પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ એમને લખેલું : 'તમે તો મારું મગજ છો.' (૨૧૪). જ્યારે પણ ગાંધીજીના મરણનો કંઈ પણ ઉલ્લેખ થતો ત્યારે મહાદેવભાઈને અંધારાં આવી જતાં. ગાંધીજી વિનાના મહાદેવ હોઈ જ ન શકે એવી એમની કલ્યાણ હતી. (૨૧૪). પોતે ગાંધીજી પહેલા જવાના તેવું એ વારંવાર કહેતા ને છેવટે એમની એ વાત સાચી પણ ઠરી. બંને એકમેકથી દૂર હોય ત્યારે પત્રો તો સતત ચાલતા જ રહેતા. અલહાબાદથી પોતાને પાછા તેડાવી લેવા માટે પણ મહાદેવ ગાંધીજીને લખેલું, એક વાર માંદગીમાં સપદાયેલા, ગાંધીજીના કાગળ વગર અધીરા-આકળા થઈ ગયેલ મહાદેવ પ્રેમથી તુંકારો કરી બેસો છે. જાણો કોઈ આશક માશૂકને લખે તેવો તાર એમણો ગાંધીજીને કરેલો : 'મારું સુધારા પર છે, પણ શાને આટલો દયાહીન ? એકાદ પ્રેમપત્ર તો લાખ !' ગાંધીજીના પત્ર વિના એમની સ્થિતિ ચંદ્રની રાહ જોતા ચકોર જેવી થતી. એક પત્રમાં તેઓ લખે છે : 'આપના પત્ર વિના તલસી સુકાઈ ગયો છું.' (૨૭૭). રાહ માત્ર મહાદેવ જ જોતા એવું નથી. ૧૯૨૮ના ગાળમાં મહાદેવભાઈની માંદગી વેળાએ ગાંધી લખે છે : 'તમે બીજા નિયમો જાળવો કે ન જાળવો, ડેકાણં ડેકાણે રાખો કે ન રાખો, પણ મને કાગળ લખવાનું તો શૂણીએ બેઠા પણ કરો.' (૪૦૭). લાગણીના સ્તરે ગાંધીજી પર વધુ ને વધુ ઢણતા જતા મહાદેવભાઈને એક વાર ગાંધીજીએ લખેલું : 'પોલાકને હું કહેતો હતો કે તેને બે સ્ત્રીઓ છે. એક બિસ્સિસ પોલાક અને બીજી હું. કેમ કે, તેનું અંતર બેની પાસે જ ઢાલવે, બેની ઉપર જ રિસાય. તમને પણ પોલાકની જેવી જ હવે ટેવ પડી લાગે છે. પણ હુર્ગા શું કહેશો ?' (૧૭૫). પરંતુ આ સંબંધનું સત્ત્વ ન સમજી શકનાર ઓરિક એરિક્સના ગ્રંથ 'ગાંધીજ ટૂથ'માં મહાત્મા અને મહાદેવ વચ્ચેના સંબંધોમાં જાતીય વૃત્તિ જોવાઈ છે તેનું કારણ એનું શિક્ષણ અને સંસ્કૃતિને જ ગણવાં રહ્યાં ને ? આ બંને વચ્ચે એટલો અને એવો એકત્તમભાવ હતો કે ગાંધી બોલે તે પહેલાં મહાદેવ અનુમાનથી લખી શકતા ! અને જ્યારે જ્યારે ગાંધીજીએ ઉપવાસ કર્યા ત્યારે ભોજન લેવા છીતાં મહાદેવભાઈનું વજન પણ દરેક વખતે ઊતરતું જ ! મહાદેવભાઈના લેખની નીચેથી MD ચેકીને બાપુ MKG લખી દેતા એ દિવસે મહાદેવ હરખાઈ ઊકરતા ! મહાદેવભાઈનાં લગભગ તમામ કામનો ઉલ્લેખ ગાંધીના કામમાં સમાઈ જતો એ હંદના

સ્વાર્પણની પરાક્રાંતી જો આપણને નવાઈ લાગતી હોય તો બિચારા એરિકભાઈનો શો વાંક ક? ક. મા. મુનશીએ સાચું જ કહ્યું હતું મહાદેવભાઈના આવા સ્વાર્પણ માટે કે, ‘ગાંધીજીની તરફ એમની દસ્તિ ‘સર્વધર્મ પરિત્યજ્ય મામેકમુશરણં વ્રજં’ એ પ્રકારની હતી..’ (૭૧૦)

૧૯૭૧માં મહાદેવને કૌંગ્રેસના મહામંત્રી બનવા માટે આગ્રહ કરવામાં આવેલો, પણ ગાંધીજી એમને છોડવા તૈયાર નહોતા. ૧૯૭૭માં પ્રાંતિક સરકારો બની ત્યારે મહાદેવભાઈને મુંબઈ રાજ્યના પ્રધાન બનવાનું સૂચવાયેલ પણ એમણે હસ્તીને સૂચન કોરાણે મૂકેલું. મારા જેવાને વિચાર આવે કે આજાદી આવી ત્યારે ધારો કે મહાદેવ જીવતા હોત તો એમણે શું કર્યું હોત? એવો પણ વિચાર આવે કે મહાદેવને આમ બાંધી રાખીને ગાંધીજીએ એમને અન્યાય કર્યો હતો? તટસ્થભાવે બે-ત્રાજ પ્રસંગોમાં આપણને એવું લાગે, પરંતુ નારાયણ દેસાઈનું આકલન આ બાબતે સાવ જુદું પડે છે. તેઓ કહે છે : ‘ગાંધીજી સાથે જોડાયા ન હોત તો મહાદેવભાઈ સારા સાહિત્યકાર કે સારા ભાષાંતરકાર થયા હોત. પણ વિવેકપુરુષ કિશોરલાલ મશરૂવાળાએ જેમને ‘સર્વ શુભોપમાયોગ્ય’ કહ્યા, લોખંડી પુરુષ સરદાર પટેલે જેના મરણને દેવતાઓને પણ હુલ્લબ એવું મરણ કહ્યું, વેલિયર એલ્યુન જેવા સમાજશાસ્ત્રીએ જેમને ગાંધીરૂપી સોકેટીસના લેટો કહ્યા, રામજી જેવા સંસ્કારી મુત્સુદીએ જેમને ગાંધીજીના દ્વિતીયમ હૃદયમ કહ્યા. વાઈસરોયના સેકેટરીએ જેમને ગાંધીવિચારના સર્વોત્તમ ભાષ્યકાર કહ્યા, બીજા અનેકોએ બીજું કેટલુંય કહ્યું છતાંય દરેકને કહેવાનું રહી ગયું એવો જ ભાવ અનુભવયો તે ગાંધીજી સાથે ન જોડાય હોત તો મહાદેવભાઈ ક્યાંથી થયા હોત? કદાચ એ સાચું હશે કે મહાદેવભાઈ શૂન્યવત્તુ થવાથી ગાંધીજીની કિંમત દસ્તગઢી વધી હશે, પણ આપણે એયે ન ભૂલવું જોઈએ કે ગાંધીજી વિનાના મહાદેવ તો એકડા વિનાના મીડા જ રહ્યા હોત...’ (૭૦૮). જોકે મહાદેવની શક્તિઓ અને સ્વભાવગુણ જાળનાર કદાચ નારાયણ દેસાઈ સાથે સંમત નહીં થાય. મહાદેવને દીકરો માનનાર ઊર્મિવાદેવી સેને લખ્યું છે કે, ‘મહાદેવ ગાંધીજી પાસેથી જે પાણ્યા તે કરતાં તેમણે ગાંધીજીને જરાય ઓછું નથી આખ્યું. ગાંધીજીએ મહાદેવ પાસેથી જે મેળવ્યું તે બીજું કોઈ જાણે કે નહીં, ગાંધીજી પોતે તો બરોબર સમજતા હતા.... (શુકૃતારક સમાઃ ૧૦૧). જોકે નારાયણ દેસાઈ પણ એટલું તો કબૂલે છે કે ‘બાપુએ તો મહાદેવના સમગ્ર વ્યક્તિત્વને ઘડેલું... પણ ગાંધીજીને ગાંધી બનાવવામાં મહાદેવભાઈનો ઝણો નાનાસૂનો નહોતો...’ (૬૮૪). ગાંધીજીએ મહાદેવના મણ્યા પહેલાં ‘હિંદ સ્વરાજ’ લખ્યું અને મણ્યા પછી ‘સત્યના પ્રયોગો’ લખાયું. ગાંધી સેન્ટ્રમ, બર્ટિનના શ્રી કિશ્ચિયાન બાર્ટોલ્ડ ભાવપૂર્વક નોંધે છે કે મહાદેવના સંપર્ક પછી ગાંધીજીની ભાષામાં કોમળતાની

સાથે સાથે ચોક્સાઈ આવી છે.' (૬૮૪). આપણે ગાંધીનાં વિચારો અને કાર્યોની ચોક્સાઈ વિશે પણ આવું જ કહી શકીએ.

૨૦-૮-'૪૨ના રોજ 'કલમ અને કિતાબ'માં અપાયેલી અંજલિ મહાદેવ શું હતા તે સટીક રીતે વ્યક્ત કરે છે. (મેધાણીએ જ ને ?) તેમાં લખ્યું હતું કે, 'બુદ્ધિ, શક્તિ અને ત્યાગભાવના તો એટલી પ્રબળ હતી કે જો એકલા ઉભા રહ્યા હોત કે ઈચ્છા કરી હોત તો હિંદના પ્રથમ પંક્તિના નેતા બન્યા હોત. પરંતુ એ વિચાર જ ક્યાંથી એમના અંતરમાં ઉઠે ? એમનું તો ધ્યેય પાયામાં પુરાઈ જવાનું હતું. દેખ અને આત્માની તમામ શક્તિ નિચોવી નિચોવી ગાંધીજીના જીવનપથનું દિવેલ બનવાનું હતું.' (શુક્રતારક સમા : ૨૪૬).

નારાયણ દેસાઈ બંનેનાં વ્યક્તિત્વની બાહુ યથાર્થ તુલના કરે છે. તેઓ લખે છે : 'બાપુનું સમગ્ર વ્યક્તિત્વ વૈશાખની બપોરના સૂર્ય જેવું પ્રભર હતું, મહાદેવનું વ્યક્તિત્વ શરદપૂનમના ચંદ્ર સમાન સૌભ્ય હતું.' (૬૮૪). મહાદેવના સમર્પણને નારાયણ દેસાઈ કેટલી બધી રીતે યોગ્ય ઠરાવવા મથામજા કરે છે ! એ કહે છે : 'મહાદેવભાઈએ પોતાની હસ્તીને ગાંધીજીના યજ્ઞમાં હોમી દીધી હતી એ વાત સાચી, પણ તેથી તેમની હસ્તી શૂન્ય વડે ભાગવાથી જેમ સંખ્યાની કિંમત અનંતગણી થાય છે, તેમ તેમનો અહ્મૃ ઓગળ્યો હતો પણ અસ્તિત્વ અનંતગણી થઈ ગઈ હતી.' (૭૦૮). ને છતાંય મારા જેવા ભાવકને લાગે છે કે મહાદેવ બધાના નસીબે નથી હોતા... ગાંધીજીના નસીબે એમને મહાદેવ મળ્યા ને ભારતવર્ષનાં નસીબ કે એણે ગાંધી-મહાદેવનો સંગમ જોયો.

નારાયણ દેસાઈએ સમગ્ર જીવનચરિત્રમાં વાચકના મનમાં જાગી શકે તેવા અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને એના જવાબો આપવાની કોશિશ પણ કરી છે. અન્ય સ્ત્રીઓ સાથેના મહાદેવભાઈના સંબંધો વિશે સમકાળીનોની વાત-લખાણો ટંકીને વાચકો વતી નારાયણ દેસાઈ પ્રશ્ન કરે છે કે, 'મહાદેવભાઈએ દુર્ગાબહેનને અન્યાય કર્યો હતો કે કેમ ?' જવાબ 'ના'માં જ મળે છે. ગાંધીજ સાથે જ રહેતા મહાદેવનું સરનામું આમેય કાં તો જેવ અને કાં રેલ જ રહેતું એટલે દુર્ગાબહેના ભાગે 'સ્નેહધામ સૂરાં સૂરાં રે...' ગણગણતા મોટા ભાગનું જીવન પસાર કરવાનું આવેલું. પણ લેખક પોતે સાક્ષી છે કે જેટલો સમય સાથે રહેવાનું મળતું એટલો સમય મહાદેવ સ્નેહથી છલકાઈ ઉઠતા, ઘર-દાખ્યત્વ સુભર થઈ ઉઠતાં... એટલે જ લેખક નોંધે છે કે, 'મહાદેવભાઈનો ત્યાગ એ દુર્ગાબહેનના ગર્વનો વિષય હતો, ફરિયાદનો કદમ્પિ નહીં.' (૬૬૫)

૧૩-૧૧-૧૯૭૧થી મહાદેવભાઈએ ડાયરી લખવાની શરૂ કરી તે મૃત્યુની આગલી સાંજ સુધી લખતા રહ્યા. આમ પણ ૧૯૭૧થી ૧૯૮૭ સુધીની ગાંધીજીની

પ્રવૃત્તિ જાળો કે હિન્દુસ્તાનના ઈતિહાસની ગતિવિધિ સૂચવે છે અને મહાદેવભાઈએ એમની ડાયરીઓ દ્વારા એ ઈતિહાસની અંતરંગ કથા એના દરેક વળાંક સાથે આપણી આગળ છતી કરી છે, પરંતુ એમણે શુષ્ક ઈતિહાસ નથી નોંધ્યો. નારાયણ દેસાઈ કહે છે તેમણે : ‘તેઓ ગાંધીજીના ભાષ્યકાર છે, ગાંધીજીની વાતોને સામેનો માણસ સમજ શકે એવી ભાષામાં રજૂ કરનાર હુભાસિયા છે, ગાંધીજી જેવા એક મહાનાટકીય પુરુષને એના હુબહુ રૂપમાં પ્રગટ કરનાર એક નાટ્યકાર છે. ગાંધીજીના સંપર્કમાં આવનાર સેંકડો આબાલવૃદ્ધ સ્ત્રીપુરુષોના ચારિત્રચિત્રણકાર છે.’ (૭૭૪-૭૫)

આ ડાયરીઓમાં ગાંધીજીનાં ભાષણ, એમના પર આવેલ પત્રો, એમણે લખેલ પત્રો, ગાંધીજીને મળવા આવેલા લોકોની વાતચીતના મહત્વાના મુદ્રા ઉપરાંત પોતે જે કંઈ નવું વાંચ્યું હોય તેની નોંધ કે ગાંધીજીની કોઈ વાત નિભિતે થયેલ મનોમંથન આવેખેલ છે. એક સામાન્ય વાચક તરીકે અથવા ઈતિહાસના અભ્યાસી તરીકે આપણે આ ડાયરીઓમાંથી પસાર થઈએ ત્યારે સમજાય કે જો મહાદેવભાઈએ આ બધું નોંધ્યું ન હોત તો આપણો ઈતિહાસ કેટલો તો એકાંગી અને પુરાવાઓ વગરનો હોત ? લોકોએ અને અંગ્રેજોએ ગાંધી વિશે, એમના પ્રયોગો, માન્યતાઓ, સંબંધો, મનોમંથનો અને એમનાં આંદોલનો વિશે મનગમતી કે મનજ્ઞવે તેવી વાતો કરી હોત. બિટિશ સરકારે ઈચ્છ્યું હોત તો ગાંધીજીનાં ભાષણોને, એમના પત્રવ્યવહારને પોતાના અવિકૃત અહેવાલોમાં દાટી કે છુપાવી દીધા હોત. પણ એવું ના થઈ શક્યું એનો તમામ પણ મહાદેવભાઈની કલમને ઝણે જાય. જે જમાનામાં રેકોર્ડિંગની વ્યવસ્થા ન હતી ત્યારે ગાંધીજીનો બોલાયેલો અને લખાયેલો શબ્દેશષ્ટ મહાદેવભાઈએ ભાવિ પેઢી માટે આચય્યો. આ ડાયરીઓ વિશે રા. વિ. પાઠક લખે છે કે, ‘એમની ડાયરીઓને જગતસાહિત્યમાં હું તો અનન્ય માનું છું – વિષયની મહત્તમાની દસ્તિએ, લેખકની સર્વાઈની દસ્તિએ અને લેખકની શક્તિની દસ્તિએ પણ.’ (શુક્તારક સમા : ૧૦૭). ઘારેલાલ આ ડાયરી અંગે કહે છે : ‘ગુરુના એક એક શબ્દનો સંગ્રહ કરવા માટેની તેમની ચીવટ એટલી હતી કે કોઈ વાર કાગળ તરત હથમાં ન આવે તો મહત્વાના મુદ્રાઓ વર્તમાનપત્રોના હંસિયામાં, ચલણી નોટોની પાછળ અને કોકવાર અંગ્રોડા કે આંગળીઓના નખ પર ટંચી લેતા મેં તેમને નજરોનજર જોયા છે. વખત મળ્યે વહેલી તકે એ બધું રોજનિશીમાં તેઓ ઉત્પારી લેતા... તેમની હયાતીમાં ગાંધીજી વિશે અવળો પ્રચાર કરવાની ધૂષ્પત્તા કોઈ કરી શકતું નહીં. ભૂલેચૂકે કોઈ આવી ભૂલ કરવા જતું તો તે સમયે જ નોંધાયેલી પોતાની નોંધના પુરાવાનો હથોડો તેના પર પડ્યો જ હોય...’ (શુક્તારક સમા : ૩૭). એટલે જ જેમને ગાંધીજીના સાધન અને સાધ્ય વિશેના યુદ્ધ અને અહિસા વિશેના વિચારો જાણવા હોય તેમણે ડાયરીઓમાંથી પસાર થવું જ રહ્યું.

ભગતસિંહ વગેરેને બચાવવા ગાંધીજીએ કંઈ નો'તું કર્યું એવું દોષપોપણ કરનારા તમામે અહીં મહાદેવભાઈના હાથે નોંધાયેલ પત્ર વાંચી જવા અથવા ૨૬ માર્ચનું ગાંધીજીનું ભાષણ વાંચી જવાની ભલામણ કરી શકાય. ગાંધીજ પોતાની વાત છોડતા નહીં એટલા જિદી હતા એવું માનનારાઓએ જહાલ અને જવાળ વચ્ચે મેળ પાડવા મથતા ગાંધી કઈ હદે જતું કરવા તૈયાર થયેલા એ આ જીવનકથામાં વાંચી જવું. વળી દાખિલાસ તો આપણી સામે રાજકીય ચર્ચાઓ કે વાટાઘાટો કરતા, રચનાત્મક પ્રવૃત્તિઓ વિશે વાત કરતા, ઉપવાસ કરતા, એક પદી એક પ્રજાકીય આંદોલનો ઉપાડતા ગાંધીનું ચિત્ર ૨૭૩ કરશે. પરંતુ મહાદેવભાઈ તો આપણને બાળકો સાથે રમતા, ખડખડ હસતા-હસાવતા ગાંધી, હિન્દુ-મુસ્લિમ એકત્ર માટે મથતા ગાંધી, અસ્પૃશ્યોને ન આવકારે તે જગન્નાથ ન કહેવાય એવું કહેતા ગાંધી, અંતેવાસીઓ પર હદ બહારના અકળાઈ જતા ગાંધી, પરચૂરે શાસ્ત્રી જેવા આસન્નમૃત્યુ દરદીઓની સેવામાં રત ગાંધી.... એમ ગાંધીના કેટકેટલા રૂપ બતાવે છે ?

સૌથી મોટી નવાઈની વાત એ છે કે જે 'મહાદેવભાઈની ડાયરી' કહેવાય છે એ હકીકતે છે તો ગાંધીજ વિશેની ડાયરી ! જ્યારે જ્યારે મહાદેવભાઈ ગાંધીજ સાથે નો'તા ત્યારે ત્યારે ડાયરી નથી લખાઈ ! આટલી હદે પોતાની જાતને શૂન્યવત્ત કરી દેનારા સ્વાર્થિણ માટે આપણાને નવાઈ લાગે પરંતુ નારાયણ દેસાઈ લાગે છે તે સાવ સાચું છે : 'મહાદેવભાઈ પોતાની ડાયરીઓમાં પોતાની જાતને છુપાવીને ગાંધીજને જ આગળ કરે છે.' (૫૮૧). મહાદેવભાઈ આવું કઈ હદે કરે છે ? એક મૃત સંતાપ પદી ૧૮૨૪માં નારાયણભાઈનો જન્મ થાય પણ એ સમાચારનો મહાદેવભાઈની ડાયરીમાં ઉલ્લેખ સુધ્યાં નથી ! ૧૮૪૨ની લડતમાં જેલમાં જતા પહેલાં જવાહરલાલે પોતાની ડાયરીમાં 'ઈન્હને ફરી ક્યારે મળશે ?' એવું લખ્યું છે પણ મહાદેવભાઈની ડાયરીમાં તો બાપુ વિશેની ચિંતા જ વ્યક્ત થઈ છે !

આપણાને એક પ્રશ્ન થાય કે મહાદેવભાઈમાં સર્જનાત્મક ઉપરાંત અનુવાદક તરીકેની ભરપૂર ક્ષમતા હોવા છતાં એમણે એમનો બધો જ સમય ગાંધીજના બોલાયેલ શબ્દો નોંધવામાં કે એમનાં લખાણો-પત્રોની નકલ કરવામાં જ કેમ ગાળ્યો હોશે ? એમને કદી કંટાળો નહીં આવ્યો હોય ? આ બાબતે મહાદેવભાઈ કહે છે : 'જો કોઈક વાર અમુક વસ્તુ દર્શાવવાની ખાતર સૂર્ય અને દીપકની તુલના કરવી ક્ષમ્ય ગણાય તો હું કહું કે તુલસીદાસને રામચરિતમાનસ લખતાં કંટાળો આવ્યો હોય અથવા શંકા થઈ હોય કે કોઈ વાંચશે કે નહીં તો મને બાપુ વિશે કંઈ પણ લખતા કંટાળો આવે અથવા વાંચશે કે નહીં એવી શંકા થાય.' (૩૭૬).

અનેક દસ્તાવેજ વિગતો, પ્રશ્નો, વ્યાખ્યાનો વડે લેખક ગુજરાત અને ભારતના

એક મહત્વના કાળખંડને, આપણા સ્વાતંત્ર્યસંગ્રામના મહત્વના તબક્કાને આપણી સમક્ષ જીવંત કરી આપે છે. ગુજરાતી ભાષામાં લખાયેલા ચિહ્નતાંથોમાં આ ગ્રંથ એના નાયકને કારણે, એના લેખકની અપૂર્વ નિરૂપણ અને સંયોજનશક્તિને કારણે, ભાષાશૈલીને કારણે અપૂર્વ બની રહેવાનો કાયમ. એવું કહેવાની હિમત કરી શકાય.

છેલ્લે મહાદેવભાઈ માટે આવું કહેવાનું મન થાય....

કિસીકો ન હો સકા ઉસકે કદક અન્દાજ  
જો આસમા થા મગર સર ઝુકા કે હિરતા થા.

### સંદર્ભગ્રંથ

1. અનિન્દુડમાં ઊગેલું ગુલાબ : નારાયણ દેસાઈ, શ્રી મહાદેવ દેસાઈ જન્મ શતાબ્દી સમિતિ, હરિજન આશ્રમ, અમદાવાદ, પ્ર. આ. ૧૯૮૨, રૂ. ૫૦, પાનાં ૭૫૫.
2. શુક્તારક સમા મહાદેવભાઈ : સં. જ્યન્ત પંડ્યા, કાંતિ શાહ, શ્રી મહાદેવ દેસાઈ જન્મ શતાબ્દી સમિતિ, હરિજન આશ્રમ, અમદાવાદ, પ્ર. આ. ઓગસ્ટ ૧૯૮૧, પુ. મુ. ઓક્ટોબર ૧૯૮૧, રૂ. ૪૦, પાનાં ૫૮૬.
3. મહાદેવભાઈનું પૂર્વરચિત : નરહરિ પરીખ, નવજીવન પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૧૯૫૦, બાર આના, પાનાં ૧૦૧

# ‘વળાવી બા આવી’ : અવિસ્મરણીય રચના

## ■ મનસુખ સહલા ■

તપાસવા જેવું એ છે કે અમૃક કવિતા કેમ ભાવકોના હદ્યમાં કાયમનું સ્થાન લઈ કે છે અને કવિની ઓળખરૂપ એ કાવ્ય બની જાય છે. ઉશનસ્રનું ‘વળાવી બા આવી’ કાવ્ય આવું છે. સોનેટસ્વરૂપ બેડાઈ ચૂક્યું હતું. સોનેટના ભાવવળાંકો (ઝંડો) પ્રમાણે અહીં આઈ અને બાર પેંક્ઝિટ પછી વળાંક આવે છે. અંત્યાનુપ્રાસ પણ સોનેટની એક ઓળખ છે તે અહીં પણ છે. સોનેટના બાધ્ય માળખાનાં સંઘળાં લક્ષણો અહીં હાજર છે. પરંતુ એ કારણે જ આ કાવ્ય નોંધપાત્ર નથી નીવજ્યું. અહીં સંવેદનની અભિવ્યક્તિ જે સંયમથી થઈ છે અને એમાં યોજાયેલા કાવ્યસ્વરૂપનાં પાયાનાં ઘટકો સાર્થક થયા છે એ આ કાવ્યની અને કવિની સિદ્ધિ છે. કવિતા માટેની એક વ્યાખ્યા એવી છે કે ‘કવિતા બે પેંક્ઝિટ વર્ચયેની ખાલી જગ્યામાં હોય છે.’ એટલે કે તેમાં રજૂ થયેલા કરતાં રજૂ ન થયેલામાં ભાવ વધુ સૂચવાતો હોય છે. જીવનઘટનામાં બનતું તો ઘણું હોય છે પરંતુ કવિ શું પ્રગટ કરે છે, એટલે કે પસંદ કરે છે તે સોનેટને ચિરંજિવ બનાવે છે.

સોનેટનું સ્વરૂપ પ્રમાણમાં ચુસ્ત હોય છે. ગૌદ પેંક્ઝિટઓ તો ખરી જ, ઉપરાંત કવિ કયા છંદની પસંદગી કરે છે તે પણ નિર્જાયક બને છે. અહીં ૧૭ અક્ષરનો શિખરિણી છંદ કવિએ પસંદ કર્યો છે. શિખરિણી છંદમાં સામટા પાંચ ગુરુ અને સામટા પાંચ લઘુની રચના છે. જાણો કે આનંદની ભરતી અને પછી વેરાઈ (કે ઢોળાઈ) જતો આનંદનો ભાવ પ્રગટ કરવા કવિએ આ છંદ પસંદ કર્યો છે.

દિવાળીની રજાઓમાં દૂર રહેતાં સંતાનો ભાર્યાઓ અને બાળકો સાથે વતનમાં સ્વધેર આવ્યાં છે. એમની હાજરીમાં એ થોડા દિવસોમાં માતાપે શું શું અનુભવ્યું, કેવી ભાવભરતી તેના હૈયામાં ચડી હશે, સફાઈ-તૈયારી-મિઠાઈ-ફટકડા-રંગોળી-વાતો-હાર્ય-રમતો-કિલકિલાટ્થી કેવી તૃપ્તિ અનુભવી હશે તેની કોઈ વાત કવિએ કરી નથી. કવિનો આ સંયમ તરત ધ્યાન ખેચે છે. એ આનંદપર્વના દિવસો હવે પૂરા થાય છે, ત્યાંથી કવિતાનો પ્રારંભ થાય છે. સોનેટસ્વરૂપની સૂક્ષ્મતા કવિએ આગળી રાત અને વળતો દિવસ એવા બે ખંડ કરીને પણ સૂચિત કરી છે.

આગલી રાતે વિરહ તોળાઈ રહ્યો છે તેનો અનુભવ માતા તીવ્રપણે કરે છે. દિવાળીની રજાઓ પૂરી થઈ. સંતાનો ધંધાર્થી પાછાં જવાનાં છે, ત્યારે માતાને લાગે છે કે, ‘ધહાડાઓ કેરી સ્બાલિત થઈ શાંતિ પ્રથમની’. આ શાંતિ સ્થૂળ નથી. ઘર તો બાળકોના કલરવથી, પુત્ર-પુત્રવધૂઓની વાતોથી ભર્યું ભર્યું હતું. એનાથી માતા શાંતિ-સુખ-તૃપ્તિ-સભરતા અનુભવતી હતી. જાગે કે એ સંઘણું ઉહોળાઈ ગયું. અહીં સંસ્કૃત શબ્દ ‘સ્બાલિત’ કેવળ છંદ માટે નથી, પણ ‘ખરી પડવું’, ‘પટકાઈ પડવું’ના અર્થને સૂચિત કરે છે. ‘ઘર મહીં – પ્રથમની’નો પ્રાસ હળુહળુ પ્રવેશી રહેલા વિરહનાં પગલાં સંભળાવે છે.

પિતા-માતા-ગંગાસ્વરૂપ ઘરડાં ઝોઈ કર્મ લખાયેલો વિરહ જાગે આગલી રાતે બધા વર્ચો પોતાની જગ્યા કરી બેસી ગયો હોય એવું અનુભવે છે. આવતી કાલે સંતાનો જવાનાં છે, વિરહ થવાનો છે એ નિશ્ચિત છે. છતાં જાગે કે હજુ તો આવતી કાલે એ બનવાનું છે એવું આમક આચાસન લેતા હોય એમ બીજી જ વાતો તરફ વળી ગયાં. ધ્વનિ એ છે કે વિરહની સ્થિતિનો ઉલ્લેખ કરતાંય જીવ ચાલતો નથી. એટલે બીજી વાતો કરીને આવનારા વિરહને ટાળવા પ્રયત્ન કરે છે. કવિએ પ્રત્યેક શબ્દ સહેતુક પસંદ કર્યો છે : ‘ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂર્ય ગયાં’. અહીં છંદની ગતિ અને મનોભાવની ગતિ એકરૂપ સિદ્ધ થાય છે. કવિએ અહીં પણ અદ્ભુત સંયમ જાળ્યો છે કે આખી રાત માતાએ કેવી, કેમ વિતાવી હશે, ઉંઘી શકી હશે કે નહિ એને વિશે મૌન રાખ્યું છે. ‘જરઠ’ એટલે કેવળ ‘ઘરડાં’ નહિ કઠણ થઈ ગયેલાં, સંવેદનાહીન એમ સૂચયવાય, પણ માતાની સ્થિતિ એથી ઊલારી જ છે.

સોનેટનો બીજો ખંડ એ રાત્રિ પછીની સવારનો, એટલે કે ખરેખર વિરહની સ્થિતિનો છે, પરંતુ કવિએ માતાના ભાવોના વર્ણનને બદલે માત્ર વિગતો જ વર્ણવી છે. આ ચાર પંક્તિમાં વર્ણવાયેલી દરેક કિયામાં બા સક્રિય હશે, સતત રમમણી હશે અને તેના હૃદયમાં તુમુલ મંથન ચાલતું હશે, પરંતુ કવિ કેવળ અશબ્દ પ્રતિભાવો જ વર્ણવી છે.

બીજા ખંડમાં મોટાભાઈ, પત્ની અને બાળકોને લઈને ગયા, માતા તેને વળાવવા ગઈ હશે, ત્યારે માતાના હૃદયમાં ઊંઠતો પ્રતિભાવ છે : ‘ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા’. જાગે ઘરની વસ્તી અર્ધી થઈ ગઈ. વસ્તી શબ્દ સામિપ્રાય છે. ‘ભર્યું ઘર’માં ભર્યું કિયાપદ સાર્થક થયું છે. ‘ભરેલું’ અને ‘ઉભરાતું’, ‘સમૃદ્ધ’ એ અર્થો પણ અહીં સૂચિત થાય છે. આ પદાવલીમાં કેવળ વર્ણસગાઈનું સૌંદર્ય નથી, એક ઊંડો નિસાસો, થાસાનું સહેજ અટકી જવું, એ માતાની હૃદય-સ્થિતિનો પડઘો પદાવલી દ્વારા ઔંતરશ્રવણમાં સંભળાઈ શકે છે. છંદની લઘુ-ગુરુની બાંધણી ભાવ-પ્રગાતીકરણમાં કેવી સાર્થક સિદ્ધ

થાય તેનું આ દખાત છે.

અહીં માતાની નજરે ઘર વર્ણવાયું છે : ‘ઘર થઈ ગયું શાંત સઘણું’. બીજું પંક્તિમાં ‘ઘરની શાંતિ’ અને અહીં ‘શાંત સઘણું’ બંનેમાં શાંતિનું સ્વરૂપ તદ્દન લિન્ન છે. ઘરની શાંતિમાં સ્થિર, અખૂટ સભરતા સૂચવાય છે, જ્યારે ‘શાંત સઘણું’માં બધી વાતો—કલરવ—ભાવ—પ્રતિભાવ જ્ઞાણે શમી-અટકી ગયાનો ભાવ પ્રગટે છે.

છ્ટાં થોડુંક આશાસન પણ હશે કે હજુ બે નાના પુત્રો અને પુત્રવધૂઓ તો ઘરમાં છે. તેની નવોઢ ભાર્યાઓ માટે સમાસપ્રધાન સંસ્કૃત પદાવલી ‘પ્રિયવચનમંદસ્થિત વતી’માં પુત્રવધૂઓનું સુંદર—ચાક્ષુસ ચિત્ર તો છે જ, ઉપરાંત હેવ ઘરમાં થતી વાતોમાં, સૌનું ચાલવું—બોલવું—બેસવું ઘરને માધુર્ય અને સભરતા બક્ષતાં હશે, એમની હાજરી માતા માટે આધાર અને આશાસનરૂપ બની રહી હશે. સામયા લઘુની રચનાવાળા શિખરિશી છંદથી એ કોમળતા વ્યંજિત થાય છે.

આખરે વિદાયની એ પળ આવી પહોંચે. ત્રીજા ખંડમાં (અંતિમ બે પંક્તિમાં) બપોરે બંને નાના પુત્રો અને તેમની પુત્રવધૂઓને (પાદરેશી જ હશે) વળાવીને ઘેર પાછી ફરેલી બાની આંખે ઘરનું દશ્ય વર્ણવાયું છે : ‘ગૃહબ્યાપી જોયો વિરહ’. માતા અનુભવે છે કે ઘરમાં વ્યક્તિઓ નહિ, વિરહ વ્યાપેલો છે. જાણે માત્ર એનું જ અસ્તિત્વ છે. ત્રીજો વડીલો જે સ્થિતિને વાણીમાં મૂકવા માગતાં નહોતાં, બામક આશાસનથી એની ઉપેક્ષા કરવા માગતાં હતાં એ હકીકત રૂપે સામે આવે છે ત્યારે જે ખાલીપો, અભાવ અને ઊંઘપ માતાને અનુભવાય છે તેનું વેંટું, ઘાઢું, કરુણ વર્ણન આપવાને બદલે કવિ માત્ર એક સ્થિતિ જ વર્ણવે છે : ‘પડી બેસી પગથિયે’. અહીં શબ્દ પરસંદગી અને છંદની રચના (લઘુ-ગુણુનો લય) સૂચયે છે કે માતા કેવી ભાંગી પડી હશે. ‘બેસી પડી’માં અવશતા છે તો ‘બેસી’ અને ‘પડી’ના પ્રાસમાં તેની હદ્યસ્થિતિ પ્રત્યક્ષ થાય છે. પગથિયે જ માતા ભાંગી પડે છે. અહીં માતાના કોઈ ઉદ્ગારને બદલે કેવળ સ્થિતિનું વર્ણન કરવામાં કવિનો સંયમ ફરી ધ્યાનપત્ર બને છે. કવિની એક ખૂબી એ પણ છે કે વિરહ પણ એક પાત્ર હોય અને સ્વજનો ઘર છોડીને ગયા અને વિરહ ઘરમાં ઘરાર જગ્યા મેળવી લીધી એવું કલ્યાચામાં સર્જનાત્મકતા તો છે જ, ઉપરાંત જનારનું અને નવા આવનારનું ચિત્ર પ્રત્યક્ષ થાય છે.

કવિતા સિદ્ધ થાય તેમાં સંવેદનની સૂક્ષ્મતા, વ્યાપકતા અને ગંભીરતા અસરકારક બને છે તેમજ અભિવ્યક્તિની મુલાયમતા, સચોટતા, શબ્દપસંદગી, છંદ અને લય, ભાવસ્થિતિના પલટા, પ્રગટ કરવા કરતાં અપ્રગટ રાખવાનો સંયમ – આ સઘણું નિર્ણાયક બને છે. સોનેટસ્વરૂપની પસંદગી તો સહેલી છે (ખાસ કરીને ઉશનસુ માટે) પરંતુ તેની સૂક્ષ્મ વિભાવના અને આંતરિક સુંદરતાને પ્રગટાવવામાં આ કવિનો વિશેષ

છે. ઘૂંટાયેલો કરુણ રસ વધુમાં વધુ અશાદ રહે તે કવિતંયમ આપણને સ્પર્શી જાય છે.

આવાં કાવ્યોનું ભાવન આપણને સ્વરૂપની ચુસ્તી અને છંદનું બંધન સ્વીકારવાનો પડકાર જીવવાની કવિ ઉશનસૂની ક્ષમતાનો પરિચય આપે છે. ‘વળાવી બા આવી’ કવિ ઉશનસૂની અવિસમરણીય રચના નીવડી આવી છે, કારણ કે એમાં આવી સધણી ગુણસમૃદ્ધિ છે.



## ‘ઝીણા-મોજાં’થી ‘સમુદ્ર છલકે છે’ સુધીની જાતરા

### ■ હર્ષ બ્રહ્મભટ ■

અત્યારે સક્રિયતાથી ગજલ લખતા ગુજરાતી ભાષાના ૧૦ કવિઓ ગણાવવા હોય તો કહોવિટી અને કોન્ટિટી – બંને સંદર્ભે અવિકારપૂર્વક હર્ષદ ચંદારાણાનું નામ મૂકી શકાય. એટલું માતબર કામ આ સર્જકનું છે. અમરેલીના આ કવિ રમેશ પારેખની આંગળી જાલી લખતા થયા, ને અત્યાર સુધીમાં છ સંગ્રહો આપ્યા. સાતમો થઈ શકે એટલી રચનાઓ હજુ ગ્રંથસ્થ થવી બાકી છે. આ બધું જોતાં સર્જકના ભાવવિશ્વમાં પ્રવેશવાનું સહજ આકર્ષણ જન્મે અને પ્રવેશયા પછી સંતર્પક અનુભવ પણ થાય. એ અનુભવોને કવિના કાવ્યવિશ્વનાં નિરીક્ષણ રૂપે મૂકવા મથીએ.

‘ઝીણા-મોજાં’ (૧૯૮૧)થી આરંભાયેલી કવિની સર્જનયાત્રા ‘સમુદ્ર છલકે છે’ (૨૦૧૨) સુધી પહોંચી છે. શીર્ષકો જ કવિના સર્જનનું કેન્દ્રબિંદુ ચીંધી આપે છે. બાવીસ વર્ષની, (આમ તો ર૨૪ વર્ષની) કવિની આ યાત્રાના કેન્દ્રમાં સમુદ્ર-ઝીણા-મોજાં-રેતી-નાળિયેરી જ હોવાનાં, એ વણકષ્ટું વ્યક્ત થાય છે અને આ યાત્રામાંથી પસાર થતા કવિને આત્મસાતુ ગજલ સ્વરૂપની પણ પ્રતીતિ થાય છે. ગજલકાર તરીકે જ સવિશેષ જ્યાત આ કવિએ ગીત અને અછાંદસ પર પડા હાથ અજમાયો છે ન એ ક્ષેત્રે પડા યાદગાર સર્જન કર્યું છે એય ન વીસરવું જોઈએ.

રમેશ પારેખ જેમને પૂરી ગંભીરતા અને આદર સાથે ‘કવિ’ કહે છે એમના પ્રથમ સંગ્રહમાં ગજલોની બહુલતા સાથે થોડાં ગીતોને અછાંદસ પણ છે. ‘નદીકંઠે’,

‘પડદામાં’ કે સરોવર-બેજ-દીપકનાં ગજલગુચ્છો આપતા ગજલકાર ટૂંકી-લાંબી, બંને પ્રકારની ગજલોમાં હાથ અજમાવે છે, ને મહદુંઘંશો સફળ પણ રહે છે. પહેલી જ ગજલ ‘મને બાંધ્યો / કમળ-ગાંઠે / રહ્યો તેથી / નદી કાંઠે’ જેવી ટૂંકી બહર સામે ‘ાંખો પાંખો સંંજ તણો અજવાસ ને આદે કોઈ બોલાવે / અંખો જોડી ઊભું સૂકું ઘાસ કે આદે કોઈ બોલાવે’ જેવી લાંબી બહર પણ છે. ગોવા, હિમાલય, દાર્જિલિંગ, નાગવા બીચના આ પ્રવાસીએ અનુભવોને ગજલમાં પણ ઢાળે છે, તો ‘પુષ્પોના નગરમાં’, ‘પુષ્પની વાત’, ‘પુષ્પની સાથે’ પણ વાત કરે છે. પણ નદી ને દરિયો આપણને વિશેષ ભીજીવે છે. ‘પ્રહર-આઠે / નદી-કાંઠે’ પસાર કરવાનું ઝંખતા કવિ દરિયાને છોકરા જેવો નભરાળો ને નદીને છોકરી જેવી લજાળું કહી ગજલમાં ઢાળે છે – ‘હું માગું આવતા જન્મે મળે જળનો મને અવતાર’ એવી કવિઝંખના ફીલા, મોઝાં, સૂર્ય, રેતી, નારિયેળીમાં જ કલરવની કચેરી ને ગામની શેરી જુઓ છે. નાગવા બીચના શાંત જળને, કોઈ વૃદ્ધ પળાંટી લગાવી બેઠો હોય તેવા દશ્ય-કલ્યાનમાં ઢાળે છે. માછલીની આંખમાં અટકળ વાંચતાં આ કવિની ઝંખના પણ કેવી દરિયામય બનવાની આરત સાથે પ્રગટી છે !

હાથની હોડી, હલેસું પાછીનું કરતો રહું  
એક દરિયો ચીતરીને કાગળે તરતો રહું.

સાત સાગરને પાંખમાં લઈ ઊડવા માટે સ્વભાનું પંખી પાળવાનું સૂચન કરતા કવિ ‘શબ્દ’ને જળથીયે અધિક મૂલ્યવાન આવેબે છે :

આ નદી, દરિયો, સરોવર, વીરરો –  
શબ્દની આગળ બધું નિર્જળ લખું.

પ્રિયતમાના પત્રની હોડી નાયકના આંખ-દરિયે તરાવતા કવિને મન દરિયો દોસ્ત છે :

આંખમાં આખો ભરાયો કોઈ ગમતાં દશ્ય જેવો,  
રોકી રાખ્યાં આંસુઓમાં છલછલે છે દોસ્ત દરિયો.

‘ચિહ્ની-દુલા’થી ભાવકને ખેંચતા કવિ, ‘ત્રણ ચુંબન’થી નિરાશ જરૂર કરે, પણ ગીતમાં ગમતીલા બની જાય. ‘નદીયું તો...’, ‘તારી યાદ’, ‘ઝાકળનાં પાંચસાત ટીપાં’ જેવાં ગીત સંગ્રહનો શાશગાર છે. તેમાંથે, ‘ઝાકળનાં...’ ગીત તો અનન્ય છે : આખીયે રાત તને કહેવાની વાત મેં બોલી રાખી તો થથાં ઝાકળનાં પાંચસાત ટીપાં

કવિની આ કલ્યાન અછંદાસમાં જરા નોખાં-નવાં રૂપેરંગે પ્રવેશો છે :

‘આ ઘાટ/ગેરુઓ રંગ પહેરી/સમાધિમાં છે ?’, ભેટે તલવાર બાંધી / કમર કરી / હું (યંદા) રાણો / ચઢી જાઉ વાદળ પર...’ જેવાં ‘રાજસ્થાન’ મુલાકાતાધારિત

અછાંદસ કે ‘લીલીછમ વેવી અમરેલી’ જેવું અછાંદસ કવિની અનોખી ઓળખ જમાં છે.

કવિનો બીજો સંગ્રહ ‘નદીને મળ્યા પછી’ (૧૯૮૫)માં પણ ‘કાગળમાં’ ‘નદીને મળ્યા પછી’, ‘નદી’, ‘હમરદીફ ગજલ’, ‘પંખી ઉડી ગયું’ જેવા ગજલગુંથો છે. કવિના આ સાતત્ય સાથે ગજલને સતત મઠારતા રહેવાની મથામણનું સાતત્ય પણ અહીં ધ્યાન ખેંચે છે. નદીને દરિયો તો હોવાનો જ, ‘કન્યાવિદાય’ અને ‘પુત્રવિવાહ’ જેવા વિષયો પણ પ્રવેશ્યા છે. ગજલ સાથે ગીત અને અછાંદસ પણ અહીં છે. પ્રિયતમાને સંબોધન કરતી ગજલમાં નામનો ચ્યામ્પટ્કાર જોવા જેવો છે.

‘તારું આ નામ માત્ર લખતામાં  
ચારે પ્રગટ્યા છે વેદ કાગળમાં’

‘તૃપ્તિ અને તરસની વચ્ચે રહ્યો સદા’ કહેતા કવિ નદીને મળ્યા પછીનો ચ્યામ્પટ્કાર પણ જતાવી શકે અને નદી માટે ખારાશ પણ સ્વીકારવા તૈયાર થાય !

મને મળવા તું આવે છે નથી ! એવીય અફ્વા હોત  
હું સાગર થાત ઘૂઘવતો, ભલેને સાવ ખારો હોત

‘શબ્દના તત્ત્વનો આ જાયો’ પ્રિયતમાને પણ ‘તું જ વરસે છે અહીં વરસાઈ’માં કહી તેની સર્વવ્યાપકતાને આવેલે છે. ‘વર્ષા’ નામની આખી ગજલ નોંધપાત્ર છે :

ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું યાણું છે વર્ષા  
કે વાણ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા

‘શબ્દોની સરહદો સુધી છે મારું રાજ્યાટ’ કહેતા કવિ ‘આ ચાલણગાડી શબ્દની લઈને / ચાલવાનો પ્રયાસ ચાલે છે’ એમ પણ લખે અને ‘તને તું ભલે માનતો હોય ગામા / અહીં શબ્દ જેવા મળે મલ્લ સામા’ એમ પણ કહે ! શબ્દનાં આ વિધવિધ રૂપ આકર્ષે. સંગ્રહની ‘ધાદ છે ?’ ‘ચાલ, સોંપી દે મને’, ‘વર્ષા કે નદીને મળ્યા પછી’ જેવી ગજલો યાદગાર બની રહે તેવી ને તેટલી સંસ્કૃતમ છે, તો ‘એ જ મારો મનોજ’, ‘મને કેં જ મળતું નથી’, ને ‘વસ્ત્રિયત’ પણ એ જ લાંબી બહરથી ધ્યાન ખેંચે છે.

ગીતોમાં ‘અળગા ન થાજો’, ‘કન્યાવિદાય’ અને ‘ક્યાંથી મળીએ’ લય અને ભાવની સમૃદ્ધિથી સ્વતંત્ર ટકી શકે એટલાં સમર્થ છે. પહેલા ગીતનો આ ઉપાડ જુઓ :

‘શધા એક કોળાંતું બીજ છે  
શ્યામ, તમે તાજી ઝૂપળ  
અળગા ન થાજો એક પળ’

- કે, ‘ક્યાંથી મળીએ’નો આરંભ તપાસો :

‘તું નીચે વેતી નદી, હું જિંયો બેખડ કાંઠો,  
સાખી રે, ક્યાંથી મળીએ !’

અણાંદસમાં, પૃથ્વી - / એક ટીપું છે આંસુનું - ‘એવી આજની સાંજ’, ‘કોરા  
કાગળ જેવા દીપ’ અને ‘પથરની ઉક્કિઓ’, ‘તને - એટલે -’ જેવાં લઘુકાવ્યો આપે  
છે. ‘પ્રેમ એક વૃક્ષ’માં પ્રેમને વૃક્ષની ઊંચાઈ સાંપડી છે, તો ‘મીરાંબાઈ... તને વધાઈ’માં  
મીરાં બની લખવા ધારેલાં કાવ્યો છે. એમાં પણ જળ બનવાની ઝંખના તો છે જ.

‘હે ઈશ્વર ! / મને જળનો રાશી / ન સર્જ શકે તો કાંઈ નહીં / પણ બનાવજે  
/ એક ટીપું ઝકળ...’

અંતમાં, ‘એકાંતના ઉપહાર’માં વિશ્વપ્રસિદ્ધ ફીટોગ્રાફર શ્રી અચ્છિન મહેતાના  
ફીટોગ્રાફ્સના પ્રતિભાવ રૂપે લખાયેલા ૮૮ દોહરા / સોરઠા છે, જે ગુજરાતી કવિતામાં  
જુદી ભાત પાડે છે.

‘કુલરવનું ઘર’ કવિનો ગ્રીજો કાવ્યસંગ્રહ (૧૯૮૮) પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો-  
આધારિત ૧૭ વિભાગો ધરાવતો પ્રકૃતિકેન્દ્રી આ સંગ્રહ સ્વરૂપેવિવિધ કરતાંથે  
વિષયસામ્યની બાબતે ‘નયનરમ્ય’ બન્યો છે. આ ‘નયનરમ્ય’ શબ્દ રમેશ પારેખનો  
છે. વૃક્ષ, પંખી, પુષ્પ, પવન, પર્વત, આકાશ, વર્ષા, નદી, સરોવર, દરિયો આદિ  
વિભાગોમાં ગજલ છે તો કોઈ ગજલના શેર પણ છે. થોડાં નવાં તો થોડાં પૂર્વે લખાયેલાં  
કાવ્યોનો આ સંચય કવિને પ્રકૃતિપ્રેમી તરીકે જરૂર ઓળખાવે છે.

‘લેલ જેવા કેટલાયે ઓરતા વીંયાય છે  
વૃક્ષને લાંબા સમયની કેદ ગમતી જાય છે’

ગજલમાં નાજુક ભાવોનું ગુંથન અહીં જોઈ શકાય. આવો જ બીજો શે’ર  
મમળાવવા જેવો ખરો !

પાનખર જેવી જ છે હરએક મારી કાજ છતાં,  
અંખમાં છે કેમ લીલાં ઝડપાંની આવ-જા ?

થોડી પ્રકૃતિ-વ્યાખ્યા પણ વાંચવી ગમે :

- ‘પંતિયાં-/બુદ્ધ ઉદત્તં લઘુકાવ્યો’
- ‘તડકો-/જાણે તાનસેનનો દીપક રાગ’
- ‘પર્વતો/બુદ્ધ તબલા ને બુદ્ધ તબલચી’

પર્વતવરણ ટ્રસ્ટ દ્વારા આયોજિત પર્વતવરણજાગૃતિ અંતર્ગત પરીક્ષામાં સંદર્ભ-  
પુસ્તક તરીકે સમાવેશ પામેલ આ સંગ્રહ પ્રકૃતિને ચાહનારાએ તો અચૂક વાંચવો /  
વસાવવો જ રહ્યો.

‘હાથની હોડી’ (૨૦૦૨)માં માત્ર ગજલો જ હોઈ, ગજલસંગ્રહ છે :

ગજલ આ લખી તે સમયનો તકાદો  
ભૂસે, સાચવે તે સમયનો ચુકાદો

ગજલને દૂત બનાવી વિશ્વમાં પળભરમાં પહોંચવા માંગતા કવિ ગજલનો ધરમ  
પણ નોંધે :

‘તમારે હદ્ય છે, સ્મરણ એ કરારે  
ગજલનો ધરમ સાવ સીધો ને સાદો’

મનહર મોટીના ‘ગમતા - ગમી જાય એવા’ આ ગજલકારની હથોટીનો  
સાક્ષાત્કાર આ સંગ્રહ કરાવે છે. અહીં પણ ગજલની સાથે ગજલગુચ્છો છે. થોડી  
ગજલો પુનરાવર્તિત પણ થઈ છે ત્યારે કવિની આ લાલસા સમજાતી નથી. ગજલ-  
અષ્ટકનો પ્રયોગ નવો છે. (જે આગળ જતાં કવિ પાસે ૧૦૮ શેરની દીર્ઘ ગજલ લખવા  
પ્રેરે છે) ગજલને જ જાણે આવકારતાં હોય તેમ કવિ ‘ઝકુચક’માં લખે છે :

આવ તું, મારું પાતાળ આપું તને,  
છતીએ દ્વાર સમ ચાસ આપું તને

ગજલકારનો મિજાજ ‘રહીએ’ ગજલમાં પમાય છે :

શેત કાગળના ગામમાં રહીએ,  
શાદ છીએ, દમામમાં રહીએ

કવિની ભાવભવ્ય કલ્યનાનું નાજૂક સંવેદન પણ કોઈ શેરમાં જકડી લે :

‘હાથમાં લઈ હાથ, મલમલ જાળથી  
પાંદડું તોડું હવાએ ડાળથી’

‘અમે ઝકળનાં ટીપાંથી તમારું નામ લખતા’તા’ એવું લખતા કવિએ પ્રાગયવેદના  
પણ ગાઈ છે :

તું મને સાદ દઈને શિખર થઈ ગઈ  
ખીણ થઈ મારું પડ્યાઈને રહી જવું.

‘ઝરણ જેવું સ્મરણ’ પ્રિયાનું, પ્રિયા વિના કવિને અડધા-અધૂરાપણાનો અહેસાસ  
જગાવે છે :

‘તું’ વગરનું ગામ અડધું, ચીમ અડધી, ઘર અધૂરું  
રણ અધૂરું, ઝાંઝવાનું ગૂમારું અડધું – અધૂરું’

ગજલ-અષ્ટકમાં ‘મેઘ બારેય ખંગ, હોઠોમાં’ ગાતા કવિ પ્રેમના પ્રાગટ્યની કષણને  
‘તિરાડ’ જેવા નકારવાચક શબ્દથી કેમ ઓળખાવતા હશે ?

‘નાની શી હો તિરાડ હૈયામાં  
તો પ્રવેશે અણાઢ હૈયામાં (!)’

પરંતુ, આ જ અષ્ટકમાં ઘણા શે'ર ધ્યાનપાઈ છે, તેમાંનો એક 'એ સમુદ્રી તોઝાન  
મારામાં / નાવ પણ હું, સુકાન મારામાં'

કવિની જળંખના સુખયાત છે. 'નદીકાંઠ'માં આ જુઓ કઈ રીતે વ્યક્ત થઈ  
છે :

'ઘણાં વર્ષે નદીકાંઠે બની પથર પડ્યો છું હું,

સદાયે માઇલી માર્ફક તને જળ તરફડ્યો છું હું'

કવિની અન્ય વાદગાર ગજલોમાં 'વર્ષા, દરિયો અને હું', 'જળ પર લકીર',  
'ગુનો કર્યો', 'આવ્યા છે' જેવી રચનાઓ જોઈ શકાય (અન્ય સ્મરણસમર્થ ગજલો  
અન્ય સંગ્રહમાં હોવાથી અહીં એનો ઉલ્લેખ ગણ્યો છે.) 'આવ્યા છે'ના બે અન્યન્ય  
શેર નોંધવા યોગ્ય :

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે

નવાં કેં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.

અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,

અમારે દ્વાર, જળનું રૂપ લઈ ટાકોર આવ્યા છે'

'કિરણોની પોટલી' અને 'સમુદ્ર છલકે છે' એ બંને સંગ્રહો ૨૦૧૨માં પ્રગટ  
થયા છે. જેમાં પ્રથમમાં કવિનું નોખું રૂપ પ્રગટે છે. અહીં 'દીકરી' નામે દિલને સ્પર્શિતું,  
નાના-નાના ખંડોશી સર્જંગ સંવેદન જગવતું આત્મીય એવું અછાંદસ છે તો ૧૦૮  
શેરની ગજલમાળા પણ છે ! 'શૈશવમાં સપનામાં જોયેલી પરી, / સદેહે અવતરિ....  
થઈ દીકરીથી આરંભાતું કાબ્ય 'વિદાય લીધેલી માની જળા / દીકરીએ કયારે લઈ  
લીધી / તે ખબરેય ના પડી' સાથે પૂરું થાય ત્યારે ભલભલાની આંખો ભીની થઈ  
જાય.'

ઓસ્કાર વાઈલની વાર્તા 'જાયન્ટ્રસ ગાઈન' આધારિત મળતું અછાંદસ  
'ફળિયાના બાગમાં' હોય કે 'કિરણોની પોટલી'નું અછાંદસ, કવિની સર્જકતાનાં ઉત્તમ  
ઉદ્ઘારણ છે. કવિએ માત્ર અછાંદસ જ લખ્યાં હોત તોયે સિદ્ધિ તેમને જઈ વરત  
એ આ કાબ્યો જોતાં અનુભવાય છે.

'હરિ ! હું બાવળ, તું ગુલમોર' જેવું ગીત ઊંચાઈની ગહનતા દર્શાવે છે તો,  
'ધ્રાંગડ ધ્રાંગડ' જેવી ગીતરચના લગ્નનો માહોલ રચતી નાદ-સૌંદર્ય રચે છે. 'વાંકાં  
વળગણા', 'વાલમ વરણાગ્યો', 'ગીત ગાતાં ચોઘડિયાં', 'પાન અવસરનાં' જેવાં ગીતોમાં  
પણ લગ્નોની મોસમ છલકી છે, સ્વજનનાં સંતાનોનાં લગ્ન નિમિત્તે લખાયેલાં આ

ગીતોમાં ભાવસૌંદર્ય સાથે લયનિખાર આકર્ષે છે.

‘ગુજરાતમાળા’ નવો પ્રયોગ છે. મધ્યમ બહરના ૧૦૮ શેર સાથે પ્રથમ ‘વંદના’ અને અંતે ‘સમાપના’ના એક એક શેર સાથે ૧૧૦ શેરની આ દીર્ઘરચનામાં કવિએ રદીફ-કાફિયા સરળ પસંદ કર્યા છે, જેથી તેની દીર્ઘતમાં અવરોધ ન જન્મે. દરેક શેર સ્વતંત્ર હોવાથી, ને ‘લાગે’ જેવા રદીફથી કવિ સાતત્ય જાળવી શક્યા છે.

ઘણા-ઘણા શે’ર એના તાજગીભર્યા મિજાજથી સ્પર્શક્ષમ બન્યા છે.

- લીલાં હેરાતાં ખેતરો પંક્તિઓ છે  
ધરા છે મહાકાવ્ય, સમજાતું લાગે
- પૂરા ધ્યાનથી એકલો ચાંબળું છું  
ગુજરાત એકધારી, હઠય ગાતું લાગે
- હજુ વાળમાં હાથ ‘મા’નો ફેરે છે  
મને બાળપણ પાછું જિવાતું લાગે

કવિની સફળ દીર્ઘ ચનનામાં અચૂક સમાવવી પડે એવી આ ગુજરાતી દીર્ઘ ગુજરાતોમાં પણ પોતાની જગ્યા અચૂક કરી શકે તેટલી સમર્થ છે.

ગાંધી, મોરાસિબાપુ જેવા મહાનુભાવો અને અમૃત ધાયલ, અમર પાલનપુરી, રમેશ પારેખ, કલાપી, મનોજ બંડેરિયા, રાજેન્દ્ર શુક્લ આદિ કવિઓનાં ચિત્રો પણ અહીં ગુજરાત રૂપે મળે એમાં રમેશ પરંપરાનાં જ દર્શન થાય ! મનોહર નિવેદી, રાજેશ વ્યાસ, હર્ષ બ્રહ્મભણ અને ભરત વિજુડા પણ અહીં ગુજરાતમાં ફળ્યા છે અને ‘ઝાઈલો પીરે ને ફોન ખાઈ છતાં જીવે !’ એવા સ્વયં હર્ષદ ચંદ્રારાણા પણ અહીં, અન્ય કવિઓની કલમે સંગ્રહાયા છે.

‘સમુદ્ર છલકે છે’માં કવિની કલમ વધુ ધીર-સ્થિર બની છે. ગુજરાતનું બાહુલ્ય જ અહીં છે. ગુજરાતસંગ્રહ જ કહી શકાય આને. ‘ગોપીગુજરાત’, ‘તું’ અને ‘ભોસમ’ જેવાં ગુજરાતગુચ્છો પણ આકર્ષણ જન્માવે છે. પ્રાર્થના ગુજરાતમાં ‘ના બનું સંપૂર્ણ, કે ક્ષતિ આપજે’ની નમ્રતા સ્પર્શે છે, તો ‘જોગીડા’ માં ‘શાસનાં ઓશીકાં, પંડનાં પાથરાં/ આપશું પ્રાણનાં પોઢણાં, જોગીડા !’ની આતિથ્યભાવના આકર્ષે છે. ‘બાવરો’માં હરિવરની આ નવી ઓળખ જુઓ :

શબ્દ તું, નરસોહ તું ને તું જ આ જલતી મશાલ  
હાથ બાળે ને પછી ઘર, તું નિરંતર બાવરો  
‘મીરાં’નું નવું રૂપ પણ અહીં મળે :

મોંસૂલાણું થયું છે, પ્રગાઠી સવાર મીરાં  
 ના સૂર્યથી ઉત્તરતી, ઝળહળ અપાર મીરાં  
 હરિ કોણ, કોણ મીરાં ? સહેજ ન લેદ પરખાય  
 મીરાંની સૌંસરા હરિ, હરિ આરપાર મીરાં'

'કોઈ નકશાથી નથી સંબંધ, મારે તો જરૂરું -' એવા ભાવ સાથે ગજલ લખતા  
 આ કવિ 'લખું છું ગજલ તે ઉજાણી કરું છું' એવા નિજાનંદી પણ છે.

પૂછ્યે ને, ગજલથી મને શું મળે છે ?  
 મહોબતની મબલખ કમાણી કરું છું -

કહેતા કવિની ભીતર સમુદ્ર છલકે છે. દરિયો પી જનારા આ કવિની તરસ  
 એક સાચા ગજલકારની તરસ છે :

સકળ બ્રહ્માંડથી મારી તરસનો વ્યાપ જાઓ,  
 પીતાં ઓછો પડ્યો... હે રામ ! દરિયો પી ગયો છું.

કવિની અન્ય થોડી અગ્રથસ્થ ગજલો પણ યાદ કરવા જેવી ખરી, જે અત્યાર  
 સુધીમાં જુદાં-જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી છે. એમાં 'સવાર આવી', 'બપોર આવી',  
 'સાંજ આવી', 'રાત આવી'ના ભાવસાતત્ત્વવાળી ગજલોને ટાંકી શકાય તો, 'એ કોણ  
 છે ?' 'જીણી જાળમાં', 'લખ', 'કિનારા' ને 'વ્હાલા' જેવી ગજલો પણ તપારી શકાય.  
 તેમાં સર્જકતાના ઉન્ભેષે દર્શાવતા થોડા શેર જુઓ :

- અંધાર ખૂબ કાળો, ચૂમી રહ્યો છું જે હું  
 તારા એ ગાલ છે કે ગુલમ્બોર ? ચાત આવી. ('ચાત આવી')
- કોઈ મારામાં નિરંતર ટળવળો એ કોણ છે ?  
 કેં વરસથી મુક્ત થાવા ખળખળે, એ કોણ છે ? ('એ કોણ છે ?')
- બોળ, આકળમાં સળી ને નામ લખ  
 પત્ર કર તું પાંદડાને, ઢામ લખ. ('લખ')
- વહે છે ધરધાધરધાર રોરગમાં સતત, વહાલા !  
 ગજલમાં લોહી છે મારું, ન સગપણ ખાનગી રાખ્યું ('વહાલા !')

'જીણી જાળમાં' ગજલનો પ્રત્યેક શેર કબીર, સાંઈ બાબા, મીરાં, ગંગાસતી,  
 નરસિંહ કે સુદામાનો સંદર્ભ લઈને ભાવની ઊંચાઈને સ્પર્શે છે. આ સંતસંદર્ભ ગજલને  
 ગરિમા બદ્ધ છે, તો ચિત્રકાર મિત્રોની સ્મૃતિએ લખાયેલ અછાંદસ 'એક ચિત્રકારની  
 કેફિયત'માં કવિકલ્પન કેવું કહ્યું છે : 'પાંછી.../ એ તો મારા જમણા હાથની / છણી

આંગળી છે,

કવિ હર્ષદ ચંદ્રારાણા ગજલનો જીવ છે, તેમ જળનું જૂજવું રૂપ પણ છે ! છેલ્લા ત્રણેક દાયકાથી સતત લખતા આ કવિએ દરિયાને દ્વિલમાં ઉતાર્યો છે ને ગજલને ગળામાં ધારી છે. આંગળીમાંથી ટપકતા શબ્દો સહજતાથી કાવ્યરૂપ ધરે એટલું માતબર ખેડાણ આ કવિનું હોવા છતાં, ને ગુણવત્તાસભર અનેક રચનાઓ સર્જવા છતાં કેમ આ કવિ પોંખાવો જોઈએ એટલો પોંખાયો નથી એ ચિંતાનો વિષય છે. વિવેચકોની ઉદાસીનતા કે નિર્ણાયકોની નિર્દેખતા એમાં કારણભૂત હશે ? તપાસવું રહ્યું.

---

### સાભાર સ્વીકાર પ્રક્રીષ્ટ

(૧૮૮) મહામાનવ આંબેડકર : રમેશચંદ્ર પરમાર, સંવર્ધિત બીજી ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરલ્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૨૦, રૂ. ૧૩૦ (૧૯૦) વિદ્યાપુરુષ આંબેડકર : રમેશચંદ્ર પરમાર સંવર્ધિત : ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરલ્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૦૮, રૂ. ૧૨૦ (૧૯૧) મૂક નાયક આંબેડકર : રમેશચંદ્ર પરમાર સંવર્ધિત : ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરલ્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૧૨, રૂ. ૧૨૦ (૧૯૨) સમાજસુધારક આંબેડકર : રમેશચંદ્ર પરમાર સંવર્ધિત : ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરલ્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૨+૧૮૨, રૂ. ૧૦૦ (૧૯૩) કાનૂનદાતા આંબેડકર : રમેશચંદ્ર પરમાર, સંવર્ધિત : ૨૦૧૫, ગૂર્જર ગ્રંથરલ્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૧૬+૧૦૦, રૂ. ૧૧૦

## ફાર્બસ ગુજરાતી સભા ટ્રેમાસિક દ્વારા ગુજરાતનાં દોઢસો-બસો વર્ષ પર હરખ થાય એવો દસ્તિપાત

■ ઓસ. ડી. હેસાઈ ■

“ધ સ્ટોરી ઓવ્ટ સિવિલાઈલેશન”માં વિલ દુરાંટ કહે છે કે માનવજાત માટે વિકાસની શક્યતા વાસ્તવિક છે કારણ કે ઈતિહાસ એક બાજુ ધંસાત્મક વાતોથી ભરપૂર છે તો બીજુ બાજુ મનુષ્યની સર્જનાત્મક પ્રતિભાથી પણ જળહળે છે. એ પ્રતિભાઓની સિદ્ધિઓ સાંસ્કૃતિક વારસા તરીકે સચ્ચવાય અને પેઢી દર પેઢી આગળ પહોંચતી રહે તો તે રાજ્યો અને સામાજિકોને જંખાં પાડી દઈ આપણને સમૃદ્ધ કરતી રહે.

પ્રસિદ્ધિની કળામાં માહિર આજના સમયમાં નાનામોટા સ્વરૂપે ઘડાયા કરતા આ સાંસ્કૃતિક વારસાને પ્રોજેક્ટલિત કરી તેને નવી પેઢી સુધી આગળ ધ્યાવવાની સવિશેષ આવશ્યકતા દેખાય છે. સમગ્ર મનુષ્યજાતનો વારસો પ્રજાગત અને તે પ્રજાગત વારસાઓ જે તે ભૌગોલિક પ્રદેશના નાના ઘટકોથી આકાર લેતા જોઈ શકાય. સ્થાનિક પ્રદેશ ગુજરાતની છેલ્લાં દોઢસો વર્ષની સામાજિક ઉત્કાંતિને અન્ધકાર કેમેરા વડે ઝડપીને તેને રજૂ કરવાનું છેલ્લાં ૧૦ વર્ષથી ‘ફાર્બસ ગુજરાતી સભા ટ્રેમાસિક’ના સંપાદક રહેલા પ્રબુદ્ધ કવિ-નાટ્યકાર સિતાંશુ યથશ્વંદને તેમની કાર્યદક્ષ ટુકડીના સહારે સૂઝ્યાંદું. તેના પરિણામરૂપે ટ્રેમાસિકના આઠસોથી વધુ પૃષ્ઠમાં પથરાયેલા ત્રણ સાર્ધશતાબ્દી વિશેષાંકો બન્યા છે.

પ્રજાના નિરંતર ચાલ્યા કરતા ઘડતરનો કોઈ અંતિમ પડાવ તો હોતો નથી. જ્યિતિજ તરફ આગળ ને આગળ અને, તેથી વિશેષ તો, આકાશ તરફની સતત ચાલતી રહેતી ગતિ એટલા માટે તો મોહક છે. ટેનિસના કલ્યનથી જોઈએ તો દરેક પડાવ આગળ એવી કમાન રચાઈ જાય જેમાંથી જોતાં સુદૂર સુધી અદીઠ રહેલી ભૂમિ ઝળહળતી દેખાય. ટ્રેમાસિક વિશેષાંકો “મીમાંસાપર્વ ૧, ૨ અને ૩” ૨૧મી સદીના આજના આપણા કામચલાઉ પડાવ પરથી છેલ્લાં દોઢસો-બસો, ક્યારેક તેથી પણ વધુ, વર્ષ દરમિયાન ઉત્કાંત થતા રહેલા ગુજરાત પર કલ્યનાશીલતાથી, હરખ થાય તેવો, દસ્તિપાત કરાવે છે. ફાર્બસ ગુજરાતી સભાનું સ્થાપનાવર્ષ ૧૮૬૫ અને

તૈમાસિકનો આરંભ એપ્રિલ-જૂન ૧૯૪૦થી.

વિશેષાંકોની ખંતીલી ઉત્થનન-ટુકડી સંશોધન કરતી પાછલાં વર્ષોમાં ૧૯૭૬ સુધી પહોંચી ગઈ છે. એ વર્ષમાં મુખ્યમાં પ્રથમ ‘ગુજરાતી બીજું’ બહેરામજી જીજાભાઈએ બનાવ્યું. ત્યારથી માંગીને આજ સુધીની ગુજરાતી છાપકામની, કહો ને, આ વિશેષાંકો સુધીની વિકાસયાત્રા મનોમન મમળાવવા જેવી છે. અતિ આધુનિક કેમેરા અને તેની પ્રભાવક ફૂટિઓનાં સરજનોની સરખામણીમાં આરંભનો, ટાંકણીનું હોય તેવું છિદ્ર ધરાવતો (pinhole) કેમેરા અને એના દ્વારા સામેની બાજુ મળતી ઊંઘી આકૃતિ આદિમ અવસ્થાનાં લાગે. આમ છતાં, કદાચ એટલે જ, ફિલ્મસર્જનના ઇતિહાસમાં તેને ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે. ત્રણ વિશેષ અંકોની દસ્તિસંપન્ન સંશોધન ટુકડી પ્રથમ ગુજરાતી બીબાં સુધી જઈ તેને ગૌરવ પ્રદાન કરે છે. ગુજરાતી છાપકામના પ્રકૃત્વ તબક્કે, ૨૨૦ વર્ષ પછી આજ સુધીનો, ગુજરાતી ભાષાનો વિકાસ જોઈને આપણને સૌને પણ ગૌરવ થાય.

આરંભનાં વર્ષોમાં છાપાયેલાં ૧૮૨૨ સુધીના પાંસઠ જેટલાં પુસ્તકોની ભાષા અને વિષય બંને દસ્તિએ રસપ્રદ યાદી બને છે. એમાં પંચાંગો છે, ‘અસલી ખુદાની ખૂલ્લી’ અને ‘ખોરદેહ અવસ્થાનો તરજૂમો’ છે, ‘માથાઉનાં સદેશ’ (Gospel of Matthew), ‘આપડો મસીહાની નીતિકથા’ અને ‘બચાઓ માટે શિખામણ’ પણ છે. વિશેષ ધ્યાન ખેંચતાં બે પુસ્તકો છે : ‘અંગરેજ વેઅકરણની કેતાબનો તરજૂમો !’ તथા ‘ગુજરાતી વાકાબિલારી’ (૧૮૨૨). લગભગ બધાં અનુવાદનાં પુસ્તકો છે. ‘વાકાબિલારી’ (Vocabulary) જેવા શબ્દોમાં રમૂજી ઉચ્ચારદોષ જ જોવાને કારણ નથી. જરૂરી બીબાં નહીં હોય એમ માનવાને પૂરો અવકાશ છે. આ યાદી આપનાર મેહલી ભાંડપવાલાનો યાદી પહેલાં ચાણીસથી વધુ પાનાંનો દીર્ઘ લેખ ‘ઓગણીસમી સદીની શરૂઆતમાં ગુજરાતી છાપકામ’ છે. તેમાં, એક ‘લાંબો કસરતી બદનનો નવજીવાન’ એક હિસે ‘ધાર્ણી જ ઉકમાઈથી મલકમલક હસીને એક ત્રણસો પાનાંની ચોપડી ટેબલ પર મૂકીને અદબ વાળીને ઊભો રહ્યો.’ તેવો ઉલ્લેખ છે. ભાંડપવાલા લખે છે, ‘આ ચોપડીનાં પાનાં ફેરવી જતાં એટલો હરખ એટલી મગરૂરી એટલી ખુશાલી મને દ્રિલમાં ઊભરી આવી...’ એટલો હરખ એટલી મગરૂરી એટલી ખુશાલી આ વિશેષાંકોના પાનાં ફેરવતાં થાય એવું છે કારણ કે તે આપણી ભાષા અને તેમાં ખેડાયેલા સાહિત્યનું ગમી જતું અતીતસ્મરણ કરાવે છે.

આ તૈમાસિક (૧૯૪૦-૨૦૧૬) પૂર્વના સમયનો શબ્દદેહ ઘડાયો છે ‘બુદ્ધિમકાશ’, ‘સ્ત્રીબોધ’, ‘શાનસુધા’, ‘ગુજરાતી શાળાપત્ર’ વગેરેમાં પ્રકાશિત લેખો દ્વારા. તે લેખો પાછા યથાતથ હોવાનો અનુભવ આપવા માટે તેની ફોટોકોપી મુકાઈ

છે. તે જોતાં-વાંચતાં તત્કાલીન સમયમાં રોમાંચક રીતે સંકાંત થઈ જાવ. હાથ પકડીને તે સમયમાં લઈ જવા માટે વિષયો પણ ઓછા આકર્ષક નથી. અહીં ‘દુલપત્રામ કવેશરે... કુરુપા કરી બનાવેલા ગરબાઓ’ છે તો ‘નઠારી ફરણીજ ઠેકાણો આવી’ નાટક છે. ‘મુસલમાનોનું રાજ્ય સારું કે મરાઠાઓનું?’ અને ‘વાચનમાળા કેવી હોવી જોઈએ?’ તેના પર ચર્ચા છે. તો વળી, ‘લેખકો અને સુધારકો’, ‘માતીના ખાડિયા’, ‘મૃત્કા પત્થર : રલેટ અને સ્લેટપેન’ પણ નજરે પડે છે.

(૨)

વિશેષાંકોનું પ્રથમ દર્શન એક રંગીન લઘુચિત્રથી થાય છે. ચિત્ર ઊંચાઈમાં ત્રણેક ઠંચ. ઉપરનીએ સરળતાથી ઉકેલી ન શકાય એવી વિપિમાં સુંદર મરોડવાળું લખાણ. સપ્રમાણ ચિત્રસંયોજનમાં લઘુસૂચિ. આકર્ષક અંગભંગી સાથે સંવાદ કરતી બે લલનાઓ. તેમની આસપાસ પશુ-પક્ષી-વનસ્પતિની જીવંત થઈ ઊઠતી વિવિધતા. સમગ્ર ચિત્રમાં પ્રવાહિતા. સંપાદકનો સર્વગ્રાહી પ્રવેશક તો આઠમા પણે. તે પહેલાં, વિશેષાંકોની ઓળખ આપી દેતું વિશેષાંક-૧નું આ રંગીન આવરણ. જૂની ગુજરાતીમાં શૃંગારપ્રધાન મધ્યકાલીન કાવ્ય ‘વસંતવિલાસફણુ’નો પ્રસંગ. ચિત્ર પૂરું ઉકેલવાની ઉત્કર્ષા છિપાવવા અંદર જુઓ તો પ્રવેશક પહેલાં આ અને અચ્ય લઘુચિત્રોનું કલારહસ્ય ઉદ્ઘાટિત કરતું લઘુચિત્રની જેમ લઘુલખાણ કલાવિદ રતન પારિમૂ દ્વારા. એક આ કલાધૂંટ ગુજરાતના જ્ઞાન-કલાવારસાનો ક્ષુધાઉતોજક સ્વાચ આપી હે છે. મોગલ ચિત્રશૈલી પૂર્વની આ જેન ચિત્રશૈલી, ગુજરાતની તેટલી સમગ્ર ભારતની. એ શૈલીના કેટલાક કલાકારોને અકબરે (૧૫૪૬-૧૬૦૫) પોતાના દરબારમાં સ્થાન આપેલું.

પ્રથમ વિશેષાંકનું આ મુખપૃષ્ઠ વિલક્ષણાતાથી ત્રણો વિશેષાંકેનું હાઈ વ્યક્ત કરે છે. અપારંપરિક ભાતમાં ઊઘડતાં એનાં પૃષ્ઠો આશ્ર્ય સર્જતા રહે છે. નિમિત્ત છે ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપનાનાં દોઢસો વર્ષ (૧૮૬૫-૨૦૧૬), લક્ષ્ય છે એ વર્ષો દરમિયાન સમાજનો જે સંસ્કારપિદ બંધાયો, બંધાતો જતો હતો, તેનો સ્પર્શ આપવાનું. એ સ્પર્શ આ વર્ષો, વિશે આ તબક્કાનાં આરંભનાં વર્ષો દરમિયાન સામયિકીમાં પ્રગત થયેલાં લખાણો દ્વારા મળે છે. આ લખાણો ત્રણેક કારણે રોમાંચક બને છે. એક તો એ લખાણોની તે સમયની લાક્ષણિક પરિચિત મીઠી શૈલી. બીજું, એ લખાણોમાં વ્યક્ત થતા વિચારો, જેમાં લેખકોની સમાજ અને મૂલ્યોસંબંધિત પ્રામાણિક નિરબત હૃદયરૂપરૂપી છે. અને ત્રીજું, તત્કાલીન સમાજ પર લાદાયેલા વિદેશી શાસન વચ્ચે રહીને મૂલ્યનિષ્ઠ ઉચ્ચતર વિચારો અને સમાજરચના તરફના સંકમણ માટેના સંઘર્ષની પ્રતીતિ. આમ છતાં, પિન્ટરને પૂછો, શબ્દની પ્રકૃતિ થોડે અંશે પણ સ્કુટ થઈ જવાની. એ જોતાં, સમતુલા માટે, અભિવ્યક્તિની ધ્વનિજબકારથી સમૃદ્ધ સંકેતભાષાનો

(Semioticsનો) પ્રયોગ થયો છે. ઉપર જેની વાત કરી, લઘુચિત્રની, તે એનું સર્વોત્તમ ઉદાહરણ છે.

તૈમાસિકની સ્થાપના પહેલાંનાં વર્ષો સંદર્ભે અન્ય સામયિકોનાં પૃષ્ઠોને ઝોટોકોપીથી પુનર્જીવિત કરી રજૂ કરવાથી એમાં મળુની મુદ્રણશૈલી વગેરેને કારણે સંકેતભાષા મળે છે, જેને કારણે એમાંથી તે સમયની સુગંધ પ્રસરે છે. કોઈ પણ સામયિક તો શબ્દની સૃષ્ટિનું માધ્યમ. આ વિશેષાંકો એની સંકેતભાષાથી મહોરી ઊઠ્યા છે. એવા ઊડાણ ચીધે કે ઝૂબકી મારવાનું મન થાય. કલ્યાસૂત્રમાંથી વિશેષાંક-રમાં મૂકેલ રંગીન આવરણ ‘ત્રિશલાના ચૌદ સ્વખન’ (૧૮૪૮) સ્મરણ કરાવે કે કલામાધ્યમથી બુદ્ધ અને બૌદ્ધ ધર્મ અંગે ગુજરાતીઓ, વાસ્તવમાં ભારતીયો પણ, જાણે છે તેટલું તીર્થકર મહાવીર અને જૈન ધર્મ અંગે નથી જાણતા. મહાવીરના માતા રાણી ત્રિશલાને બાળક મહાવીરનો ગર્ભ ધારણ કર્યા પછી ચૌદ મંગલ સ્વખનો આવેલાં. તેના પતિ રાજ સિદ્ધાર્થે દરભારના વિદ્ધાનોને પૂછ્યું, તો તેમણે કહ્યું કે એ સ્વખનો દર્શાવે છે કે થનાર બાળક ગુણવાન અને સમર્થ હશે. વિદ્ધાનોએ સંકેતભાષા ઉકેલી આપી. કલા અને સંકેત અંગે વિચારવાનાં દ્વાર તૈમાસિક વાચક માટે પણ ખૂલ્યાં, આ અને અન્ય ચિત્રો દ્વારા. ભવિષ્યમાં સિતાંશુભાઈ આ વિષય પર એક વિશેષાંક આપે.

વિશેષાંકોમાં સંકેતની ભાષાનાં વિવિધ પરિમાણો ખૂલે છે. બીજો વિશેષાંક તો પૂરેપૂરો ચૌંદર્ઘદસ્તિ અને પ્રાચીન તથા આધુનિક કલા અને કલાકારોને સમર્પિત થેથેલો છે. એમાં ‘રાડોડ રાઉ રતનજીની વચનિકા’ હસ્તપ્રતનાં રંગીન ચિત્રો ઉપરાંત એ પ્રકારની લોકકલાશૈલીનાં ચિત્રો છે, તેમજ કચ્છનાં ભીતિચિત્રો પ્રકારનાં ઝીણી વિગતો આપતાં ચિત્રોની ઝોટોકોપીઓ અને અન્ય ચિત્રો પણ છે. બંને લોકકલાશૈલીનાં છતાં વિભિન્ન ‘વચનિકા’ની પ્રસ્તુતિનોંથ કહે છે કે તેની શૈલી મુઘલ-રાજસ્થાની-ગુજરાતી લઘુચિત્રશૈલી. બળવા સમયના ઔરંગજેબ-શાહજહાં યુદ્ધદશ્યો, જે-તે ઘટનાની જાણે કે આધુનિક રંગીન ઝોટો ઇમેજ - પૂરા કદની મનુષ્ય અને પશુ-આકૃતિ સાથે. સૈનિકોનું ગમન, તોપ આદિ હથિયારોનું વહન, અશ્ચ અને ગજ-સવારોની સામસામી ઝપાઝપી, યુદ્ધ/વિજયઘોષણા વગેરે. ચિત્રોમાં આકૃતિઓ વચ્ચે આંતરક્કિયા, પહેરવેશની વિગતો અને ગતિશીલતાનો આભાસ.

ભીતિચિત્રો સૈકાઓ જૂની પરંપરાના. લઘુકદની કોડીબંધ આકૃતિઓ સાથે રામ-રાવણ યુદ્ધદશ્યો, કૃષ્ણાની આંગળીએ ગોવર્ધન પર્વત પરની કે ભરતને મળવા જતા રામના પથની આસપાસની પ્રાણી-વનસ્પતિસૃષ્ટિ. આમ રામાયણ અને કૃષ્ણજીવનમાંથી હિન્દુઓને પરિચિત અને આસ્થાપ્રેરક પ્રસંગોનું ધીરજપૂર્વક કલાત્મક ચિત્રાંકન. આ બધાં અને જામનગરનાં ભીતિચિત્રોના નમૂનાઓનું રસાસ્વાદન વિદ્ધાનો દ્વારા લખાયેલ

મૂળ અંગેજી લેખોના સારા અનુવાદમાં જોવા મળે છે. આગળ જતા, ડભોઈનાં શિલ્પ-સ્થાપત્યની વિગતો આપતો એક વિસ્તૃત લેખ પણ છે.

કચ્છનાં આ ભીતચિનો કલાકારોના સમૂહે તૈયાર કર્યા લાગે છે. તે ઘરની અને મંદિરની દીવાલો, રાજ્વી રહેઠાળો અને એક અંગેજના બંગલા સુધી પહોંચ્યા છે. ધ્યાનથી ચિત્રો જોતાં અને તૈયાર કરનાર કલાકારોને એમાં વેણિત પ્રસંગો, લોકજીવન અને વન્યસ્પૃષ્ટિ પ્રત્યે સમભાવ હતો તેની પ્રતીતિ થાય છે. કચ્છ અને રાજ્યસ્થાનનાં અનેક કુટુંબોનો વ્યવસાય પ્રણાલીગત રીતે સુથારીકામ અને કડિયાકામનો રહેતો અને આ કારીગરો સારાં ચિત્રો અને કોતરકામ પણ કરી શકતાં. કચ્છમાં ચિત્રકલા માટે કમાંગરી અને તેના કલાકારો માટે કમાંગર શબ્દો પ્રચ્છિત. રસપ્રદ વાત એ છે કે આ કલાકારો મુસ્લિમ હતા. ચકાશૌંધ શહેરી જીવનથી દૂરનું શાંત આત્મનિષ્ઠ ગ્રામીણ જીવન, જેમાં કલા જીવનનો અંતર્ગત ભાગ. આજના પત્રકારો પૂછતા હોય છે, ‘તમે કેવી રીતે રિવાઈન થાવ છો?’ અભિજા પરંતુ કોણસૂજ અને નિસર્ગદાટ કલાપ્રાતિ ધરાવતા એ સુથાર-કડિયાઓ પાસે જવાબ હતો. વળી આજે ધર્મભેદ ઊભો કર્યા પછી હવે આપણે ધર્મનિરપેક્ષતા શોધવાનો ઉદ્યમ માંડી બેઠા હીએ ત્યારે સામાજિક ઉત્થાન આડે માથું ઊંચકતાં અવરોધક વિરૂપ બળોનો જ્યાલ આવે છે. તે સાથે જ, ડભ્યુ. બી. યેઠિટસના કલ્યાનનું કેન્દ્ર ઘરીભર હાલી જતું લાગે ત્યારે સ્થાનિક પરંપરામાં નિહિત સહિષ્ણુતા-સમજ-સમભાવનાં બીજ હૈયાધારણ આપે છે અને પરંપરાનાં મૂલ્યો પ્રત્યેની પુનર્જીવનિની આશા બંધાય છે.

ઉપર જે અંગેજનો ઉલ્લેખ કર્યો તેનું નામ જેઈમ્સ મેકમર્ટો. તેમણે ઊંચી પાયરીના લશકરી અફસર તરીકે ગુજરાતમાં સેવા આપેલી, તે દરમિયાન તેઓ કચ્છી અને ગુજરાતી ભાષા શીખેલા. તેમણે વિદ્ધાન વિલિયમ જોન્સના માર્ગદર્શન હેઠળ ભારતીય રીતરિવાજે અને સંસ્થાઓનો અભ્યાસ કરેલો. ગુજરાતમાં ચાંચિયા-લૂટારાનો ઉપદ્રવ હતો, તે ઓછો કરવા તેમણે પગલાં લીધેલાં. અંજારના એમના બંગલાની દીવાલ પરનાં બચેલાં ચિત્રો સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યેનો એમનો લગાવ દર્શાવે છે. અંગેજોનાં આ પ્રકારનાં કામ એલોક્ઝાન્ડર ફાર્બેસનીક્રૂલંટ પ્રણાલીનાં કામ છે.

### ૩

વિશેષાંકોના સંપાદક તાકે છે ગુજરાતના સંસ્કાર-વિકાસના સંદર્ભે પરંપરાનું અનુસંધાન આધુનિકતા સાથે કરી આપવાનું. એટલે કલા સંબંધે આજ સુધીના અને આજના કલાકારો અને તેમની રંગીન અને શ્યામ-શ્વેત સ્વરૂપની કૃતિઓ માટે રસ પડે એ રીતે પર્યાપ્ત પ્રમાણમાં પૂછો ફાળવ્યાં છે. કલાકારો સાથે ઔપચારિક અને અનૌપચારિક સંવાદો છે, એમના અંગે ચિત્રો છે, ડાયરીનાં પાનાં છે, લખાણની

હસ્તપ્રતની ફોટો-કોપી છે, સામયિકનાં પૃષ્ઠો છે, કૃતિઓના આસ્વાદ છે, નિબંધો છે, ચોક્કસ વિષયને કેન્દ્રમાં રાખીને વિકસાવેલી છબીકલાનો પણ રંગીન છબીઓ સાથે લેખ છે.

સંકેતની ભાષા ભાવકને પણ સંવેદનશીલ સર્જક બનાવે છે. લાભશંકરની કવિતાના મૂળ શબ્દનો સંકેત વિશેષાંક-ઉના સર્રિયાવિસ્ટિક ભાતના આવરણ પર વધુ સમૃદ્ધ ધ્વનિ ધારણ કરતો લાગે :

ખોડંગાવું ખોડંગાવું સતત  
કોણ

મારા શબ્દના કાંઠે કાંઠે ફરી રહ્યું છે ?  
કોણ મને આ ઉંઘવા નથી દેતું ઉંઘમાયે ?

શીર્ષકને બાજુએ મૂકી દઈને જોતાં વિશેષાંક-રના આવરણ ૧ અને આવરણ ૪ પરની ગાંધીજીની છબીઓમાંથી દરેક પ્રેક્ષકને કદાચ જુદી અર્થ પ્રાપ્ત થાય. વિશે બાંકડા પર સોડ તાણી ચશમાં સાથે જમણે પડાયે માથા નીચે હાથ રાખી કામળો પાથરી સૂતેલા બાપુને જોઈને. સંકેતની ભાષાનું કેવું સામર્થ્ય !

સમકાળીન લેખોની પસંદગીમાં સંપાદકશ્રીએ નજર રાખી છે મૌલિકતા અને પુનરાકાળીન પર. ટેકસ્ટના વાચન સંદર્ભે એમને પ્રિય છે સ્વાયત્તતાનો મહિમા કરનાર અભિગમ અને શબ્દ હર્મન્યુટિક્સ. વ્યક્તિ કે તેનો વિચાર, પાઠ કે તેમાં નિહિત ઝ્યાલ ઉકેલવો એટલે પાડી સમજ સુધી એનું અર્થઘટન, નહીં કે તેનો સારાંશ, પુનઃકથન કે ‘ફેર-રજૂઆત’. આ સંદર્ભે તેમણે જર્મન તત્ત્વચિંતકો હાંસ ગાડામર અને ફીડ્રિક નિત્યોને ગંક્યા છે. ગાડામર, દાખલા તરીકે, ટેકસ્ટને, ‘વચ્ચગાળાની એક નિર્ભિતિ, સમજણરૂપી ઘટનાના બનાવમાં એક તબક્કો’ કહે છે. સંપાદકશ્રી ગીતાના સ્થિતપ્રશ્ન અંગેના કૃષ્ણ-અર્જુનસંવાદને સમકાળીન સંદર્ભે સમજાવે છે. અન્યત્ર એક શિક્ષણવિદ અર્જુનને લક્ષ્યવેધ સમયે દેખાયેલી ‘માત્ર આંખ’માં શિક્ષણક્ષેત્રે સૂક્ષ્મ થઈ રહેલા લક્ષ્યનું મેટાફર જોઈને આજના પ્રતિભાશાળી લક્ષ્યવેધીઓને ‘અયુત કિસ્ટલ’ અને તેની વિદ્યુતગૂંથણી દેખાય છે તેની વાત કરે છે.

આપણા બુજુર્ગ લબ્ધપ્રતિષ્ઠ આધુનિક કવિનો મહાનગરી મુંબઈ સંદર્ભે લખાયેલાં કાલ્યોનો સંગ્રહ ‘પ્રવાલદીપ’. એમાં એમણે એ નગરીને ‘શિલા શત, સિમેન્ટ કાચ વળી કાંકરેટ રચ્યું’, ‘આધુનિક અરાઝ્ય’ કહ્યું. એના અનુસંધાને એક સુશ્રુત સાહિત્યકારને ડેસમંડ મોરિસનું મનુષ્યવર્તનની નિરીક્ષા પર આધારિત નોંધપાત્ર પુસ્તક ‘ધ હુમન ઝૂ’ સાંભરે છે. તેમનો અર્થઘટનાત્મક નાનો પ્રતિભાવ એક વિશેષાંકમાં છે. પ્રકૃતિ વચ્ચેની મુક્ત આદિમ અવસ્થામાંથી ત્વરિત ‘વિકાસ’ પામતા રહી માનવે જાતે

જ પોતાની જાતને વિશાળ પ્રાણીધરમાં પૂરી દીધું છે. મૌરિસ મુક્ત અને બંધક પ્રાણીઓનાં લક્ષણો તારવીને મહાનગરી સંસ્કૃતિના બંધક માનવોના કુઠિત-કંઢગા વર્તનને અરણ્યનાં પ્રાણીઓને બદલે બંધક પ્રાણીઓના વર્તન સાથે સામ્ય ધરાવતું જુએ છે.

વિદેશમાં વસીને ત્યાં પણ સન્માન પ્રાપ્ત કરનાર ગણનાપાત્ર વિચારક-લેખક પાસેથી વિશેષાંકોને પ્રસ્તુત સમય દરમિયાન જે યુગપ્રવર્તક ગુજરાતી થયા તેમના કેટલાક આચાર-વિચારનું અર્થઘટન મળે છે. ગાંધીજીની અંદર તેઓ ‘સોન્સ ઓવ્ઝ થિયેટર’ જુએ છે. દાંડીમાર્ય, ઘોતિયાની પહેરવેશ તરીકે પસંદગી, ‘જીવન એ જ સંદેશ’, ‘થિયેટ્રિકલી મર્યાદ’ એ દાંસાંતો. ગાંધીજીને તેમણે પ્રજાપ્રેમમાંથી જન્મેલો સાહિત્યકાર’ કહ્યા અને પ્રજાને ઊંચે લઈ જાય તે સાહિત્ય એવી એમની માન્યતા યાદ કરી. તેમણે એમ પણ ઉમેર્યું કે ગાંધીજીએ બોલાતા અને લખાતા ગુજરાતી વચ્ચેની રેખા ભૂંસી નાખી.

\* \* \*

તૈમાસિક વિશેષાંકો સંદર્ભ ગ્રંથસાગર બન્યા છે. દૂબકી મારો ને મોતી જરૂરી આહીં આસ્વાદું તેથી વિશેષ ઘણણું છે. ગુજરાતી, ગુજરાતીતા, સ્વની ઓળખ મળે અને આંખમાં ચમક આવે. ત્રણો અંકો મળીને આ જે છે તે પણ નમૂનો છે. એ બહાર પણ કેટલું બધું પડ્યું છે ! સ્મૃતિ સંકોરાય છે. એલેક્ઝાન્ડર ફાર્બર્સે, ગુજરાતી સભાએ, આ તૈમાસિક, અસંખ્ય સંસ્કારશિલ્પીઓએ બીજ નાખ્યાં. તેમાંથી આજે વૃક્ષ, વૃક્ષમાંથી ડાળ, ડાળમાંથી કુપળ-પાર્ણ-પુષ્પો નજરે પડે છે. એ પ્રક્રિયા અવિરત ચાલુ રહે – આજે, સામયનો જુકાવ જુદો છે ત્યારે પણ. તો ‘એ રંગ થકી પણ અવિક સરસ રંગ થશો.’ સંપાદકશ્રી તો મેધાવી સર્જક છે. એમનો અને એમની સજજ-તત્પર-નિષ્ઠાવાન સંશોધન ટુકડીનો પરિકલ્પના, આયોજન, નિમજજન, યુરેકા પળોનો આનંદ કલ્પી શકાય છે. એ આનંદ વહેચવાનો, ગુલાબની પાંખડીઓની જેમ ઉછાળવાનો ઉત્સવ આ વિશેષાંકોમાં વર્તાય છે.

## સાહિત્યરસિકનો સ્વાધ્યાય

### ■ સતીશ વ્યાસ ■

[‘વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો’] : વે. મધુસૂદન કાપડિયા, પ્રકાશક દર્શક ફાઉન્ડેશન, વિકેતા : રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૧૫, પૃ. ડિમાર્ટ ૩૩૨, કિ. ૩. ૩૦૦.૦૦]

અમેરિકાસ્થિત સાહિત્યમર્જણ મધુસૂદન કાપડિયાના સ્વાધ્યાયના પરિપાકરૂપ આ પુસ્તકમાં પચીસ જેટલા વિવેચનલેખો, કેટલાક સાહિત્યિક હેવાલો અને લેખકના પોતાના વિશેના અન્યોના પ્રતિભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસંગોપાત્ર લેખકે પ્રગટ કરેલાં ચર્ચાપત્રોનો પણ અહીં સમાવેશ છે. લેખકે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી છે એમ, ‘આત્મસ્તુતિના આરોપનો ભય વહોરીને પણ એ પુસ્તકને અંતે સાચવ્યાં છે.’

પ્રસ્તુત ગ્રન્થમાંથી પસાર થતાં લેખકની જે મુદ્રા ઊભી થાય છે એ છે આકંઈ સાહિત્યરસિકની. એ રસની સાથે ભળે છે મર્જણતા અને અભ્યાસનિષ્ઠા. એમનાં લખાશોમાં આ ત્રણેયનું રસાયણ સધારેલું જોવા મળે છે.

પુસ્તકનો પ્રથમ લેખ રત્નિલાલ જાનીના ‘કાવ્યાલોચનાના અવલોકન નિમિત્તે ‘કાવ્યમાં અલંકારનું સ્થાન’ શીર્ષક હેઠળ લખાયો છે. અહીં મધુસૂદનભાઈની સંસ્કૃત સાહિત્યમીમાંસાની સજ્જતા સુપેરે પ્રગટ થાય છે. સાથે સાથે ગુજરાતી વિવેચકોના મતોનેય એ ટંકતા જાય છે. આ દરમિયાન એમણે એક નોંધપાત્ર વિધાન કર્યું છે કે, ‘પ્રાચીન આચાર્યોએ કદ્દી ‘ભૌતિક’ બનવાની સ્પૃહા નથી રાખી’ રત્નિલાલ જાનીએ રા. વિ. પાઠકના મતની કરેલી ટીકાની મધુસૂદનભાઈ તર્કપૂર્ણ ટીકા કરે છે. આ ‘ટીકાની ટીકા’ની પરંપરા સંસ્કૃત અલંકારશાસ્ત્રની ધારા પ્રમાણે થઈ છે. અનેક આચાર્યોના મતના નિરૂપણ બાદ મધુસૂદનભાઈ કુન્તક અને અભિનવ પાત્રે ઠરે છે. કુન્તકે beautification અને poetizationના સંદર્ભે જ અલંકાર સંજ્ઞાનો નિર્દેશ કર્યો હોવાની એમની સ્પષ્ટતા પ્રશસ્ય છે, તો અભિનવે ‘વાણીના અનંત વિકલ્પો’ને અલંકાર ગણાયાની વાત પણ નોંધપાત્ર છે. આ અવલોકનને નિમિત્તે સમીક્ષકે આપણા અલંકારશાસ્ત્રની એક લઘુયાત્રા – લઘુ પરકમાં કેવી સરળતાથી કરી લીધી છે એની.

સુખદ પ્રતીતિ અભ્યાસીઓને થયા વિના રહેશે નહીં.

‘કાન્ત’ની શતાબ્દીનિમિતે મુંબઈના એક પરિસંવાદમાં નવવોહિયા અધ્યાપક એવા મધુસૂદનભાઈને વક્તા તરીકે મળેલા નિમંત્રણનું સુફળ છે ‘વત્સલનાં નયાનો’ વિશેનો એમનો આસ્વાદ. આ એમનું પ્રથમ જાહેર વ્યાખ્યાન હતું અને, એમણે ખુદ જગ્યાવ્યા પ્રમાણે, એને શ્રોતાવર્ગની અને મુદ્રિત માધ્યમોની ઘણી પ્રશંસા મળી. ત્યારથી, આજ સુધી, એ એક વાક્યતુર કુશળ વક્તા તરીકે પ્રસ્થાપિત થયા. પ્રસ્તુત લેખમાં લાઘવની પડછે છૃપાયેલા ‘કાન્ત’ના કવિત્વની સૂક્ષ્મ ધારને મધુસૂદનભાઈ એવી જ જીજાવથી પકડે છે અને સાથે સાથે ગુજરાતી સમીક્ષકોએ ‘નિર્મળ સ્નેહસરોવર સારસયુગમ સમાં’માં ખાદેલાં ખતાને પણ જોશપૂર્વક પ્રગટ કરી આપે છે. અલભજ્ઞ ‘કાન્ત’ પ્રત્યેના મોહને કારણે આ કાવ્યની બાનીમાં સંસ્કૃત તત્ત્વમ શબ્દોની સાથે અનુચ્ચિત રીતે બેસી ગયેલા ‘જાભી દિલનાં શયનો’ શબ્દોનું સાનિધ્ય એમની નજર તળેથી ચરકી ગયું છે. એ જ રીતે ‘દોષભર્યા’ને સ્થાને સંજાણાએ ‘દોષદેખાં’નો કરેલો તર્ક એમને વિશેષ યોગ્ય લાગ્યો છે, પણ આ ‘દોષભર્યા’ના સાદશ્યે પણ તપાસવા જેવો છે.

હરીશ મીનાશ્રુણો ‘હાલેશરીનાં પદો’ને લેખકે ઉમળકા સાથે આવકાર્યા છે. આમ છતાં આ કવિના એકાધિક સંગ્રહોનાં એકસાથે થયેલાં પ્રકાશનો અંગે એ ચિંતિત પણ છે. એ કહે છે કે, ‘એક-બે વર્ષમાં ચાર કાવ્યસંગ્રહોનું પ્રકાશન આવકારદાયક એટલું ચિંતાજનક પણ છે.’ હાલેશરીનાં પદોની તુલનાએ એમને ઘણી રચનાઓ પુનરુક્તિયુક્ત તથા કૃત્રિમ લાગી છે. ઐંધા પડેલા પવને ઘાઘરો ઊંઘાડ્યો’ જેવી પ્રક્રિતનો એ યોગ્ય રીતે જ ઉધરો લે છે.

સિતાંશુ યશશ્વર્દની કવિતાની એમણે નિરાંતે, સદષ્યાન્ત સમીક્ષા કરી છે. એમની કવિતામાં આવતા ‘બ્લેક હ્યુમર’ માટે એમણે યોજેલો ‘કાળનો ઉપહાસ’ પર્યાય યથોચિત છે. આ કવિને બિરદાવતાં મધુસૂદનભાઈ લખે છે કે, ‘સર્વકાલીન ગુજરાતી કવિતાનો (એ) સમર્થ કવિ છે ! સિતાંશુભાઈની શિસ્તબદ્ધ કતારમાં કોઈની માતા, કોઈની વનિતા, ભગીની’ને યાદ કરતાં મેઘાણીની ‘કોની માતા, કોની વનિતા, ભગીની હોળે મળતી’ને મૂકી આપે છે પરંતુ સાથે સાથે (ઉત્સાહમાં ?) ગીતાના ‘મામકા: બાંધવા: શ્યાલકા:’ને જોડે છે ત્યારે દુરાકૃષ્ટ બને છે. એ સંબંધાદ્ય નારીવાચક નથી !

‘કુરુક્ષેત્ર’ નવલકથા પોતાને ઘરે જ રહીને પૂરી કરનાર દર્શક માટે પણ એમને સારો એવો સમભાવ છે આથી ક્યારેક એ અત્યુત્સાહમાં એમની પ્રશસ્તિ કરી બેસે છે, જેમ કે એ કહે છે કે, ‘મૃત્યુની તો જાણો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં મહેદ્ધિલ છે.’ દર્શકમાં આવતા પ્રેમના વિવિધ વિવરોને મધુસૂદનભાઈએ યથાર્થ રીતે ખોલી

બતાવ્યા છે અને એને વિસ્તારતાં દર્શકમાં ‘પ્રેમ.’ના ડાઈ અક્ષરની જેમ જ ‘ધર્મ’ના ડાઈ અક્ષરનું આવિપત્ત્ય કેવું છવાયેલું હોય છે એ પ્રતિપાદિત કર્યું છે. જોસેફ મેકવાન માટે ‘જોસેફ મેકવાન ગુજરાતી ગદ્યાની મૌખી ભિનાત છે’ કહ્યા પછી નામ પરથી કિયાપદ બનાવતા એ લેખકના ‘અવગાધ્યા’ અને ‘નિર્વાધ્યા’ જેવા શબ્દોને આવકારી શકતા નથી.’ ગ્રામજીવનના પરિવેશ વિનાની (એમની) કૃતિઓ જાજી મહોરી નથી’ એમ પણ એ યોગ્ય રીતે જ તારવી બતાવે છે. નારાયણ દેસાઈના ‘મારું જવન એ જ મારી વાણી’ને એ ‘ગાંધેડેહ વિહરતું મહાકાવ્ય’ ગણાવે છે છતાં વચ્ચે વચ્ચે ગાંધીજી સાથે પણ અસંમત થતા જેવા મળે છે. ભારતના ભાગલા માટે એ કહે છે કે, ‘ભાગલાની જવાબદારી જીજા પછી ગાંધીજીની હતી એમ મારી દષ્ટ મતિ કહે છે.’ તારણ આપતાં ‘કરુણા’નો વાંક કાઢી, ‘સત્ય એટલું તૂટ્યું’ એમ જણાવે છે. નારાયણભાઈના ગદ્યમાં આવતા ‘રૂપાંતરણ’ શબ્દમાં એમને ‘જા’ વધારાનો લાગ્યો છે અને ‘કરિશમા’ને સ્થાને થયેલો ‘કરિશમો’નો પ્રયોગ અયોગ્ય લાગ્યો છે.

મહેન્દ્ર મેઘાણીની ‘અરધી સર્દીની વાચનયાત્રા’ને બિરદાવતાં લેખક નોંધે છે કે, ‘આપણા એકેએક સામયિક અને વર્તમાનપત્રમાં આનાં પ્રશંસાથી ભરપૂર અવલોકનો પ્રગટ થયાં. મહેન્દ્ર મેઘાણી આ ઉત્કટ પ્રશંસાના પૂરેપૂરા અવિકારી છે પણ કોઈ એક પણ અવલોકનકારે કાચ્યોની પસંદગીની રીકા નથી કરી.’ મધુસૂદનભાઈને અહીં પસંદ થયેલાં, ઉમાશંકર જેવાનાં પણ, અનેક અકાચ્યો સામે ઉચિત રીતે જ નારાજગી છે. ખોટાં છાપાયેલાં સંસ્કૃત અવતરણો પણ એમને કઠે છે. એ કહે પણ છે કે, ‘આપણી સંસ્કૃતની જીજકારીને તો લૂણો લાગ્યો છે.’

અહીં આ પુસ્તકના બધા લેખો વિશે વાત થઈ શકે એમ નથી, આમ છતાં ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન જેવો આસ્વાદલેખ ગમી જાય એવો છે. ગુજરાવંત શાહના ‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ના ગુણપક્ષની નિરાંતે વાત કર્યા પછી એટલી જ નિરાંતે એના દોષપક્ષની પણ લેખક ચર્ચા કરે છે ત્યારે એમના અભ્યાસનિષ્ઠ તાત્કષ્ણની સુખદ પ્રતીતિ થાય છે. પ્રશસ્તિ કરતાં એ નોંધે છે કે, ‘આવા ઉત્તમ ગ્રંથના આકલનથી આપણે તરપાઈ ગયા.’ એ પછી લેખક ગુજરાવંત શાહને ચેતવતાં કહે છે કે, ‘તમે બખ્તર ધારણ કરી લેજો. મારે કઠીરતાથી કેંક કહેવાનું છે.’ ગ્રંથમાં રહેલી અપાર મર્યાદાઓ પ્રતિ પણ લેખક ધ્યાન દોરે છે. શૈલીદાસ્યને તો એ અનેક ઉદાહરણો દ્વારા ખુલ્ખું પાડે છે. સીતા માટે થયેલા ‘વણબોટાયેલી’ પ્રયોગનો ઉધડો લેતાં લેખક લખે છે કે, ‘અરેરે, આ ‘વણબોટાયેલી’ જેવો શબ્દપ્રયોગ તમારાથી થઈ જ કેવી રીતે શકે? તમને આપેલા Womens liberનાં બધા જ કોમ્પ્યુટિમેન્ટ્સ પાણી લઈ લેવાનું મન થાય છે. સ્ત્રીઓ માટે આવો હલકો વિચાર કેળવી જ કેવી રીતે શકાય.’ ગુજરાવંત

શાહની કાવ્યવિભાવના અંગે પણ મધુસૂદન કાપડિયાને અનેક પ્રશ્નો થયા છે. સંસ્કૃત શ્લોકોના ગુણવંત શાહે કરેલા અનુવાદ સામે પણ મધુસૂદન કાપડિયા પ્રશ્નો ઉઠાવી લગભગ ઊર્ધ્વબાહુ બની પડકાર ફેક્તા હોય એવી મુદ્રા ધારણા કરે છે.

હા, ઘરદીવડાઓની વાત પણ કરે છે. ભરત શાહ, નટવર ગાંધી, ચંદેશ ઠાકોર આદ્ય વિશેનાં લખાણોમાં એ જોઈ શકાય છે. અહીં ઉમળકો વિશેષ અને સમીક્ષા ઓછી જોવા મળશે. સ્થાનિક કાર્યક્રમોની વિગતોથી એક પ્રકારનું દસ્તાવેજુકરણ સાંપ્રે છે. પોતાના વિશે પ્રગટ થયેલાં લખાણોમાં આત્મરતિ કરતાં સ્વપરીક્ષણ જ વિશેષ દેખાય છે. અહીં પણ દસ્તાવેજુકરણનો આશાય જ વધારે છે. લેખકની આકંઠ સાહિત્યપ્રીતિના પરિપાક સમું આ પુસ્તક વાચકોને અને અભ્યાસીઓને નિરાશ કરે એવું નથી.

લેખક ઉમાશંકર, દર્શકથી માંડીને ગુણવંત શાહ સુધીના લેખકોમાં દોષો જોવા છે. જોવાયે જોઈએ. એ વખતે એ ટીક ટીક નિર્મંબ બની જાય છે પણ એમનો સૂર થોડો આકમક બનતો જોવા મળે છે. એમની પાસે ઝીંગી અવલોકન દસ્તિ છે પણ એવે (લેખકસહજ) અનવધાનનો ભોગ બની જતા જોવા મળે છે. એમનાં બે વાક્યોમાં રહેલા આવા અનવધાન પ્રત્યે ધ્યાન દોરવાની ‘ધૃષ્ટા’ કરું છું :

1. ‘શરૂઆત જ શું લાજવાબ હતી ?’ (પ્રસ્તાવના)
  2. ‘આનાથી વધારે આપણી પ્રશંસા શું હોઈ શકે ?’ (પ્રસ્તાવના)
- આ નિર્સર્જ આ સૃષ્ટિમાં કશું દોષરહિત રાખ્યું જ કયાં છે મધુસૂદનભાઈ ? આથી જ મમ્મટેય ‘કવચિત્ દોષયુક્ત’નો મહિમા કર્યો છે ને ?

## આવરણાચિત્ર સંદર્ભનોંધ

### ■ પીયુષ ઠક્કર ■

ચિત્રકાર : અર્પણા કૌર (જ. ૧૯૮૪, દિલ્હી)

આવરણાચિત્રનું શીર્ષક : Embroiderer

માધ્યમ : કેન્વાસ પર તૈલચિત્ર

વર્ષ : ૧૯૮૫/૮૬

કળાકારો અવારનવાર લોક-આદિવાસી કળા પાસે ગયાં છે. પાછ્વો પિકાસો આફિકાના આદિવાસી મહોરાં અને કાષ્ટશિલ્પોથી પ્રેરણા મેળવે છે તો પોલ ગોળાં તાહિતી જાય છે. આપણી ત્યાં જામની રાય, જે સુલતાન અલી, મીરા મુહર્ઝ, કહુ શાહ, માધવી પારેખ, નવજોત અને અર્પણા કૌર જેવાં અનેક બીજાં પણ કળાકારો છે કે જેઓ લોક-આદિવાસી કળાથી પ્રભાવિત થયાં હોય. ‘પરબ’ની આવરણાશ્રેષ્ઠમાં આ અંકેથી લોક-આદિવાસી કળા, પ્રશિષ્ટ કળા અને સમકાલીન કળા જેવી ઓળખોની તપાસ કરીશું. ગતાંકના અનુસંધાનમાં આ અંકે જોઈએ અર્પણા કૌરનું એક બીજું ચિત્ર.

બિહારના ભિથિલા પ્રાંતની લોકચિત્રકળાનાં બે રૂપો છે. એક તે બ્રાહ્મણો અને કાયસ્થોની ચિત્રશૈલી, જે મધુબનીના નામે ખ્યાત છે. બીજી તે પાશવાન જ્ઞાતિની ચિત્રશૈલી છે, મધુબની ગોદના. મૂળે ગોદના એટલે શરીર પરનાં છૂંદણાં માટે એ પ્રદેશમાં બોલાતું નામ. આ પાશવાન જ્ઞાતિને દેવદેવીઓનાં ચિત્ર કરવા પર પાબંદી. એટલે એમનાં ચિત્રોમાં હોય પશુ, પંખી, નઢી ને દુંગરા. અર્પણા કૌર આ મધુબની ગોદના ચિત્રકળાની પૃષ્ઠભૂમિમાં સાલ ૧૯૮૫-૮૬ની આસપાસ એક ચિત્રશૈલી રેચે છે. જેમાં ગોદનાં ચિત્રો પર અર્પણા પોતાની ચિત્રબાનીના અંશો આવેલે છે.

એક રીતે તો અર્પણા કૌર અહીં ગોદના ચિત્રકળાવિશ્વ સાથે સંવાદ યોજે છે. એક બાજુ અહીં લોકની કલ્યાણ અને જગતને નીરખવાની પોતીકી દસ્તિનું લોકમાન્ય ચિત્રરૂપ છે. તો બીજી તરફ એ ચિત્રવિશ્વને વિચલિત કરતો અથવા તો એ દ્વારા આપણા (બેઉ લોક અને નાગરી) સાંપ્રતને ઉજાગર કરતો ચિત્રકારનો ચિત્ર રૂપે સર્જનાત્મક હસ્તક્ષેપ છે.

ગોદના ચિત્રકારનું એક ચિત્ર છે કે જેમાં એક ઝડપ છે અને પંખીઓ છે. અહીં એ ઝડપને ટેકવેલી એક બંદૂક અર્પણાએ આવેલી ને ચિત્રને શીર્ષક આપ્યું છે, “એ

જ એ લાકું”. અન્ય ચિત્રમાં પશુઓનું પ્રકૃતિ સાથે સુમેળભર્યુ ચકાર આવેખન છે ને એ ઉપર જંણુભતો ટ્રાફિક સિનલ ચિત્રાયો છે જેની લાવબતી જળકે છે. ચિત્રકારે શીર્ષક આપ્યું છે, “સ્ટોપ”. એમ ચિત્રકાર મૂળ ચિત્રમાં અછાતો એક ચિત્રાંશ આવેખને દુંદુ રચી આપે છે.

આવરણ પર વાદળ સરીખાં કપડાં પર લીલી વર્ણધાયામાં ભરતકામ કરતી સ્ત્રીનું ચિત્ર છે. એ પહુંચે ગોદના ચિત્રની ચકારાર યોજના છે. એને પડ્ઘાવતી ચકારે મુકાયેલી ભૂરી કાતરો છે. સ્ત્રીની એક ઊંચકાયેલ હથેળીમાં સોય છે તો બીજાની ચપટીમાં કપડું છે. ચિત્રમય સૃષ્ટિને આવરતી સ્ત્રી જાણો કે અહીં આદિમ પ્રકૃતિનું પ્રતીક બને છે તો પ્રકૃતિને જાળવતું એક બળ પણ છે. એ સાથે આપણાં લોકજીવનને રમણીય – રસમય બનાવતા કલાકસબનો ચિત્રકારે આમાં મહિમા પણ કર્યો જણાય છે. લોકકળાને પોતાના સ્વાર્થે મરડચા વગર એનો ગરિમા સાચવીને ચિત્રકારે રચેલી સ્મરણીય માંડળી આમાં છે.

## સાભારસ્વીકાર

### હાસ્ય

(૧૮૬) હાસ્ય કલરવ : પ્રધુમન આર્યા, ૨૦૧૫, હર્ષ પ્રકાશન, અમદાવાદ,  
પૃ. ૮૪૧૨૮, રૂ. ૧૦૦

### દેખો

(૧૮૭) રવીન્દ્રનાથ ટાગોર : ભોળાભાઈ પટેલ, સંકલન : તોરલ પટેલ, ૨૦૧૫,  
રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૪૪૧, રૂ. ૪૦૦ (૧૮૮) ભારતીય નવલકથા  
પરંપરા અને ગ્રામ કેન્દ્રી નવલકથા : ભોળાભાઈ પટેલ સંકલન : વીરેન્દ્ર નારાયણ સિંહ,  
૨૦૧૫, રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૨૬૦, રૂ. ૨૦૦

## આપણી વાત



### સંકલન : પ્રફુલ્લ રાવલ

તા. ૫-૧-૨૦૧૭ના રોજ પાકિઝી અંતર્ગત શ્રી મનહર ઓજાએ 'કંકુડી' વાર્તાનું પઠન કર્યું હતું. કુવારી કંકુડીએ પરિણાત મંગાનું ઘર માંડયું તે ઘટના ગામના લોકો માટે ચર્ચાનો વિષય બની ગઈ હતી. ખાસ તો જે યુવાનો તેની સાથે પરણવાનાં સપનાં જોતાં હતાં તેના માટે કંકુડીનું આ પગલું સમજજ્ઞ બધારનું હતું. વાર્તામાં પ્રયોજાયેલી ઉત્તર ગુજરાતની બોલીના પ્રયોગને ભાવકોએ પસંદ કર્યો હતો. વાર્તાનું તે જમા પાસું હતું. વાર્તાના અંતમાં થતો ખુલાસો વાર્તાની નબળી કરી હતી. તે સંદર્ભે વાર્તારસિકોએ સૂચનો કર્યા હતાં.

ગુજરાતી સાહિત્ય પરિષદ-સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરના 'ગ્રંથગોણિ' અંતર્ગત તા. ૧૭-૧-૨૦૧૭ના રોજ સાંજે ૬.૦૦ કલાકે શ્રી રૂપાલી બર્કએ શ્રી છિમાંશી શેલતની આત્મકથા 'મુક્તિવૃત્તાંત' વિશે વ્યાખ્યાન આપ્યું હતું. પરિષદના મહામંત્રી શ્રી પ્રફુલ્લ રાવલે પ્રારંભે સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. શ્રી પારુલ કંદર્પ દેસાઈએ ક. લા. સ્વાધ્યાયમંદિરની પ્રવૃત્તિઓ અને ગ્રંથગોણિના કાર્યક્રમના પરિચયની સાથે વક્તાશ્રી રૂપાલી બર્કનો પરિચય કરાવ્યો હતો. શ્રી રૂપાલી બર્કએ 'મુક્તિવૃત્તાંત' વિશેના વક્તવ્યમાં કદ્યું હતું કે આત્મકથા-સાહિત્ય એ સર્જનાત્મક સાહિત્ય કરતાં થોડું લિતરતી કક્ષાનું સાહિત્ય છે. તેમણે 'મુક્તિવૃત્તાંત'ને આત્મકથા તરીકે નહિ પણ આત્મકથન કહીને ઓળખાવી હતી. અંતરિક અને બાધકથનના સંવાદની વાત પણ કરી હતી. આમ તેમણે આત્મકથાના સ્વરૂપની ચર્ચા કરતાં કદ્યું હતું કે, 'મુક્તિવૃત્તાંત' આત્મકથા કરતાં સંસ્મરણકથા વધુ છે.' આત્મકથામાં સંસ્મરણો હોય, પરંતુ તેમાં ઐતિહાસિક પરિપ્રેક્ષયવાળું અને સંશોધનાત્મક લખાણ હોય જ્યારે સંસ્મરણકથામાં અનૌપચારિક છીતાં અંગત અનુભવો હોય. 'મુક્તિવૃત્તાંત' કબુલાત જેટલું ગંભીર પણ નથી અને કાલ્યનિક સાહિત્ય જેટલું ઊંચું પણ નથી. તેથી એ બંને સંભોની વચ્ચે આવે એવી એક કૃતિ છે. કૃતિના લેખનમાં પ્રવાહિતા નથી, તેમાં અલપ-ઝલપ ઘટનાઓ ચાલ્યા કરે છે. જે તમને વિચારોની પ્રવાહિતા વિશે ખ્યાલ આપે છે. આ પ્રસંગે ઉપરિથિત સાહિત્યના ભાવકોમાં સર્વશ્રી રઘુવીર ચૌધરી, રમેશ ર. દવે, કિરીટ દુધાત, લાલુભા, પ્રકાશ ન. શાહ, હર્ષદ નિવેદી, પારુલ કંદર્પ દેસાઈ વગેરેએ કૃતિની વિગતે ચર્ચા કરી હતી.

તા. ૧૬-૧૨-૨૦૧૬ના દિને વડોદરાની સાહિત્યિક સંસ્થા ‘અક્ષરા’ અને ‘ગુરુકુળ વિદ્યાલય’ના સંયુક્ત ઉપકમે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવતા શિક્ષકો માટે, ધોરણ ૮, ૧૦, ૧૧ અને ૧૨ના પાઠ્યપુસ્તકોમાં સામેલ નિબંધોને કેન્દ્રમાં રચી ‘નિબંધનું સ્વરૂપ અને પ્રકાર’ વિષય પર કાર્યશિબિર યોજવામાં આવ્યો હતો. જેમાં શિરીષ પંચાલે બીજરૂપ વક્તવ્ય આપતાં વિશ્વસાહિત્યમાં નિબંધસાહિત્યના આરંભકાળથી શરૂ કરી આજ સુધીમાં ગુજરાતી ભાષામાં ખેડાતા રહેલા નિબંધના પ્રકારો અને મુખ્ય સર્જકોના યોગદાનની વાત કરતાં પાઠ્યપુસ્તકોમાં સમાવિષ્ટ નિબંધોની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ દર્શાવી હતી.

ગુજરાત સાહિત્યસભા તરફથી ૨૦૧૫ના વર્ષ માટેનો રણજિતરામ સુવર્ણચંદ્રક શ્રી કુમારપાળ દેસાઈને અર્પણ કરવાનો સમારંભ તા. ૭-૧-૨૦૧૭ના રોજ સાંજે ૫.૦૦ કલાકે ગુજરાત વિશ્વકોશમાં યોજાયો હતો. જેમાં શ્રી રઘુવીર ચૌધરીના હસ્તે શ્રી કુમારપાળ દેસાઈને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો.

બાળસાહિત્ય તથા બાળસાહિત્યકારોનાં હિત, વિકાસ અને ગૌરવ માટે ૧૯૮૪થી સક્રિય બાળસાહિત્ય અકાદમીનું સત્તરમું અધિવેશન તા. ૮-૧-૨૦૧૭ને દિવસે ગુજરાત વિદ્યાપીઠ ખાતે, ભાવનગરની વિષ્યાત શિક્ષણસંસ્થા શિશુવિહારના સંચાલક ડૉ. નાનક ભંને અધ્યક્ષસ્થાને મળ્યું હતું. જેમાં છેક વલસાડથી માંડીને સોમનાથ સર્જકો ઉપસ્થિત રહ્યા હતા.

ગિરાગુર્જરી પારિતોષિક સ્પર્ધા ૨૦૧૬નાં પરિણામો નીચે પ્રમાણે છે.

**નવલકથા :** પ્રથમ પારિતોષિક, ‘અશ્રુત શ્રુતિ’ પુષ્પ મહેતા-પારેખ; દ્વિતીય પારિતોષિક ‘સમય પરચો સમયાતીત’.

**કાવ્ય :** પ્રથમ પારિતોષિક ‘અનકોટ’ ભાસ્કર ભંડ, ‘હવા પર ઉહ્યન’ હેમંત કારિયા દ્વિતીય પારિતોષિક ‘કાવ્યાલ્ય’ અલ્યા વસા, ‘પુષ્પદ્વીપ’ આરતી સૈયા..

**નિબંધ :** પ્રથમ પારિતોષિક ‘માધુર્યસૃષ્ટિ’ પૂર્ણિમા શેઠ, ‘નિબંધનિર્જર’ ડૉ. આશા મહિયાર; દ્વિતીય પારિતોષિક ‘મારી મંઝિલ’ જ્યોતિ ઓઝા, ‘પારિજાત’ આરતી સૈયા..

**નવવિકા :** પ્રથમ પારિતોષિક ‘પળનો પડછાયો’ નીલા સંઘવી, ‘મારું આકાશ કર્યાં ?’ ડૉ. કલ્યાન દવે; દ્વિતીય પારિતોષિક ‘ઘટસ્ફોટ’ કિરણ કાણકિયા, ‘મનતરંગ’ સરલા શાહી.

**સંસ્કૃત-વિવેચન :** પ્રથમ પારિતોષિક ‘લગ્નવિચ્છેદ’ ડૉ. હેમલતા જોશી; દ્વિતીય પારિતોષિક ‘પુષ્ટિમાર્ગ-સંત’ કવિઓ’ નેહા આર્યા, ‘જીવન એક કવિતા’ મૃહુલા દેસાઈ.

બધા જ પારિતોષિકવિજેતાઓને અભિનંદન.

## આ અંકના લેખકો

- અરવિંદ ભટ્ટ : તૃ, જ્યબી કોમ્પ્લેક્સ, ૪/૮, રોડ્યલપાર્ક, યુનિ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫
- ઇન્દ્ર જોશી : 'વિશ્રામ', ૪/એ-૧, આત્મરાજ સોસાયરી, મહેસાણાનગર પાછળ, નિઝામપુરા, વડોદરા-૩૬૦૦૨૪
- ઉજમશી પરમાર : ૭૫, સમરથનગર, હંસોલ, અમદાવાદ-૩૮૨૪૭૫
- એસ. ડી. હેસાઈ : બી/૫, સુચિત્તા એપાર્ટમેન્ટ, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮
- કિશોર જીકાદરા : ૧૪૨, સર્વોદ્યમનગર, સેક્ટર-૩૦, ગાંધીનગર-૩૮૨૦૩૦
- ગીરીશ ભટ્ટ : પ્રશાંતિ નિલયમ, માધવનગર, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧
- પીયુષ ઠક્કર : બળવંત પારેખ સેન્ટર, સી/૩૦૨, શિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન પાછળ, ફરામજી રોડ, વડોદરા-૩૬૦૦૦૭
- પુષ્કરરાય જોશી : ૪૭૮, ઉપવન પાર્ક, કણ્ણકોટ પાટ્ટિયા, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫
- પ્રકુલ્લ રાવલ : તૃ, રાજમહેલ ફ્લેટ, આઈઓસી કોલોની રોડ, વીરમગામ-૩૮૨૧૫૦
- ભગીરથ બ્રહ્મભટ્ટ : ગ્રેસ બંગલો, પ્લોટ નં. ૮૬૪, એલિકોન ગાર્ડન પાસે, મહાદેવ વિસ્તાર, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦
- ભરત વિઝુઢા : 'રામકૃપા', ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા, જી. અમરેલી-૩૬૪૧૧૫
- મનસુખ સલ્લા : સી/૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટ્સ, દેવાશિષ સ્કૂલ સામે, જળસ બંગલા વિસ્તાર, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫
- મોહનલાલ પટેલ : ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫
- રજનીકુમાર પંડ્યા : બી/૩, / જીએફ-૧૧, આકંક્ષા ફ્લેટ, જ્યમાલા ચોક, મણિનગર-ઇસનપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૫૦
- લખિત ત્રિવેદી : શિવકૃપા, ૧, વૈશાલીનગર, રૈયારોડ, રાજકોટ-૩૬૦૦૦૭
- સતીશ વ્યાસ : આર/૭, અભિલાષ રો-નાઉસ, રાહુલ ટાવર ચાર રસ્તા, આનંદનગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ-૫૧
- હર્ષ બ્રહ્મભટ્ટ : ૭૪/૮, જગાભાઈ પાર્ક, રામભાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮

## રંગદ્વાર પ્રકાશન

G-15, યુનિવર્સિટી પ્લાઝો, દાદાસાહેબનાં પગલાં, નવરંગપુરા, અમદાવાદ-380009  
ફોન નંબર : 079-27913344, વેબસાઈટ : <http://www.rangdwar.com>

### વાર્તાસંગ્રહો

રજાની વર્ચ્યે	વીનેશ અંતાડી	૧૦૦
વિસામા વિનાની વાટ	સં. રમેશ ર. દવે	૧૮૦
રસવૈભવ	નીતિન ત્રિવેદી	૨૦૦
દસ પાશ્ચાત્ય નવલિકાઓ	સં. રેમંડ પરમાર	૧૨૦
દશ્ય ફરી ભજવાયું	મુનિકુમાર પંડ્યા	૧૦૦
દૂરથી સાથે	રઘુવીર ચૌધરી	૮૦
ખંડિત સુવર્ણપાત્રો (વિદેશી વાર્તા)	શિન્મય જાની	૧૨૦
પુનર્જ્ઞન અને બીજી વાર્તાઓ	શિન્મય જાની	૧૦૦
ચંદન અને સાધુ	ભાનુપ્રસાદ ત્રિવેદી	૧૦૦
દીવાલની એક ટેંટ	નરેન્દ્ર પરમાર	૮૦
જિંદગી જુગાર છે ?	રઘુવીર ચૌધરી	૭૦
પ્રાણપ્રતિજ્ઞા	રઘુવીર ચૌધરી	૭૦
છેલ્લું ફરમાન	ઇવા તેવ	૧૩૦
નોખા સવાલ નારીના	ઇન્દ્ર રાવ	૬૦
શરૂઆતનો વરસાદ	મુનિકુમાર પંડ્યા	૭૦
મંદિરની પછીતે	રઘુવીર ચૌધરી	૧૧૦
પુનર્શ	બંકુલ દવે	૧૦૦
કાળરાક્ષસ	ઇવા તેવ	૮૬
ખોવાયેલી ઓળખ	ભાવના મહેતા	૬૦

### ઈ-બુક્સ

અમૃતા, લાગણી, ઉપરવાસ-અંતરવાસ-સહવાસ-સોમતીર્થ, પૂર્વરાગ-પરસ્પર,  
પ્રેમઅંશ, તીર્થભૂમિ ગુજરાત, ગોકુળ-મથુરા-દ્વારકા, સહરાની ભવ્યતા  
તથા નિરનાર

<http://www.e-shabda.com/shop-ebooks-online>

## નોખું-અનોખું અભ્યાસસભર વિવેચનસાહિત્ય

સાત અંગ, આઈ નંગ અને....	રમણ સોની	140
હેઠું શબ્દું તો....	યોસેફ મેકવાન	120
Hamartin in Macbeth	Dr. Saloni Nandan	125
ભર્તુહરિનાં બે શતકો	સ્વામી સાચ્યદાનંદ	170
અધિત 37	સંપા. જે. એમ. ચંદ્રવાડિયા	125
અધીત આડવીસ	સહસંપાદન	120
બાળવાંચન	નિહારીકા ટી. ઉદાશી	125
નરસ્થિષ ચિત્રવિમર્શ	દર્શના ધોળકિયા	300
સહદય ધર્મ (અન્તરાય રાવળાલિમિતલેખો)	સંપા. દર્શના ધોળકિયા	260
સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ	સંપા. શિવપ્રસાદ એમ. દવે	400
દર્શક અને બીજા વિશે	ધીરેન્દ્ર મહેતા	180
બાળસાહિત્યમંથન	યશવંત મહેતા	100
બાળસાહિત્યના પરિધમાં	યોસેફ મેકવાન	100
ગુજરાતી બાળવાર્તા	ઇશ્વર પરમાર	80
શબ્દભેદ	દવપત ચૌહાણ	125
વિવેચનની વાટે	અરુણિકા મનોજ દસ્તુ	160
રંગવિમર્શ	ભરત દવે	250
કૃતિપર્વ	નીતિન રાડોડ	100
સંત તુલસીદાસજીની કવિતાવલીનો રસસ્વાદ	અર્ચના ભણ, પટેલ	70
અર્વાચીન ગુજ. સાહિત્યની વિકાસરેખા (સાક્ષરયુગ)	ડૉ. ધીરુભાઈ ઠાકર	200
અર્વાચીન ગુજ. સાહિત્યની વિકાસરેખા (ગંધીયુગ અને અનુગંધીયુગ)	ડૉ. ધીરુભાઈ ઠાકર	340
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભાગ-5		
આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો	ધીરુભાઈ ઠાકર	320
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા :1 (મધ્યકાળ)	ધીરુભાઈ ઠાકર	90
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા :2 (સુધારકયુગ)	ધીરુભાઈ ઠાકર	90
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જૈન પરંપરા	કીર્તિદા શાહ	125
ભર્તુહરિનાં બે શતકો	સ્વામી સાચ્યદાનંદ	170



## ગુજર ગંધરવન કાર્યાલય

રતનપોળનાકા સામે, ગંધીમાર્ગ, અમદાવાદ-380001

■ ફોન : 22144663, 22149660 ફેક્સ : 22144663

■ ઈ-મેલ : goajar@yahoo.com

**ગુજર સાહિત્ય પ્રકાશન :** 102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, ગાર્ડન્સ એન્ડ સિટીસેન્ટર  
પાસે, ચીમા હોલની સામે, 100 ફૂટ રોડ, પ્રદુલાણગર, અમદાવાદ-15.

ફોન : 26934340, મો. 9825268759 ઈમેલ : gurjarprakashan@gmail.com





સાહિત્યકળાની નજીક રહીને થતાં સર્જનોની  
માય ડિયર જ્યુની પોતાની પ્રકાશન-વ્યવસ્થા

### લટૂર પ્રકાશન

‘અવનિલોક’, ૩ શાંતિનગર સોસાયટી, ૨૨૭૩ હિલ ગ્રાઇન્ડ ભાવનગર-૧

મો.: ૮૬૨૪૬૮૫૬૪૬

### નવાં - અવનવાં પ્રકાશનો

નવા વાર્તાસંગ્રહો		ઉત્કૃષ્ટ કાવ્યસંગ્રહો	
૧. પોલિટેકનિક (મહેન્દ્રસિંહ પરમાર)	રૂ. ૧૭૦	ચંદ્ર શુક્રલ : ૧. કોમલ રિષભ	રૂ. ૧૫૦
૨. મારગ વાતાનો (હરીશ મહુવાકર)	રૂ. ૧૮૦	૨. અંતર ગાંધાર ભરત ભણ :	રૂ. ૧૫૦
૩. ફરીથી (લઘુકથા) (નસીમ-હરીશ મહુવાકર)	રૂ. ૧૫૦ રૂ. ૨૦૦	૩. મીણના માર્ગ પર ૪. એક પંડિતની પોથી	રૂ. ૧૫૦ રૂ. ૧૨૦
૪. શીઆવિતી શો (નવનીત જાની)	રૂ. ૨૦૦	સૌલિડ મહેતા : ૫. શાખાધાર	
૫. પડથારો (પોરધન બેંસાણીયા)	રૂ. ૧૮૦	૬. સંભૂતિ મનોહર ત્રિવેદી :	રૂ. ૧૧૦
૬. નીચે નહીં ધરતી ઉપર નહીં આકાશ (બહુદુરભાઈ જ. વાંક)	રૂ. ૧૫૦	૭. ઘર છે સામે તીર ભરત વિજુદા :	રૂ. ૧૭૦
૭. ગોત્ર	રૂ. ૧૮૦	૮. તો અને તો જ	રૂ. ૧૫૦
૮. સુંધાંધ (ગુરીશ ભણ)	રૂ. ૧૫૦	૯. રેશે આચાર્ય : ૯. પાથરણવાળો	રૂ. ૧૧૦
૯. થુંબારી (સંજ્ય ચૌહાણ)	રૂ. ૧૫૦	૧૦. ઘર બદલવાનું કારણ સુધીર પેટેલ :	રૂ. ૧૨૫
૧૦. નિરુત્તર (બકુલ દઢે)	રૂ. ૧૫૦	૧૧. જળ પર લકીર	રૂ. ૧૫૦
૧૧. કાવ્યસંગ્રહોની ડિ. ૧૫૧૫/- થાય છે. આખો સેટ ખરીદનારને રૂ. ૧૦૦૦માં ધેર બેઠાં પહોંચાડીશું.			
રખનો કાગળ - મહેન્દ્રસિંહ પરમાર (નિબંધનું લખિત રૂપ) - રૂ. ૧૭૦			
માય ડિયર જ્યુની વાર્તાકળા વિશે (૫૩ અભ્યાસલેખો) - રૂ. ૪૫૦			

તમારા બુકસેલર પાસેથી મળશે. સીધો સંપર્ક કરો : વિશેષ વળતરથી ધેર બેઠાં પહોંચાડીશું.

માય ડિયર જ્યુ : ૮૮૮૮૮૬૮૬૨૬ - ૮૪૨૬૧૬૦૨૦૮

અવનીન્દ્ર : ૮૬૨૪૬૮૫૬૪૬ - ૯૩૭૭૧૧૫૬૫૬

Email : latoorprakashan@yahoo.com

₹  
૨૨૦

## દૂકી વાર્તા



પ્રસ્તુત પુસ્તકમાં દૂકી વાર્તા આસ્વાદ, દૂકી વાર્તા સમીક્ષા, દૂકી વાર્તા સ્વરૂપ, દૂકી વાર્તા સંશોધન, દૂકી વાર્તા સંપાદન, બાળવાર્તા, લઘુકથા, ઈત્યાદિનો સમાવેશ કરેલ છે. ૧૯૨૪થી ૨૦૧૫ સુધીના સમયગાળાને આવરી હેતું ૧૬૮ પાનાનું આ પુસ્તક ૨૧૨૯ અધિકરણો, ૩૫૦ વિવેચકો, ૫૨૦ વિવેચનગ્રંથો, ૮૧૭ કૃતિઓ અને ૩૫૩ કૃતિના સર્જકોનો રસથાળ આપણને પીરસે છે.

પ્રસ્તુત પુસ્તકમાં નવલકથા આસ્વાદ, નવલકથા સમીક્ષા, નવલકથા સ્વરૂપ, નવલકથા સંશોધન, લઘુનવલ આસ્વાદ, લઘુનવલ સમીક્ષા, લઘુનવલ સ્વરૂપ અને લઘુનવલ સંશોધનનો સમાવેશ કરેલ છે. ૧૯૩૪-૨૦૧૫ સુધીના સમયગાળાને આવરી હેતું ૨૮૦ પાનાનું આ પુસ્તક ૩૦૧૫ અધિકરણો, ૪૫૦ વિવેચકો, ૫૫૯ વિવેચનગ્રંથો, ૧૦૪૯ કૃતિઓ અને ૫૨૩ કૃતિના સર્જકોની વિગત આપણી સમશરૂ કરે છે.

₹  
૩૩૦

## નવલકથા



ગુજરાતી સાહિત્યના અધ્યાપકો, ગ્રંથપાલ, સંશોધકો, વગેરે માટે અત્યંત ઉપયોગી સંદર્ભગ્રંથની ગરજ સારતાં પુસ્તકો

પ્રામિકથાન : ગ્રંથવિહાર

ગુજરાતી સાહિત્ય પરિપદ, ટાઈમ્સ પાછળ, નડી કિનારે, આશ્રમ માર્ગ,  
અમદાવાદ-૩૮૦૦૦૮ • ફોન : ૨૬૪૮ ૭૮૪૬

## વાર્તા વાંચવાનું શાસ્ત્ર

લેખક : અનુપમ ભણ

(પાંકું પૂંકું, પૃ. ૨૮૮, ડિ. રૂ. ૧૯૦)

તમે સાહિત્યના વિદ્યાર્થી છો અને વાર્તા કેવી રીતે વંચાય તેની વ્યવસ્થિત તાલીમ મેળવવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.

તમે કથાસાહિત્યના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે અત્યંત મહત્વની વિભાવનાઓ (જેવી કે વસ્તુસંકળના, વિષયવસ્તુ, વાર્તાનો અન્તર્નિહિત લેખક, વાર્તાનો અન્તર્નિહિત વાચક)ની વિશાદ અને વિસ્તૃત સમજણ મેળવવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.

કથાસાહિત્યની કૃતિ વિશે અભ્યાસલેખ લખવા માટે આવશ્યક એવી નિયમનિષ્ઠ, શાસ્ત્રીય પદ્ધતિ કેવી હોય તે જાણવા-સમજવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.

તમે સાહિત્યના અધ્યાપક છો અને કેવા વિવિધ દાખિલાઓ વાર્તા / નવલકથાની વિદ્યાર્થીઓ સમક્ષ ચર્ચા કરી શકાય તે જાણવા - સમજવા ચાહો છો ?

- તો આ પુસ્તક તમારા માટે છે.

પ્રાપ્તિસ્થાન

ગ્રંથવિહાર

ગુજરાતી સાહિત્ય પરિષદ, 'યાઈમ્સ' પાછળ, નદી કિનારે,

આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯

ફોન નં. : ૨૬૫૮૭૮૪૪

આ ઉપરાંત આપના નજીકના પુસ્તકવિકેતાનો સંપર્ક કરો.

સત્ત્યનિષ્ઠા જ વાણીના સામર્થ્યનો મૂળ આધાર છે. સત્ત્યપૂર્ત વાણીમાંથી અમોઘવીર્ય પેદા થાય છે. જે વાચાશુદ્ધ હોય છે, તે વાચાસિદ્ધ થાય છે. મિતભાષણ સત્ત્યને મદદ કરનારું છે. આવું જ મૌન પણ એક સાધન છે. ઉત્તાવળા લોકો કટુવાણી બોલી નાખે છે. સાચા માણસોને જ્યારે અક્કલ નથી હોતી, ત્યારે તેઓ ઉત્તાવળા થઈ જાય છે અને પછી કટુવાણી બોલી નાખે છે. અક્કલ હોય, તો તેઓ મિત અને મધુર બોલે છે. નિશ્ચિતવાણી સત્ત્ય, મિત અને મધુર હોય છે. વાણી વિચારનું શરીર છે. વાણી અંદરની છે અને ભાષા બહારની છે. સારી ભાષામાં વાણીનું સમ્યક્ પ્રગટીકરણ થાય છે. વાણી મુજબ છે, શબ્દ તેનું સાધન છે.

- વિનોભા

વ્યાકરણ બહુ સખ્ત હતું માટે સંસ્કૃત મરી ગઈ અને વ્યાકરણ લૂઝ હતું માટે અંગ્રેજી ભાષા હોંગકોંગ અને કેનબેરાથી કેપટાઉન અને લોસએન્જેલસ સુધી ફેલાઈ ગઈ. ગુજરાતી ભાષાએ જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોલચાલના વિશ્વાળ ફલક પર આવતું હોય તો વ્યાકરણને લરીલું બનાવતું પડશે, નવા શબ્દો સરેઆમ સ્વીકારી લેવા પડશે. ગુજરાતી એ જ માર્ગ ઉપર છે. પણ શબ્દોનું બાહુલ્ય જરૂરી છે.

- ચન્દ્રકાન્ત બક્ષી

કોઈ સાહિત્યકારનો શબ્દ ક્યારે અને કોને સ્પર્શી જાય એ કળાવું મુશ્કેલ છે. આવું બને ત્યારે સાહિત્યકારની જવાબદારી કેટલી મોટી છે તેનો પણ ખ્યાલ આવે છે.

- ગુણવંત શાહ

વિદ્યામાં કામવિનુ જેવા ગુણો રહેતા હોય છે. વિદ્યા વિપરીત સમયમાં પણ ફળ પ્રાપ્ત કરાવે છે. વિદ્યા ગુપ્તધન કહેવાય.

- સ્વામી સચ્ચિદાનંદ

લેખન અને વાચન બને એકાન્તમાં થતી અંતર્મુખી પ્રવૃત્તિ છે. તમારા લખાણમાં ઊંડાણ હોય, મૌલિકતા હોય, એ કંપાંક છયાતું હોય તો મરજીવાસાથી એ શોધી લેવાના. લેખનનું સુખ એ છે કે તેમાં પ્રવચનની જેમ મગતરાંનો સીધો સામનો કરવો પડતો નથી. માત્ર પરમાત્માની આંખોમાં આંખો મેળવીને અભિવ્યક્તિ કરી શકાય છે.

- ડૉ. સર્વેશ પ્ર. વોરા

: સ્થાનસમર્પિત :

ડૉ. અરુણ જે. કક્કડ

એસોસિએટ પ્રોફેસર, હેડ ઓફ ગુજરાતી ડિપાર્ટમેન્ટ, દેવમણિ કોલેજ,  
વિસાવદર

## કવિ શ્રી સુન્દરમૂના નવા કાવ્યસંગ્રહો

૧. પલ્લવિતા	૧૮૮૫	૮૩૪૬	રૂ. ૧૬૦
૨. મહાનંદ	૧૮૮૫	૭૧૯૮૩	રૂ. ૮૦
૩. પ્રભુ-પદ	૧૮૮૭	૧૩૪૪૧	રૂ. ૨૨૫
૪. અગમ નિગમા	૧૮૮૭	૧૧૨૮૨	રૂ. ૧૫૦
૫. પ્રિયાંકા	૧૮૮૭	૧૧૩૬૭	રૂ. ૧૫૦
૬. નિત્યશ્લોક	૧૮૮૭	૧૨૧૮૮	રૂ. ૧૦૦
૭. નયા પૈસા	૧૮૮૮	૧૩૩૩	રૂ. ૧૭૫
૮. વરદા	૧૮૮૮	૧૬૪૨૮	રૂ. ૨૫૦
૯. ચક્કૂત	૧૮૮૮	૮૨૪૫૮	રૂ. ૧૨૫
૧૦. લોકલીલા	૨૦૦૦	૧૩૨૫૨	રૂ. ૧૦૦
૧૧. દક્ષિણા-૧	૨૦૦૨	૧૭૩૨૩	રૂ. ૫૦
૧૨. મનની મર્મર	૨૦૦૩	૧૦૪૩૮૭	રૂ. ૫૦
૧૩. ધ્રુવયાત્રા	૨૦૦૩	૧૨૩૪૫	રૂ. ૫૦
૧૪. ધ્રુવચિત્રા	૨૦૦૪	૧૭૨૭૪	રૂ. ૫૦
૧૫. ધ્રુવપદે	૨૦૦૪	૧૧૨૫૩	રૂ. ૫૦
૧૬. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૧	૨૦૦૪	૧૬૩૨૦	રૂ. ૨૦૦
૧૭. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૨	૨૦૦૪	૧૬૩૭૦	રૂ. ૨૦૦
૧૮. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૩	૨૦૦૬	૩૨૩૧૭	રૂ. ૨૫૦
૧૯. મંગળા-માંગલિકા	૨૦૦૭	૨૮૨૩૮	રૂ. ૧૫૦
૨૦. તું ક્યાં... હું ક્યાં ! ?	૨૦૦૮	૨૮૩૦૪	રૂ. ૨૫૦
૨૧. સ્વાગતમૂર્તિ ગીતવાહીને	૨૦૦૮	૧૬૨૦૭	રૂ. ૧૫૦
૨૨. 'સાવિત્રી'ના કાવ્યખંડો	૧૮૮૫	૨૪૪૭૩	રૂ. ૩૦૦
(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી, મૂળ અંગેજ સાથે.)			
૨૩. દક્ષિણા-૨	૨૦૦૨	૧૮૬૭૬	રૂ. ૫૦
(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી, મૂળ અંગેજ સાથે.)			

### આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

૧. ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગાઈમ્સ ઓફ ઇન્ડિયા પાઇલ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
૨. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧

## આપણાં સુખ-દુઃખ તુલનાનાં !

વિચાર કરતાં એમ લાગે કે આ તુલનાશક્તિની તો કેવી ખૂબી છે !

મનમાં એક વિચાર ચાલતો હતો, મોં મલકાંતું હતું. પોતાની જાતને મોટી સમજતો હતો, સુખી માનતો હતો. અચાનક જ કંઈ યાદ આવ્યું; તેની સાથે સરખામણી થવી શરૂ થઈ. મોં પડી ગયું ! સુખ રાખ થઈ ઉડી ગયું. દુઃખના વિચારોથી મન હવે કડવું થઈ ગયું. મનમાં પીડા ઉપારી. અજંપો થયો. દેહમાં વેદના થઈ આવી.... એવામાં બીજું કંઈ યાદ આવ્યું. કોઈકે આવી વધુ દુઃખી માણસની વાત કરી. એ સાંભળી મનને સારું લાગ્યું ! પેલી વેદના ઓસરવા લાગી.

શું છે આ ? તુલનાની આ તે કેવી તાકાત ?

મેળામાં મહાલવા એક માણસ જતો હતો. મસ્તીભરી ચાલ હતી અને ગળામણી ગીતોના સૂર રેલાતા હતા. એવામાં રસ્તે ઉત્તાવળે ચાલતા માણસોના પગ પર નજર પડી. અનેક નર-નારીને એ જાત જાતનાં પગરખાં પહેરીને જતાં જોયાં. રે નસીબ ! મસ્તીનાં ગીતો વરાળ થઈ ઉડી ગયાં ! હાય રે ! મારા પગમાં કંઈ નહીં ? હું ઉઘાડપગો ! અટકી ગયો. મોળો પડી ગયો. દુઃખી દુઃખી થઈ ગયો ! આગળ વધતાં, ચકડોળ પાસે એક ઠેલાણગાડીમાં સૂતેલો માણસ જોયો. આને તો પગ જ ન હતા ! તેને જોયો અને થયું : હાશ ! મને પગ તો છે ! મલકાયો. મનને ઘેરી વળેલો વિષાદ દૂર થયો.

આપણો, આપણાં સુખ-દુઃખને કશીયે સરખામણી વિના તેના સ્વરૂપને પામીએ અને સ્વીકારીએ તો કેવું સારું ? જ્યારે તુલના કરીએ છીએ ત્યારે જ ઉપાયિ આવે છે ! આમ, આપણાં સુખ-દુઃખ વાસ્તવિક છે જ નહીં. કશી તુલના વિના જ જો સુખ-દુઃખનો વિચાર કરીએ તો કેવું સારું. અરે ! આપણો કોઈને સારા કે ખોટા કહીએ છીએ એ પણ અન્યની સરખામણીએ જ ને ?

હવે, તુલનાના કશા વળગણ વિના વિચારવાની ટેવ પાડવા જેવી છે.

તુલના બધે ખપની નથી.

(પાઠશાળા)

- પ્રધુભનસ્કુરિ

સ્થાનસમર્પિત

## વસન્ત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર

અમદાવાદ

## ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે

આપણે કાંઈ ને કાંઈ પુરુષાર્થ તો રોજ કરતા જ રહીએ છીએ, પણ એ પુરુષાર્થની સફળતાની આધારશિલા છે : ધ્યેયની સ્પષ્ટતા.

આપણું ધ્યેય સ્પષ્ટ હોય તો જ, તેને સામે રાખીને કરેલી ગતિ સાર્થક બને છે; એ ગતિ પ્રગતિમાં રૂપાંતર પામે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તે પછી, તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. આ સરળ નથી. તેમાં વિધન આવે તોપણ તે ધ્યેયનો વિકલ્પ ન સ્વીકારવો. ધ્યેયપ્રાપ્તિની તીવ્રતા એ વિધનોને વિભેરી નાએ છે; ઓંણી જવાનું બળ આપે છે.

માટે, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી અવિરામપણે મંડચા રહેવું તે સિદ્ધિની પૂર્વશરત છે.

ગામ જવા નીકળ્યા, પણ થોડું ચાલીને જો બીજી દિશાના ગામે જવા વિચાર્યુ, એટલે વિધન શરૂ ! તેથી ધ્યેયની સ્પષ્ટતાની જેમ નિશ્ચલતા પણ તેટલી જ જરૂરી છે. તેમાં ચંચળતા ન ચાલે. નિર્ણય વેતાં પહેલાં ‘આ કે તે’ વિકલ્પ ભલે શોધ્યા કરીએ – એ ચાલે. પણ પછી નહીં.

તે નિર્ણય પછી તબક્કો ગતિનો આવે છે. ગતિ જ પ્રગતિનું રૂપ લે છે અને ધાર્યા ગામ અને દામ પહોંચાય છે. માત્ર ચાલવાથી ગામ નથી પહોંચાતું, પણ જે ગામ જવું છે તે ગામની દિશામાં ચાલવાથી તે ગામ પહોંચાય છે – જરૂર પહોંચાય છે.

ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે.

(પાઠશાળા)

– પ્રદ્યુમનસ્કૃતિ

: સ્થાનસમર્પિત :

**નિમેષભાઈ ડગલી**

**અમ. બી. ટ્રેડિશનલ પ્રિન્ટસ પ્રા. લિમિટેડ**

ઉ/એ, અલકાપુરી સોસાયટી, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે,  
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન : ૦૨૬૦૬૬૫૫



fevistik

25%  
extra\*

₹25/-  
only



No Chip Chip.  
No Jhik Jhik.

\*3g + 2g FREE